



**પ્રત્યક્ષીય ■**

સજજ અભ્યાસીઓનું એક આધારભૂત સંપાદન ઉ

**સમીક્ષા ■**

એકાન્તમાં ઊડતાં નક્ષત્રો (કવિતા : રાધેશયામ શર્મા) રમણીક સોમેશ્વર ૭  
મુક્તિવૃત્તાંત (આત્મકથન : હિમાંશી શેલત) બિન્દુ ભં ૧૦  
વડફળિયું (આત્મકથન : મણિલાલ રાનવેરિયા) ચંદુ મહેરિયા ૧૫  
પારસી પ્રકાશ (સંદર્ભ : બહુમનજી પટેલ) દીપક મહેતા ૨૦

**અવલોકન ■**

બંધ બારણાં (ઘનશયામ દેસાઈ), રોમાંચક વિજ્ઞાનકથાઓ (રવીન્દ્ર અંધારિયા),  
જિસીની રૂપકક્થાઓ(માવજી સાવલા), પંદરમું રતન (કલ્યાન દેસાઈ),  
અદશ્ય પાત્રો(હરેશ ધોળકિયા), બહુરંગી(સંપા. સ્વાતિ મેઢ), જિંદગી  
ના મિલેગી દોબારા(રોહિત શાહ), ગુજરાતી બાલવાર્તા(ઈશ્વર પરમાર),  
વહીવટની વાતો (કુવીનચંદ્ર યાણીક) – રમણ સોની ૨૬

**વરેણ્ય ■**

કાવ્યની શક્તિ (વિવેચન : રા. વિ. પાર્ટક) – ચન્દ્રકાન્ત ઠેપીવાળા ૩૨

**ગ્રંથ-ગોષ્ઠી ■** ધરીમેમ્બર વિવેજ(અમ.શ્રીનિવાસ); દીર્ઘન(રુક્મિણી શ્રીનિવાસ) – જ્યંત મેઘાણી ૩૭

**પ્રસંગવિશેષ ■**

વાર્તા-અનુવાદ શિબિર (અહેવાલ) – નીના ભાવનગરી ૪૧

**પત્રચર્ચા ■**

– હેમન્ત દવે, હર્ષવદન ત્રિવેદી ૪૪

**સામયિક લેખ સૂચિ : ૨૦૧૫ ■** ‘નાટક : સમીક્ષા’ થી ‘હાર્યસાહિત્ય : સમીક્ષા’ – કિશોર વ્યાસ ૫૦

**પરિચયમિતાક્ષરી ■**

પ્રાપ્ત પુસ્તકોની પરિચયનોંધ – સંપાદક ૫૫

**આ અંકના લેખકો ■**

લેખક-પરિચય ૬



**PRATYAKSHA**

*Periodical Registration No. RNI New Delhi, 54887/98*

**ISSN 2278-9081**

પ્રકાશક અને મુદ્દક : શારદા સોની ૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂનો પાદરા રોડ,

વડોદરા ૩૬૦૦૦૭ ફોન : ૦૨૬૪-૨૩૫૭૭૧૭

મુદ્દણ-અંકન : મહેશ ચાવડા, હિયા અક્ષરાંકન, વાસણા(બો.), તા. બોરસંદ, મો. ૮૮૦૮૯૦૦૧૨૭

મુદ્દણસ્થાન : મધુ પ્રિન્ટરી, કારેતીબાગ, ગુજરાત સમાચાર સામે, વડોદરા ૧૮ ફોન : ૦૨૬૪-૨૪૬૧૨૪૪

**સભ્યપદ વર્ષિક રૂ. ૩૫૦. વિદેશમાં ડોલર ૩૦, પાઉંડ ૨૦. શુલેચ્છક રૂ. ૩૦૦૦**

સભ્યપદની રકમ હાથોડાથ, મનીઓર્ડર, ડીડી કે મલ્ટીસિટી ચેકથી મોકલી શકાશે. ચેક/પ્રાફ્ટ  
**'શારદા સોનીપ્રકાશક પ્રત્યક્ષ'** એ.નામે લખવા વિનંતી; માત્ર **પ્રત્યક્ષ** ન લખતું મનીઓર્ડર મોકલનારે સંદેશાની  
જગાએ પૂરું નામ-સરનામું અવશ્ય લખતું એ સિવાય રકમ ગેરવલે કે અન્ય નામે જવા સંભવ છે.

સભ્યપદની રકમ મોકલવાનું સરનામું : શારદા સોની/ રમણ સોની ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા,  
જૂનો પાદરા રોડ, વડોદરા-૩૬૦ ૦૦૭

●

પ્રત્યક્ષ વર્ષમાં ચાર વાર : માર્ચ, જૂન, સપેન્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે - પ્રગટ થાય છે.

અંક ન મળ્યાની ફરિયાદ ૧૫ દિવસની અંદર કરવી. અંક સિલકમાં હશે તો જરૂર મોકલાશે.

●

**સંપાદકીય સંપર્ક :**

રમણ સોની, સંપાદક, પ્રત્યક્ષ ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂનો પાદરા રોડ,

વડોદરા-૩૬૦ ૦૦૭

ફોન : ૦૨૬૫-૨૩૫૭૧૮૭, ૦૯૨૨૮૨૧૫૨૭૫

**email : ramansoni46@gmail.com**

પ્રત્યક્ષમાં પ્રગટ થતાં લખાણોમાંના લેખકોના અભિપ્રાયો સાથે સંપાદક/પ્રકાશકની સંમતિ-અસંમતિ અપ્રસ્તુત છે.

## મુલ્યકીય

### સજ્જ અભ્યાસીઓનું એક આધારભૂત સંપાદન

સર્જનાત્મક કૃતિઓનાં ચયનો અને સંપાદનો તો પુષ્ટ પ્રમાણમાં થતાં હોય છે, એમાંનાં કેટલાંક શ્રમ-સૂઝપૂર્વકનાં, ઉપયોગો અને સંપાદનના ઉત્તમ નમૂનારૂપ પણ હોય છે. પરંતુ કોઈ એક ઉત્તમ વિવેચકના અનેક ગ્રંથોમાંથી કોઈ ખાસ દસ્તિપૂર્વક પસંદ કરેલા લેખોનાં સંપાદનો બહુ જ ઓછા પ્રમાણમાં – કહો કે ન-જેવાં – થતાં હોય છે. ખરેખર તો, આપણી સાહિત્ય-વિદ્યા-પરંપરામાં આવાં સંપાદનોનું મોટું મૂલ્ય હોય છે – સાહિત્યના વિદ્યાર્થીઓથી લઈને સંશોધકો સુધીનાને ઉપયોગી થાય એવું એનું ફલક હોય છે. અભ્યાસી સાહિત્યરસિકોને પણ આવી સંપાદિત સંચિત સામગ્રી – એ વિવેચકના કાર્યના અર્કડુપ લેખો – એક સાથે મળે એનો લાભ થતો હોય છે.

પરંતુ આ પ્રકારનાં ચયન-સંપાદનોનું કામ ઘણું અધનું હોય છે. વળી, ‘—ના ઉત્તમ વિવેચનલેખો’ એ પ્રકારનું માત્ર મન-ગમતું ચયન કરવાને બદલે વિશેષ દસ્તિપૂર્વકનું સંપાદિત ચયન કરવાનું હોય ત્યારે તો સંપાદક અધિકારી અભ્યાસી હોય એ પણ જરૂરી બલકે અનિવાર્ય બની જાય છે.

હેમન્ત દેવ અને હર્ષવદન ત્રિવેદીએ ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનગ્રંથોમાંના સાહિત્ય-સિદ્ધાંત-વિચારને લગતા લેખોમાંથી કરેલું સંપાદન ‘આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર’ (પાર્શ્વ પલ્બિકેશન, અમદાવાદ, ૨૦૧૬) એક નમૂનારૂપ સંપાદન છે.

આ ગ્રંથનું બાબ્ય પરિચ્છુપ, એનો નકશો સંપાદકોની સજ્જતાનો ધોતક છે. શા માટે ને કેવી રીતે આ સંપાદન કર્યું એનું નિવેદન; ચન્દ્રકાન્ત ટોપીવાળાની સિદ્ધાંતવિચારણાના દિશા-ગતિ બતાવતો અભ્યાસવેખ; પસંદ કરેલા લેખોની વિષયો/સિદ્ધાંતપ્રવાહો અનુસારની વિભાજિત ગોઠવણી; પરિશિષ્ટોમાં – ટોપીવાળાની વિચારણામાં ઉત્લેખ પામેલા યુરોપના વિદ્ધાનોનો ટૂંકો પરિચય આપતી વ્યક્તિનામ સૂચિ, ટોપીવાળાના વિવેચનગ્રંથોની પ્રકાશન-સમયાનુસારી સૂચિ, આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચારનો પરિચય આપતા ગ્રંથોની સૂચિ, શબ્દસૂચિ અને છેલ્દે, સંચિત લેખોના પૂર્વપ્રકાશનોની વિગત – એવી આવશ્યક બાબતોનો સમાવેશ કરતો આ ગ્રંથ અભ્યાસીઓ-સંશોધકોને ઉપયોગી બનતી તથા એમનો રસ્તો ચોખ્યો રાખતી શાસ્ત્રીયતાનો નિર્દેશક બન્યો છે.

સંપાદકોનું નિવેદન એ ખરેખર તો સંપાદિતગ્રંથની ચાવીરૂપ લખાણ હોય છે – હોવું જોઈએ. આ સંપાદકોએ ખૂબ મથામણપૂર્વક અને પોતાની અભ્યાસશીલતાને પ્રયોજને લેખોનું ચયન કર્યું છે ને એને વિષય-વિભાજનમાં રજૂ કર્યું છે. ત્યાંલા વિભાગના ૧૭ લેખોને

ઉપ-શીર્ષક આપવાનું, સરતચુકથી જ રહી ગયું હશે?) એ ઉપરાંત એમણે મૂળ લેખોની કેટલીક બાબતોમાં ફેરફાર (એડિટિંગ) કરી લીધા છે – સંપાદકો કહે છે એમ ટોપીવાળાની ‘પૂર્વસંમતિ’થી કર્યા છે. આ ફેરફારોથી લેખનની એકવાક્યતા લાવવામાં ને લેખોને વધુ પ્રાસાદિક કરવામાં ખરેખર જ મદદ મળી છે. મોઢેથી આવેલો મૂડીવાદને બદલે ‘પરવર્તી મૂડીવાદ’ કે ‘માતૃદેશો’ને ‘સામાજિકવાદી દેશો’ એમ ફેરવી લેવામાં; લેખોમાં જ ક્યાંક ક્લિષ્ટ કે તરજૂમિયા રહી ગયેલી લાગતી વાક્યરચનાઓ સુધારી લેવામાં; ગુજરાતીમાં જાણીતા ને સ્થિર થયેલા પારિમાણિક શબ્દો પછી ટોપીવાળાને ક્રોંસમાં અંગ્રેજ પર્યાયો પણ મૂક્યા છે તે કાઢી નાખવામાં – સંપાદકોએ વિશદ્ધતાના સંદર્ભે, બહુ યોગ્ય નિર્જરીયો લીધા છે. (‘સાક્ષીભાસ્ય’ની સમીક્ષા કરેલી ત્યારે મેં લખેલું કે, ટોપીવાળાના વિવેચનદેખોમાં ઘણીવાર તો આ ‘પર્યાય-દ્વિભાસિકતાની જરૂર વરસી’ છે [...] એટલે એમ લાગે છે કે એમણે ક્રોંસમાંના અંગ્રેજ શબ્દો ખસેડી લીધા હોત તો રાહત થાત’ [જુઓ, પરબ, માર્ચ, ૨૦૧૩માં તથા ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’, ૨૦૧૩માં એ લેખ]. સંપાદકોના આ નિર્જરીયથી મને યોગ્ય સમર્થન મળ્યાનો આનંદ થયો.)

પરંતુ સંપાદકોની એક બાબત સાથે સંમત થવું મુશ્કેલ છે. પાશ્ચાત્ય લેખકોનાં નામના ‘સાચા ઉચ્ચારો અને લિખ્યાતરો’ના સંદર્ભે એમણે, ટોપીવાળાના લેખોમાં આવતાં ગુજરાતી લિખ્યાતરોને બધી જ ફેરવીને એમનાં નવાં લિખ્યાતરો મૂક્યાં છે. એમાં એક-બે આત્યંતિક દાખલા પણ છે. (એમણે અલબત્ત એનો નિર્દેશ પણ કર્યો જ છે) જેમ કે ‘ફોર્ટિડને બદલે ‘ફોર્ટ’ અને ‘નિત્યો’ને બદલે ‘નીચ.’ હવે, રોલાં બાર્થ/બાર્ટ કે વેઠન/વેન બૂધ જેવાં લિખ્યાતરણોનો ન જેવો ભેદ તો પકડાય-સમજાય પણ આપડી આખી લેખનપરંપરામાં ફોર્ટ અને નિત્યો નામો એટલાં પ્રચલિત છે કે આ સૂચવેલાં – સૂચવેલાં જ નહીં, મૂળ લેખોમાં ફેરવી દીધેલાં – લિખ્યાતરણો હંમેશાં ક્રોંસમાં રોમન લિખ્યાતરણ અને નોંધો મૂક્યા સિવાય પકડાવાનાં નહીં. નીચ. એ નીચ્યાએ એમ ઉચ્ચારવાનું છે એ પણ એમણે દરેક વખતે બતાવવું પડવાનું, અને એથી, જે ‘વિશદ્ધતા’નો (સાચો) આગ્રહ સંપાદકોએ સેવ્યો છે એમાં જ બ્યવધાન આવવાનું. મને બીજી વાત એ વિચારવા જેવી લાગે છે કે ડ ~ ટ એ ઘોષત્વ ~ અઘોષત્વના ફલક પર – જેમ બંગાળી અ એ ગુજરાતી અન્યોના ફલક પર – વિસ્તરેલાં, જુદી જુદી ભાષાના ભાષકોના કાન પર એના (ડ ~ ટના કે અન્યોના) કોઈપણ બિંદુએ છિલાતાં ઉચ્ચારણો છે. તો એટલી હેરેફર શું સ્વીકાર્ય ન જ બને? (વધુ સ્પષ્ટપણે તો આ વિશે ધ્વનિવિજ્ઞાનના અભ્યાસીઓ કહી શકે.) એવું જ, એક જગાએ સંપાદકોએ Franzનું ઉચ્ચારણ – જ ને બદલે – ત્સ રૂપે નોંધું છે એમાં પણ સ્પર્શ/સ્પર્શસંઘર્ષના સંવિફલકમાં આવી જાય એવું ઉચ્ચારણ છે. જો સ્થળનામોનાં ઉચ્ચારણો ભારતીય અંગ્રેજ, બ્રિટિશ અંગ્રેજ, અમેરિકન અંગ્રેજમાં જુદાં જુદાં હોય છે તો આપણે, લેખકનામનાં ઉચ્ચારણો સુધારવામાં, ઓછામાં ઓછું, આત્યંતિક સ્થિતિઓનો તો પરિષાર કરીએ જ – એ મને પોતાને આવશ્યક લાગે છે, સંપાદકોએ ફેરફાર ન સ્વીકારનાર માટે ‘જડભરત’ શબ્દ વાપર્યો છે એ હું જાણતો હોવા છતાં.

બીજું બધું જવા દઈએ તો, ટોપીવાળાના લેખોમાં એમણે લેખકનામોનો પાઠ મૂળ જ રાખ્યો હોત ને પરિશિષ્ટમાં નૂતન ઉચ્ચારણોની એક તુલનાત્મક સૂચિ મૂકી હોત તો યોગ્ય થાત એમ પણ મને લાગે છે.

‘સિદ્ધાંતવિશ્વનો યાત્રિક (ચન્દ્રકાન્ત ટોપીવાળાના સિદ્ધાંતવિચાર વિશે એક નોંધ)’

ટોપીવાળાની સિદ્ધાન્તવિચારની દિશા અને ગતિ બતાવતો એક અભ્યાસપૂર્ણ ને માર્ગદર્શક લેખ છે. સંપાદકો બરાબર કહે છે કે, ટોપીવાળાના ‘વિવેચન વિશેનો આ અભ્યાસલેખ’ નથી, એમની સૈદ્ધાન્તિક વિચારણા અંગેના સંકેતો બતાવતો લેખ છે. પણ એ સંકેતોથી એક સ્પષ્ટ નકશો જરૂર ઉપસ્થો છે – ટોપીવાળાની સિદ્ધાન્તવિચારની પ્રક્રિયા, અનાં વ્યાપ અને વિરોધો, સિદ્ધાન્ત સાથે પ્રત્યક્ષનું સતત સંધાન અને, ખાસ તો, એમની ‘એક સુયોગ્ય પ્રતિમાનની શોધયાત્રા’ – અહીં બરાબર અંકિત થયાં છે.

બે અપેક્ષાઓ, તેમ છતાં, રહે છે. અહીં પસંદ કરેલા લેખો વિશે ને એમણે નિર્દેશલા વિભાગો વિશે પણ અહીં વાત થવી જોઈતી હતી – ને તો એ આ સંપાદિત લેખોની એક યોગ્ય ભૂમિકા પણ થઈ હોત. ઘણા લેખોની નીચે જે પાદ-નોંધો છે એ બધી સંપાદકોએ કરેલી છે ને એમાં ક્યાંક વિચાર કે વિચારક વિદ્ધાન અંગેની ભૂમિકારૂપ નોંધ જેવું પણ છે. એ રીતે પ્રત્યેક લેખને નહીં તો વિભાગને આરંભે એક ટૂંકી પ્રવેશક નોંધ પણ થઈ શકી હોત.

બીજું, સંપાદકોએ નોંધ્યું છે કે ઉર્વા તેવારે એમના શોધગ્રંથમાં ટોપીવાળાએ રેચેલી હજાર જેટલી ગુજરાતી સંશાઓની યાદી આપી છે. ટોપીવાળાએ કરેલા આ પર્યાય-ઘડતરની બાબત એટલી નોંધપાત્ર ને રસપ્રદ પણ છે કે આ વિદ્ધાં સંપાદકોએ, એ બધીની નહીં તો કેટલીક સંશાઓની તુલનાદર્શી ને પરિચયાત્મક સૂચિ આ ગ્રંથમાં પણ આપી હોત તો એ ઉપયોગી થાત. પરિશિષ્ટમાં પાશ્ચાત્ય વિવેચકોની એમણે કરેલી કેવળ સૂચિમાં પણ આ સંપાદકોએ લેખકનું રોમન લિપિમાં નામ, એનું ગુજરાતી લિપિંતર, તે તે વિદ્ધાનનો જીવનકાળ, એમના મુખ્ય કામ અને ગ્રંથનો નિર્દેશ એવી ખૂબ ઉપયોગી અને અભ્યાસીઓ જ કરી શકે એવી પરિચય-નોંધો પણ આપી છે. એથી પણ પેલી પરિચય-તુલનામૂલક સંશાસૂચિની અપેક્ષા વધી જાય છે.

ઘણા લેખોમાં, આવશ્યક ફૂટનોટ્સની સાથે જ કેટલાક બહુ જરૂરી પ્રતિનિર્દેશો આપીને પણ સંપાદકોએ અભ્યાસનિષ્ઠા અને શાસ્ત્રનિષ્ઠા દાખવી છે. આ નાની લાગતી બાબત પણ ઘણી મહત્વની ઠરી છે.

પરંતુ, આટલી સજ્જતા ને આવી ચીવટ દાખવનારા આ સંપાદકોએ આ ગ્રંથમાંના અસહય લાગે એવા કેટલાક મુદ્દણદોષો માટે કશું જ કર્યું નથી એ આશ્ર્યકારક જ નહીં, એક કમનસીબ ઘટના છે. અનુસ્વારોની ગેરહાજરી, હસ્ત-દીર્ઘનાં થોડાંક મુદ્દણ-અનવધાનો, વગરેની વાત ન કરીએ પણ ‘વિવેચન માળખું’, ‘વિવેચન વિચાર’, ‘સંસ્કૃતિ મૂલક’ એવાં પદો છૂટાં રહી જવાની ભૂલો નહોતી રહી જવી જોઈતી. જીક દેરિદા / એક દેરિદા એમ બંને જોડણી બે-ત્રણ જગ્યાએ રહી ગઈ છે એ પણ આશ્ર્ય.

સૌથી મોટી તકલીફ – જે નહોતી જ રહી જવી જોઈતી તે એ છે કે ટોપીવાળાનાં કેટલાંક પુસ્તકોનાં નામ ખોટાં છાયાં છે. ‘પ્રતિભાષાનું કવચ’ને બદલે ‘પ્રતિભાષાનું કવન’ (૫૦ ૩૬ ૩) લખાય એ તો ટીક, પણ ‘અપરિચિત અ અપરિચિત બ’ એ ‘અપરિચિત અ અને પરિચિત બ’ (૫૦ ૧૨) તથા ‘અપરિચિત અ અને અપરિચિત બ’ (૧૬) છાયાં એ ટીક નહીં. ચન્દ્રકાન્ત ટોપીવાળાનાં બે પુસ્તકોનાં નામ ઘણી જગ્યાએ ખોટાં જ લખાતાં રહ્યાં છે. ‘સહવર્તી-પરિવર્તી’ અને ‘સાક્ષીભાસ્ય’ એ બે નામો સાચા રૂપે ભાગ્યે જ ઉદ્ઘૃત થાય છે. અહીં – આવા મહત્વના પુસ્તકમાં પણ – ‘સહવર્તી-પરવર્તી’ (૧૬), સહવર્તી/પરવર્તી (૩૫૭) અને વળી સહવર્તી કમવર્તી

(૫૦ ૩૮૨, તણા વાર); તથા સાક્ષીભાષ્ય (૩૮૧, ૩૮૩ : પાંચેક વાર) – એમ છપાય એ બજુ વસમું લાગે છે. લેખકો-સંપાદકો એમ કહેતા હોય કે મુદ્રણદોષો એ પ્રેસની જવાબદારી છે તો એ ખોટી વાત છે. આ સંપાદકો એવું કહે એવા નથી છતાં પરિણામ તો ક્ષોભજનક જ આવ્યું! પોતાના પુસ્તકનાં છેલ્લાં પૂર્ફ કણજીથી જોવાં એ લેખક-સંપાદકની જવાબદારી ગણાય.

સંસ્કૃતના મોટા વિદ્ધાન પીઠ વીઠ કાણોને એક પ્રતિષ્ઠિત સામયિક તરફથી લેખ માટે નિમંત્રણ આવેલું. એ માટે દ્વિલગીરી દર્શાવતાં એમણે કહેલું, ‘હમણાં હું મારા એક લાંબા પુસ્તકનાં પૂર્ફ જોઉં છું અત્યારે હું ઈનો છું ને મારે હવે કણજી રાખવી જોઈએ કે પુસ્તકમાં કોઈ મુદ્રણદોષ રહી ન જાય એટલે અત્યારે હું બીજું કોઈ જ કામ સ્વીકારી ન શકું.’ (‘એડિટર્સ ઓન એડિટિંગ’, નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા, નવી દિલ્હી, ૧૯૯૭-માંથી).

○

ઉપરની થોડીક ક્ષતિઓનો બચાવ કર્યા વિના પણ કહી શકાય એમ છે કે બે અભ્યાસીઓએ કરેલું આ સંપાદન ઘણું ઉત્તમ છે ને આપણી વિવેચન-સમૃદ્ધિમાં એક સારા ઉમેરારૂપ છે.

રમણપટ્ટાણી

### આ અંકના લેખકો

રમણીક સોમેશ્વર	સી-૨, સંસ્કૃત ટેનામેન્ટ્સ, સી. એચ. વિદ્યાલય સામે, અમીન પાર્ટી-લોટ પાસે, ગોત્રી, વડોદરા ૩૬૦ ૦૨૩ □ 9429342100
લિંદુ ભણ	એ-૧૧, નેમીશ્વર પાર્ક, તપોવન પાસે, અમિયાપુર, જિ. ગાંધીનગર ૩૮૨ ૪૨૪ □ 9723555993
ચંદુ મહેરિયા	નિરાંત, ૧૪૧૬/૧, સેક્ટર ૨-બી, ગાંધીનગર ૩૮૨ ૦૦૭ □ 9824680410
દીપક મહેતા	ફૂલરાણી સાહિત્ય સહવાસ, કેલકર માર્ગ, કલાનગર, બ્રાન્ડા(પૂર્વ), મુંબઈ ૪૦૦ ૦૫૧ □ 9821832270
રમણ સોની	૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂનો પાદરા રોડ, વડોદરા ૩૬૦ ૦૦૭ □ 9228215275
ચન્દ્રકાન્ત ટોપીવાળા	ડી-૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૧૫ □ 079 - 26301721
જયંત મેઘાણી	પ્રસાર, ૧૮૮૮ આતાભાઈ એવન્દૂ ભાવનગર ૩૬૪ ૦૦૨ □ 9898007130
નીના ભાવનગરી	૮૦૨ ફોરેમ પાર્ક એપાર્ટમેન્ટ્સ, અશોકનગર પાસે, અઠવા લાઈન્સ, સુરત ૩૮૫ ૦૦૧ □ 9825411175
કિશોર વ્યાસ	૬, મહેતા સોસાયટી, હાઈસ્કૂલ સામે, કાલોલ(અમદાવાદ) ૩૮૮ ૩૩૦ □ 9924735111

## સમીક્ષા

એકાન્તમાં ઉડેલાં નક્ષત્રો – રાધેશ્યામ શર્મા

રનાદે, અમદાવાદ, ૨૦૧૫.

વિશે

રમણીક સોમેશ્વર

### 'એકાન્તમાં ઉડેલાં નક્ષત્રો'નો ઉજાસ

'આકાશની ઉડયનલિપિ' આવેખનારા કવિ રાધેશ્યામ શર્મા હવે પોતાના 'એકાન્તમાં ઉડેલાં નક્ષત્રો'ને તરતાં મુકે છે. એ નક્ષત્રો જરમર જરમર જરમરતાં આવી પહોંચાં છે મારા આંગણામાં. ક્યારેક હું એને પલક ઝપક્યા વગર તો ક્યારેક ઝપકી ઝપકીને જોયા કરું છું. કોઈ મને આંજે તો કોઈ માંજે, કોઈ ઝબકે તો કોઈ ઝબૂક ઝબૂક થાય. કોઈ આકાશ વચ્ચે આકારો રચે તો કોઈ આકારો વચ્ચે રહેલા આકાશનું ગાણું ગાય – કાગળ પર કરી રીતે એની વાત મંડાય!

નક્ષત્રોનું તો પાણું એવું કે હોય નજર સામે જ છતાં હોય પહોંચની બહાર. તેથી જ કદાચ એ વધું આકર્ષે. તો આ દૂર છતાં સંનિકટ લાગતાં નક્ષત્રોને જોતો બેઠો છું ને મારા મનમાં રમવા લાગે છે એક બાઉલ ગીતની પંક્તિઓ.

આમાર પાંચિર જાત

આમાર હોઈત્યા ચલાર ભાઓ જાનિ ના

આપા દેર ઉડવા ચલાર ધાત

(અમારી તો ભાઈ, પંખીની જાત, ભોંય પર પગલાં માડી

ચાલવાનું અમને ન ફાવે, આકાશે ઉડવું અમારા માટે સહજ) – કવિ રાધેશ્યામ શર્માની આંતરચેતના ક્યાંક આ ગીતના ભાવજગત સાથે મને જોડાયેલી લાગી.

કાવ્યસંગ્રહના પ્રવેશકમાં જ કવિ કહે છે : "કવિતા કળા ભાષાપરક ઘટના હોવાથી તે મૂર્ત છે, દશ્ય છે, બાકી ભાવકના અનુભવમાં ઝબકતી વ્યંજના અમૂર્ત છે, અદશ્ય છે – આકાશની ઉડયનલિપિ સમી ઈન્ડ્રિયગ્રાવ્ય છતાં સેન્દ્રિયતાને અંડોળી જતી, વાસ્તવિક છતાં આત્મ-વાસ્તવની સ્વભિલ સરહદોને સ્પર્શી આવતી." કવિની આ વાતની પ્રતીતિ એમનાં કાવ્યોમાં સતત થતી રહે છે.

આ કાવ્યોમાં ક્યાંક આપણાને ગ્રત્યુતર શૂન્ય/ મહાકાશ પ્રસરેલું દેખાશે તો ક્યાંક 'સભરતા/શૂન્યનો પદ્યાદ્ય' – બની બની છલછલતી જણાશે. કવિની સર્જકચેતનાનું પગેરું દ્યાબતાં આપણે 'પહાડ' નામક કાવ્યની થોડી પંક્તિઓ મથુરાવી લઈએ. કોરો કાગળ લઈ કવિતા સાથે સંવાદ રચવાની મથુરાશ કરતા કવિ કઈ રીતે જોડાય છે કવિતાના શબ્દ સાથે? જુઓ –

"સભરતાના

સરોવરમાં

માનસ હંસો

અપૂર્વ

ધ્વનિ

વેરુ."

સભર થવાની પહેલી શરત છે ખાલી થવું. ખાલી થાય તે નવાં નવાં સ્પંદનોથી સભર બને. એ રીતે કવિનું ચિત્ત બન્યું છે. સભર સરોવર અને એમાં તરતા માનસ હંસો વેરે અપૂર્વ ધ્વનિ, નિત્ય નૂતન એટલે અપૂર્વ. એવા

પ્રાચી

અધ્યાત્મ ૨૦૧૫ ૭

આ ધ્વનિને વેરાતો જુઓ અને લહેરાતો સાંભળો. પછી આ ધ્વનિ જ -

"નોંતરે"

સર્જક

કવિને

રહસ્ય

મંજૂષા

ઉધાડવા"

કવિની આ રહસ્યમંજૂષાને ઉધાડતી આપણે જોઈએ.  
એ ઉધાડ સાથે ભાવકનો રહસ્યલોક પણ ખૂલતો-ખીલતો  
રહેશે. આ 'પહાડ' કાવ્યમાં સર્જનપ્રક્રિયા, સર્જક સામેના  
પડકારો ને મારગ વચ્ચે આવતા આસક્તિના અવરોધોની  
વાત કેવી સ-રસ રીતે મુકાઈ છે!

સર્જનની ક્ષણો એ આ કવિને મન - "કવિતાની  
પ્રક્રિયામાં વિચારોને નિર્વિચાર દિશામાં દોરી જવાનો  
સ્વાનુભવ છે." પોતાની કેફિયતમાં વધુમાં કવિ કહે છે,  
"અનિર્વાચ્ય અનુભૂતિ સાથે તત્કષણ પૂરતું તાદાત્મ્ય અને  
ભાષાકારમાં ઢાળવાની પ્રક્રિયામાં તાટસ્થ્ય પ્રત્યેક  
સર્જકચેતનામાં અવિનાભાવી સંબંધ જેવું તત્ત્વ છે." આવા  
તાદાત્મ્ય અને તાટસ્થ્ય સાથે કવિ સાવધાનીપૂર્વક પોતાની  
કવિતામાં અવનવા આકારો રચે છે પણ એની કોઈ બદ્ધ  
આકૃતિ રચાવા દેતા નથી. સર્જનક્ષણોનો આનંદ માણતા  
કવિ કહે છે:

"શબ્દ

શીતળ

એકાન્ત

કુવારા

ગુડતા

સ્કુલ્ટિંગોના"

આવા ઉડતા સ્કુલ્ટિંગોમાંથી નીપજતું આ દશ્ય જુઓ :

"અવકાશના કર્ણપટલ પર

પતંગિયું

ચોંટી ગયેલી પાંખને

ઉધેડવા

ઉધાનોને નોંતરે"

અવકાશનું કર્ણપટલ, પતંગિયાની ચોંટી ગયેલી પાંખ

અને ઉધાનો. કેવું અજાયબ સંયોજન! આ દશ્ય-શાબ્દ ચિત્ર  
ભાવકચેતનાને કેવું તો સ્પર્શી જાય છે! અને પછી લહેરાતાં  
ઉધાનોની સૌરભ આપણા શાસમાં મઘમધવા લાગે છે.

આવાં અનેકલિંગ દશ્યો એ રાધીશ્યામ શર્મણીની  
કવિતાનો વૈભવ છે. 'તડકો'માં ખાલીપણાના આટાપાટા  
વચ્ચે રમતા તડકાને જુઓ. અને આ 'કૂકા'માં  
લિમ્બોઈવર્ણો તડકો રાત પડતાંમાં જુઓ કેવું રૂપાંતર પામે  
છે! -

"ચાત

પડતાં

કિરણોના

કટકા

કાચના

તાગ

કૂકા

બની

ગગનમાં

ફેલાઈ

જાય છે."

આવું જ ઉધાડતી સવારનું ચિત્ર જોવા આપણે  
'સંગતિ' કાવ્ય વાંચવું જોઈએ. પણ ભાઈ, આ તો 'શૂન્યની/  
સોયમાંથી/નીકળેલા/રંગબેરંગ્લી/દોરા' - આ દોરાથી ગુંથાતી  
ભાત જોતો જોતો હું તો એના થોડા વેલબુંદા જ તમારી  
સામે મૂકું છું.

રાધીશ્યામ પ્રયોગધર્મી કવિ, આધુનિકતા અને  
રહસ્યાત્મકતા એમના સર્જનમાં સાથે સાથે ચાલે. એમના  
અછાંદસમાં પણ એક પ્રકારનો 'આત્મલક્ષી લય' વહેતો  
જાણાય. એમાં સહજરૂપે આવતા છાંદસ પ્રયોગો પણ ધ્યાન  
જેંચે - અહીં 'અપરંપાર', 'સીડીઓ' આદિમાં ચોપાઈનો  
રસળતો લય-પ્રયોગ જોજો. એમનું 'વિલય' કાવ્ય જાણો  
એમની અછાંદસના વિભાવનાની કાવ્ય-લહરી. રાધીશ્યામના  
અછાંદસમાં કાગળ પર કવિતાની જે આકૃતિ રચાય એ  
પણ વિલક્ષણ. એક એક ઈંટ ગોઠવી ચણતર કરતા હોય  
તેમ કવિ એક એક શબ્દ ગોઠવતા થાય. પણ પાછું બધું  
લવચિક. એમાં વાક્યવિન્યાસો કે સંદર્ભો જોડવાનું કામ કવિ  
ભાવક ઉપર છોડી દે. ક્યારોક વળી એકાધિક શબ્દોને

આમ ઊભી લીટીમાં ગોઠવી આકારો રચતા જાય. રસાનુભવ માટે ભાવ કે બાહ્યાંતર આકૃતિઓ ઉકેલવાની રહે.

કવિ અને કવિતા દોરેલા માર્ગે ન જાય, પણ એ જ્યાં જાય ત્યાં રસ્તા કળાતા રહે. જુઓ, આપણે અહીં એક કાવ્યનું શીર્ષક વાંચીએ છીએ. ‘બોંબ’. આપણું મન કશી કલ્યાણાઓ બાંધી તે પહેલાં જ કવિ તો આશ્રયજનક રીતે ચીખના ઉત્તાપ વર્ચે આપણાને લઈ જાય છે કોઈ નવંદ્પતીના શયનકક્ષમાં. અંધકારની મસ્ઝુજ વિશિકાઓમાં અનંગ રંગ રેલાય ત્યાં અચાનક નાઈટલોભ્મની સ્વિચ પર પંજો પડે અને... વિસ્ફોટ! આવા વિલક્ષણ વિસ્ફોટ રાધીશ્યામ શર્માની કવિતામાં થતા રહે. ‘ધંજા’માં આ પ્રકારે પ્રગટ થતા રતિ-સંકેતો સુજ્ઞ ભાવક પામી શકશે.

કવિતામાં આકાશી નક્ષત્રો સાથે ઊડાઉિડ કરનાર આ કવિ ક્યારેક ઉઘાડા પગે ધગધગતી ભૌય પર ઊભા રહીને એના ભડભડાટને ભાળે છે અને સંપ્રતના ભીંસભર્યા તનાવો અને વેદના-સંવેદનાને તન્મય તાટસ્થયથી કાવ્યરૂપ આપે છે. ‘ધડાકા’, ‘શૂળ’ આહિમાં વિકાસના વ્યામોહ સાથે વધતી સંવેદનશૂન્યતા, ‘સુગંધ’માં વિધવાઓની વેદના, ‘ગાડી-ગાડી-નુરશી’માં ધર્મસત્તા-રાજસત્તાના ચક્કવ્યુહો વર્ચે ભીંસાતા જનસામાન્યની મર્મભરી કથા-વ્યથા કે ‘એટલાસ’માં ગાંધીવધની ઘટનાનો સંકેત કરી સ્તબ્ધ સમય-સંદર્ભનું નિરૂપણા... – આ પ્રકારનાં કાવ્યોમાં માનવીય સંવેદના સાથે તારોતાર જોડાયેલા આ કવિનું એક જુદું રૂપ પામી શકાય છે.

આધુનિક ધારાના સર્જક તરીકે ઓળખાવાતા આ કવિનાં નગરકાંબો પણ વિશેષ રૂપે ધ્યાનાકર્ષક છે (જોકે આ કે તે વાદ કે તુલનાઓના સીમાડા કોઈ પણ સાચો સર્જક હુમેશા વળોટી જતો હોય છે). એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘અંસુ અને ચાંદરણું’ (૧૯૬૩)માં પ્રકાશિત એમના દીંઘકાવ્ય ‘હાંફિતાં સરધસો’ને ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ‘નગરકાંબોમાં લાંબાગાળા સુધી યાદ રહે એવું કાવ્ય’ એમ કહીને ઓળખાવેલું અને કહેલું કે આ કાવ્યમાં ‘અમદાવાદ શહેરને, શહેરનાં વરવાં દંશ્યોને, શહેરની ગંઢી અને ગોબરી છબીઓને ઝડપતા રાધીશ્યામને જોવા એ એક લહાવો છે’ – આ લહાવો રાધીશ્યામ અદ્યાપિર્યત આપત્તા

રહ્યા છે.

અહીં ‘દોટ’માં વાત છે એ જ અમદાવાદની સુકાઈ રહેલી સાબર, રિવર ફન્ટ પર આત્મહત્યાનાં પ્રેતો, આત્મશાળાના ફુવારા અને મંત્રમુખ મેદનીના જયદોષોમાં પ્રસરી છે કવિ રાધીશ્યામની મર્મવાળી. ‘અમદાવાદ ૧૯૮૮’ અને ‘અમદાવાદ-૨૦૧૦’માં ટ્રાફિક સિંગનલોની રેડ લાઈટોમાં પ્રસરતાં રક્તરંજિત દશ્યોનો દાહ ભાવક અનુભવશે. ‘ખરા બપોર’માં રાજકોટ, ‘ફૂટપ્રિન્ટ્સ’માં વડોદરા અને ‘હૂરતની મૂરત’માં સુરત – અનેકવિધ સંદર્ભો તરતા મૂકી આ નગરોના વિશેષ-વિલક્ષણ વ્યક્તિત્વની ઓળખ આપતાં આ કાંબ્યો રા. શ.નાં નગરકાંબોનું એક જુદું રૂપ છે.

૬૪ પૃષ્ઠો અને ૭૭ કાવ્યોમાં વૈવિધ્ય ખાસું, સાથે મૂકેલા પરિશીષણનાં પૃષ્ઠો પાછાં એના અનુમોદનમાં હાજર. કવિનું ઉપાદાન ભાષા, તો કવિ ભાષા અને માતૃભાષાની વાત પણ પાછા કવિતામાં કરે. માતૃભાષાનો મહિમા ગાતાં કહે :

‘પણ માતાની ભાષા

જહનની સાત કોઈ વાવમાં

જો ઉતરી

તો સદા

તરી રહે

શાશ્વતી ચેતનામાં...’

‘એક આત્મલક્ષી આલાપ : માતૃભાષાથી માતૃવંદના’

અને ‘અમર સંભાષા’માં વાત આવે માતૃભાષાની તો ‘ભુવાગીરી’ જેવા કાવ્યમાં પ્રદેશ-ભાષા-ભાવના ભેદોની વાત કરતાં વિલક્ષણ શૈલીમાં કવિ કહે :

‘ભાષાને/ભૂર ભૂતદા/વળગયાં છે/કે ભાષા/ભૂવો બની/ ધુણાવે કવિઓને’ – પણ કવિ તો પાછા એ ભાષા દ્વારા જ બધા લેદભાવ વળોટી અભેદમાં સ્થિર થવાનું તાકે અને કાવ્યાન્તે નક્ષત્રોની લિપિમાં કહે :

“આપણે તો આટલું જાઇઓ/ઘટકાશ-મહાકાશ વર્ચે/વાળ જેટલું ય/નેળિયું નથી.”

રાધીશ્યામ શર્માની કવિતા ધણીવાર અનેકવિધ સંદર્ભોને ઊંડણમાં લેતી ચાલે. એમાં ક્યારેક રામાયણ, મહાભારત કે જીતાના સંદર્ભો સાથે આદમ-દીવ, શીંગી-

ફરહાદ કે નોહાની નૌકાની વાત પણ એકી સાથે આવે તો ક્યારેક આલબેર કામૂ રિલ્કે આદિ સર્જકો પણ એમાં જોડાઈ જાય. અહીં કલ્પનો, પુરાકલ્પનોને ઉકેલવાની મથામણ કરવાને બદલે ભાવકે સંદર્ભોને જોડી જોડીને આફૂતિ રચવાની દિશામાં પ્રવૃત્ત થવું પડે.

‘અસ્ત્રથનું કથકલી’ વાંચો તો ગીતપાના પંદરમાં અધ્યાયમાં છંદોના પર્ણો ખેરવતું અસ્ત્રથ વૃક્ષ અનેક પ્રદેશોમાં ફેરવી ચૈતન્ય-લીલાપૂર્વક મૂર્દંગનાટે કથકલી કરતું પ્રત્યક્ષ થાય – ‘સમુદ્ર-કિનારે લયાર મારતો’ તમે કૃષ્ણ દ્વૈપાયન પાસેથી કામૂ પાસે ક્યારે પહોંચી જાવ તેની સરત ન રહે. ‘નારી બારી પણ ખરી?’ ‘પ્રશ્નય’, ‘સંકલ્પના’ આદિમાં પણ કવિની આ શાબ્દલીલા જોવા જેવી.

કવિ તો એવું કહે છે કે “પેલો/પુરાણ/પીપળો/સ્તબ્ધ/અવાક/બોલતો/કરવા/એક/કવિઓ/કેવળ/કલમ/ગીંચી/કરી/નીચેથી/તો/અવકાશમાં/અચાનક/પ્રકાશ/જળહળતો/જબૂક્યો.” (‘અસ્ત્રથનું કથકલી’)

કવિ રાધેશ્યમે કલમ ઊંચાને અવાકને વાડી આપવા કે અમૂર્તને મૂર્ત કરવા પોતાના એકાન્તમાં સ્વાનતઃ સુખાય જે નક્ષત્રો તરતં મૂક્યાં એના જળહળતા જબકારની વાત આમ મેં આવડી એવી કહી. સંભવ છે એમાં ઘણું અકળ, અવાક કે અવાચ્ય – વણઉકલ્યું રહી પણ ગયું હોય.

લેખિકાની જેન્યૂઈન આત્મકથા અવતરવી જોઈએ! જાન્યુઆરી ૨૦૧૬માં મારી એ આશા ‘મુક્તિવૃત્તાંત’ રૂપે મૂર્ત થાય છે એનો આનંદ છે. એક નિર્ભિક-નિખાલસ, કલાત્મક સભાનાતા સાથેનો મર્મસ્યશર્મી અને સંયમી સ્વર સંભળાય છે. અહીં હિમાંશી શેલતના આરંભિક કથાસાહિત્યની આગવી વિશેષતા સાંકેતિકતા અને લાઘવનો પણ સધન અનુભવ થાય છે.

જૂની ગુજરાતીમાં આવતા એવા ‘વૃત્તાંત’નું શીર્ષક ધરાવતી આ આત્મકથામાં લેખિકાના વીતેલા સમયનો અણાચાર મળે છે. મુક્તિ એટલે લેખિકા પોતે. હિમાંશીનું નહીં જાણીતું એવું એક નામ મુક્તિ. એ અર્થમાં આજ સુધી કંઈક અપ્રગટ એવાં આ લેખિકાની મુક્તિનો બીજો અર્થ એટલે વ્યક્તિને જીવનના એક એવા પાડાવે એવું લાગે કે જે કંઈ જોયું, જાણ્યું, જીવું, જોગવ્યું અને જેના કારણે જે કંઈ વલણો અને વળગણો, આગ્રહો અને પૂર્વગઢો બંધાયાં એ તમામ બંધનોમાંથી મુક્તિ! નરવું, નિખાલસ, મુક્ત, હળવુંકૂલ એવું પોતાનું ‘હોવું’ અંકે કરવાની જંખના વ્યક્ત કરતું શીર્ષક, એટલે કે બંને પ્રકારની મુક્તિનું વૃત્તાંત!

હિમાંશી શેલત આત્મકથાનો નાટ્યાત્મક રીતે આરંભ કરે છે. ટીવી ન્યૂઝ્લેમાં કોઈ ફેશન મોડેલની આત્મહત્યાના સમાચાર જોતી મુક્તિને વિચાર આવે કે ‘એને જો અલ્યાઈમર્સ થયો હોત તો આમ મોતને વળગી ન પડત’ (૫૦૧). અને લાગણું અલ્યાઈમર્સ થાય તો શું? એવું વિચારતી એ બોલી પડે: ‘જીવેલું આખેઆખું ભૂલાઈ જાય. પહાડની ધાર પરથી સીધાં ઊંડી ખીજામાં’ (૫૦ ૨). સાટોરીની જેમ એની ભીતર જબકાર થાય, ‘મારે આત્મવૃત્તાંત લખવું છે?’ નેરેટર (અધિર સેલ્ક) નવાઈ પામતાં પૂછી બેસે છે: ‘યુ મીન આત્મકથા?’ (૫૦ ૨) મુક્તિ જવાબમાં આત્મકથાના નેરેટર એટલે કે હિમાંશીને ખૂલાસો આપતાં કહે: ‘... છેલ્લું છેલ્લું જોઈ લેવું છે કે કેટલાં પ્રામણિક થઈ શકાય છે, અને કેટલાં નિખાલસ! આ પણ એક પ્રકારનો બારડાન્સ. બધાં જોતાં હોય ત્યારે અજવાળામાં ખૂલલાં થઈ ઊભાં રહેવાની તાકાત કેવીક છે, જોઈએ તો ખરાં! મુક્તિ જેવી છે તેવી, ઠોળ ચડાવ્યા વિનાની અને રંધો ફેરવ્યા વગરની. બસ એની જોડે આંખ મેળવવાની દીચણ છે?’ (૫૦ ૨). પણ નેરેટર આ જવાબ

### મુક્તિ-વૃત્તાંત - હિમાંશી શેલત

અરુણોદય પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૬.

વિશે

બિન્દુ ભણુ

### રસપ્રદ અને વિચારોતેજક આત્મકથા

લગભગ પાંચેક વર્ષ પહેલાં મુંબઈ મુકામે, સાહિત્ય અકાડેમીના એક પરિસંવાદમાં ‘ગુજરાતી લેખિકાઓની આત્મકથા’ વિશે વાત કરતાં મેં આશા વ્યક્ત કરેલી કે આવનારાં વર્ષોમાં હિમાંશી શેલતના હસ્તે ગુજરાતી

નહીં સ્વીકારીને, મુક્તિની આ ઈચ્છાને અતીતમોહ, લખવાના અભરખા કે જાતને સ્થાપવાના ધખારા ગણાવે છે. મુક્તિ પોતાના પ્રયોજનને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે ‘મારે મારા સંબંધોની સરચ્ચાઈને ચકાસવી છે. અને કામની નક્કરતાને પણ’ (પૃષ્ઠ ૨). અહીં મને સહજ જ તુલસીદાસ યાદ આવ્યા. એમણે ‘રામચરિતમાનસ’ના આરંભે સગુજી ભક્તિની સ્થાપના કરતાં પહેલાં નિર્ગુજી ભક્તો કેવા કેવા પ્રશ્નો કરી શકે એની શક્યતા વિચારીને આગોતરા જવાબો આપ્યા હતા. હિમાંશી પણ એવાં સભાન રચનાકાર છે. વળી આમ પણ આપણે તાં કોઈપણ સ્ત્રીની રચનામાં અંગત સંદર્ભો સુંઘવાની બિનસાહિલ્યિક ચેષ્ટાઓ થતી રહે છે ત્યારે કોઈ સ્ત્રીનું આત્મકથા લખવાનું સાહસ એ જેવો તેવો પડકાર નથી! હિન્દીનાં લેખિકા પ્રભા જેતાન પોતાની આત્મકથા ‘અન્યા સે અનન્યા’ (૨૦૦૭)માં સ્ત્રીના આત્મકથાલેખનને સિદ્ધ્યપટીઝ કહે છે. ‘વૈસે આત્મકથા લિખના તો સ્થ્રીપટીઝ કા નાચ હૈ’ (અન્યા સે અનન્યા, પૃષ્ઠ ૨૫૫). લેખિકાની ઝંખના છે કે એની વાતને એ જ અર્થમાં લેવામાં આવે, જે અર્થ એને પોતાને અભિપ્રેત છે.

આત્મકથાની નાયિકા અને આત્મકથાકારને જુદા પાડવાની પ્રયુક્તિરૂપે અહીં મુક્તિ અને મુક્તિની અધરસેલ્ફ એવી લેખિકાની ઉપસ્થિતિ છે. અહીં નાયિકાનું જીવન બે દસ્તિકોણ દ્વારા રજૂ થાય છે. મુક્તિએ કહેલી અંગત વાતમાં લેખિકાની સંડોવણી થતી વાત કંઈક તાટસ્થય ધારણ કરે. આમ નાયિકા મુક્તિની અંગત આત્મીયતા અને નેરેટર હિમાંશીના વિવેચનાત્મક તાટસ્થયની જુગતબંદી આત્મકથાને મર્મસ્પર્શી કલાકૃતિ બનાવે છે. મુક્તિના જીવનના માર્મિક, અત્યંત સંવેદનશીલ અને કયારેક તો હુચમચાવી દે એવા આધ્યાત્મિક અને હદ્યદાવક પ્રસંગોમાં વાચક દ્વારા ઉઠે, પણ લાગાડીવેડામાં વહી ન જાય તેની તકેદારી લેખિકા રાખતાં રહ્યો છે. આત્મકથામાં મુક્તિ ઘટનાઓ કરતાં એમાં સંડોવાયેલાં/સંકળાયેલાં પાત્રોને કેન્દ્રમાં રાખીને વાત માંડે છે. કુણ-કુટુંબના નિરૂપણમાં એ પોતાની સમૃતિઓ પર વધારે મદાર રાખે છે. અહીં પસંદગીમાં સહજપણે જ મુક્તિનો હથ ઉપર રહેવાનો. મુક્તિના જીવનમાં જેમની કોઈ ને કોઈ ભૂમિકા રહી છે એવાં મહત્વપૂર્ણ ચરિત્રો જેમ જેમ એના જીવનમાં આવતાં ગયાં તેમ તેમ આત્મકથાનું પોત

વણાતું ગયું.

આજાદીના વર્ષ, ૧૯૪૭માં જન્મેલી દીકરીનું સ્વાગત ‘મુક્તિ’ નામકરણથી થાય છે. આગળ ઉપર રાશિ નામ મળે હિમાંશી. લેખિકાના પરિવાર સિવાય ભાગ્યે જ આ હુલામહા નામની કોઈને બબર હશે. આમેય આત્મકથામાં કદ્યા પ્રમાણે લેખિકાનાં આત્મીય મિત્રો બહુ ઓછાં. સ્વભાવ, જીવનદસ્તિ અને મળેલી પરિસ્થિતિના કારણે જીવનમાં લોકોની સતત બાદબાકી થતી રહી. અલબત્ત પ્રિય પ્રાણીઓનો સરવાળો ઘણો મોટો. પોતાની શરતે ચાહનાર વ્યક્તિને પ્રાણીઓનો નિરપેક્ષ પ્રેમ વધારે આકર્ષી શકતો હશે કદાચ!

આજે પણ પોતાને અત્યંત પ્રિય એવી જીવનભારતી શાળાનું નામ આવતાં જેના બત્રીસ કોઈ દીવા જળહળી ઉઠે છે એવી મુક્તિને સૌથી પહેલાં યાદ આવે છે ભષણ વિશેનો પોતાનો અનુત્સાહ. લગભગ નફરતની કક્ષાએ રહેતી અરુચિ જોઈને વિશ્વાસ ના બેસે કે આ એ જ બાળકી છે જે ભવિષ્યમાં અંગેજની અધ્યાપિકા બનશે! ગણિતના એકડાને તો એવો ચકલી બનાવી ઉડાડી જ દીધા! એને ગણિત ન આવડવાનો અફસોસ પણ નથી. જોકે રચનાના અંતે પ્રતીતિ થાય છે કે સારું થયું કે એને ગણિત ન આવડયું. નહિતર આવું નિર્દ્વન્દ્વ નરવું-ગરવું વ્યક્તિત્વ આપણને ન મળ્યું હોત! જીવનભારતી શાળામાં સંગીત, ચિત્ર, અભિનય માટે રૂચિ જાગી.

પહેલેથી જ એ સ્વભાવ-પ્રમાણ મળી જાય છે કે કોઈ વાતે મુક્તિની ‘ના’ ની ‘ના’ થવી સંભવ નથી. બીજી બાજુ, કોઈ જ ગણતરી વગર જેના પર એ ઓળખોળ થઈ જાય છે એના માટે એ કોઈની પરવા કરતી નથી. માટે જ મહેતાસાહેબ માટે એ લાભી શકે છે: ‘સાહેબ મેરા એક હેઠાં’ પોતાનાથી મોટી વયના અને કોઈના પતિ, પિતા એવા, એમ. ટી. બી કોલેજના આચાર્ય કુંજવિહારી મહેતા માટેનું અનન્ય બૌદ્ધિક આકર્ષણ અને નિર્દ્વન્દ્વ સમર્પણ જે સાહસ અને સ્પષ્ટતા સાથે નિરૂપાયું છે, એના કારણે આ આત્મકથાની નાયિકા જીવતી-જાગતી સ્ત્રીઓએ અનુભવાય છે. પણ, એક વાત નોંધવી જોઈએ કે હિમાંશીની વાર્તા-નાયિકા આવા સંબંધના સંદર્ભે જે મનોસંઘર્ષમાંથી પસાર થાય છે એ સંઘર્ષ અહીં લગભગ ગેરહાજર છે.

આમાન્ય રીતે દરેક માણસ માટે પોતાનું બાળપણ સ્મૃતિઓનો અદ્ભુત ખજાનો હોય છે. એમાં વહી જવાની સંભાવના પણ ઘણી વધારે હોય છે. અહીં નેરેટર મુક્તિને આજ તર્કથી રોકે છે. વળી ઉમેરે છે કે એમાં ખાસ ઉત્તાર-ચઢાવ નથી. પ્રતાપ' સમાચારપત્રના તંત્રી એવા દાદાજીની નિશ્રામાં, સંયુક્ત પરિવારમાં વીરેલા બાળપણમાંથી લેખિકા એવા જ પ્રસંગો પરંદ કરે છે જેમાં ભવિષ્યની હિમાંશીના સગડ મળે. સુરત બહારના વિસ્તાર અઠવા ગામની ગજજરવાડીની ઓરડીમાં રહેતી ભાષીબાઈને અધ્યી રાતે ઝૂડતો દારૂડિયો પતિ, કે પછી ઘોડાગાડીમાં જોતરાવાનો વિરોધ કરતા ઘોડાને ફટકારતો જૈયો, બાળકી મુક્તિને નામ પાડ્યા વિના જ શોષક અને શોષિત એવા બે ભાગમાં વહેંચાયેલા સંસારની કુરતાનો સાક્ષાત્કાર કરાવે છે. અઠવા લાઈન્સમાં મકાનમાલિકના બંગવામાં ઉજવાતા કૃષ્ણજન્મ કે રામજન્મ, નવરાત્રી, ગણેશોત્સવ જેવા તહેવારોમાં મૂર્તિઓને થતા શાંતિ, ધરાવાતાં નેવેદ્ય, ભરતા અન્નકૂટ, આરતી-ધૂપ વગેરેની સ્મૃતિ મુક્તિની સૌન્દર્યચેતનાને આજે પણ સંકોરે છે.

પોતાના ઘરપરિવારની વાત માંડતાં મુક્તિ પોતાના કુટુંબના પુરુષો અને સ્ત્રીઓમાંથી કેટલાંક વિશિષ્ટ પાત્રો પરંદ કરે છે. સર્વ પ્રથમ તો, મુક્તિને હિમાંશી બનાવવામાં જેમનો બહુ મોટો ફાળો છે તે દાદાજી કાલિદાસ શેલત. ઉમરેઠમાં ધીરધારનો ધંધો કરતા ખેડાવાળ બ્રાબણ કૃપાશંકરના પુત્ર કાલિદાસ. એક એવો સાહસી પત્રકાર, જે વડોદરા, મુંબઈ અને રાણપુર થઈ સુરતમાં સ્થાયી થઈને પોતાનું છાપું નામે 'પ્રતાપ' કાઢે. બાળપણથી મુક્તિને વાચન-દેખન, સાહિત્ય, કળા અને શિક્ષણનો જે પરિવેશ મળ્યો એ આ દાદાજીને કારણે. આઈનું વર્ણની વયે મુક્તિ પોતાના ઘરના નાનકડા વિસ્તારને આવરી લેતું, 'ગુલાબ' નામે ચાર પાનાનું હસ્તલિખિત છાપું કાઢે એમાં આશર્ય શું? બાહોશ દાદાજીના પ્રભામંડળમાં રહેલી મુક્તિને પિતા ઠિન્કુભાઈ માટે મોયભાગે ફસ્તિયાદ જ રહી. એકાદ પ્રસંગમાં પિતા સાથે પોતે ઉદ્ઘતાઈ કર્યાનો એકગાર પણ એ કરે છે (૫૦ ૫૮-૫૯). મુક્તિને એમ પણ લાગતું કે પિતાના કારણે માને શોષાંક પડ્યું છે. સંસાર-વ્યવહારના ગણિતમાં કાયમ કાચા સાબિત થતા પિતાને મુક્તિ આજે કદાચ સાચી રીતે

સમજી શકી છે. મુક્તિને યાદ આવે છે એ પ્રસંગ, જ્યારે બાળપણમાં એક વખત એ પિતા સાથે રેલવેસ્ટેશન ગયેલી. રાતે સેશન પર ઘસઘસાટ ઊંઘતાં ઘરવિહોલાં ત્રણેક નાનાં છોકરાંઓની અધિખુલ્લી હેઠળીઓમાં સિક્કા મૂક્તા ભાઈ એટલે કે પિતાની સંવેદનશીલતા અને સામાજિક નિસ્ભતનો વારસો આજે ગૌરવબેર સ્વીકારતાં હિમાંશીની કલમે પિતાનું ચચ્ચિત અત્યંત મર્મસ્પર્શી બની આવ્યું છે.

સમાજના વગદાર મોભી ગણાતા, તથા રાજનીતિ, કળા, સાહિત્ય અને શિક્ષણજગતનાં મોટાં માણસો જોડે ઘરોબો ઘરાવતા, પણ ક્યાંય મોટાઈનો દેખાડો ન કરનારા, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વને વરેલા દાદાજીથી અત્યંત પ્રભાવિત મુક્તિ આજે પણ માને છે કે મહેતાસાહેબ માટેના પોતાના ભાવને સૌથી પહેલાં દાદાજી જ સમજી શકેલા! મૃત્યુ પહેલાં તેમણે મહેતાસાહેબને કહેલું "આ ઠણ્ણું બહુ ભત્તી ને સરળ છે, એને લોકો બનાવી જશે એટલે એને જાળવજો અને આ છોકરી તમને બહુ માને છે, એને તમારા માટે ખૂબ ભાવ છે, એનું ધ્યાન રાખજો" (૫૦ ૨૩).

પોતાના જીવનમાં જેમનું અનન્ય સ્થાન છે એવા મહેતાસાહેબને મુક્તિ કંઈક મોડા યાદ કરે છે. આરંભે અવધાર પણ રહી હો. વાતની શરૂઆત કરતાં પહેલાં એ 'જોગર્સ પાર્ક' ફિલ્મનો સંદર્ભ લાવી નેરેટર અને મુક્તિની ચર્ચા દ્વારા વાચક માટે અને પોતાને માટે પણ એક ભૂમિકા રચે છે. મહેતાસાહેબ દાદાજીની બૌદ્ધિક બેઠકોના નિયમિત સભ્ય. પારિવારિક મિત્ર. મુક્તિના શબ્દોમાં "મારા માટે અને મારા આખાયે પરિવાર માટે એ પરમ સખા કૃષ્ણ, જે ક્ષણે એમની આવશ્યકતા હોય ત્યારે એ ભીડભંજક બની અડીખમ ઊભા રહેતા." (૫૦ ૧૧૭).

એક પરિણિત મોટી વયના બૌદ્ધિક પુરુષ સાથેના પ્રેમ સંબંધ વિશે સમાજનાં ત્રાજવાં-કાટલાંને નકારીને મુક્તિ પ્રેમ અંગેનું પોતીનું દર્શન રજૂ કરે છે: "જવાબદારીના ભાન સાથે; અને પરિવારને વિશ્વાસમાં લઈને બે વ્યક્તિ પરસ્પર સ્નેહ રાખે, એકમેકને સમજે, સમાજની બેહાલી ખંખેરવા થોડાં સારાં સપનાં સાચેવે, અને એને નકર રૂપ આપવા મથે, એમના થકી થોડાં સારાં કામો થાય, અને એ કામો માટેની ઉર્જા પણ એમને પોતાના મજબૂત સમબન્ધમાંથી જ મળે, તો એમાં ટીકાપાત્ર કશું જ ન હોય. આ જડ અને

સંવેદનહીન, સ્વાર્થમાં રમમાણ લોકાચાર વચ્ચે, એકાદ્યો રમણીય અને સુવાસિત સમજન્ય પાંગરે તો એની હરખલેર નોંધ લેવાવી જોઈએ. પંચાતિયાઓને આમ કરવું ન શકે તો એમની સર્વ બ્યૂહરચનાઓ એમને મુખારક." (પૃષ્ઠ ૧૧૮). આવી સ્વસ્થતા અંખમાથા પર, સલામ આ નીડરતાને! પણ સમજાતું નથી કે તો પછી લેઝિકા બે બે વખત દાદાજીનો હવાવો આપીને (પૃષ્ઠ ૨૩, ૧૨૦) પોતાના આ સંબંધને કયું પ્રમાણપત્ર અપાવવા માંગે છે? એક સ્વતંત્ર બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે તમે આગવો નિર્ણય લીધો. એનું મૂલ્ય પણ ચૂક્યું, એથી સરેરાશ માણસ માટે કડવા થવાનો શો અર્થ? ક્યાંક લાગે કે લેઝિકનો માણસ માટેનો સમજ્ઞાવ જોગમાય છે. જે પ્રેમે આટલી સભરતા આપી હોય એમાં આવી કડવાશને ક્યાં સ્થાન?

પોતાના કુળની સ્ત્રીઓમાં મુક્તિ અનેક પ્રકારના સંઘર્ષમાં ટકી જવાનો કસબ જાણતી વડનાની અને નાની, અમબાઝેઈ, પરદાદી, દાદી અને મા ને યાદ કરે છે : "જીવી લેવાની, જીવી જવાની, આ સ્ત્રીઓની કાબેલિયત યાદ કરવાના આ દિવસો છે" (પૃષ્ઠ ૩૬). એમાં એ સુંદર, સુશીલ અને અભિજાત એવી મા માટે આકર્ષણ તથા વિશેષ ભાવ-અહોભાવ અનુભવતી હેઠાય છે. મા સુધાબહેન સાથે એ અત્યંત અંતરંગતા અનુભવે છે. મા એની દોસ્ત છે. વિવાહ નહીં કરવાનો નિશ્ચય હોય કે પછી મહેતાસાહેબ સાથેનો પ્રેમસંબંધ હોય કે પછી નીલમાણ સાથે લગ્નનો નિર્ણય હોય, બા હંમેશા મુક્તિની પડાને ઊભી રહી છે. બાબે દીકરીને 'સંપૂર્ણ મુક્તિ અને આત્મનિર્ભરતાની પરિકલ્પના' રૂપી અદ્ભુત ભેટ આપી છે. (પૃષ્ઠ ૫૨).

મુક્તિ નસીબદાર છે. 'બાઈ રે તારાં ભાગ્ય મહા બળવાન', કે આગ્રાદ ભારતના પ્રભાતમાં એ જન્મી. બાળપણમાં મુક્તિને ઘેર ભણવાની સગવડ મળે કે વયસ્ક થતાં લગ્ન ન કરવાનો નિર્ણય ખાસ વાંધાવિરોધ વિના સ્વીકારાઈ જાય કે પછી મહેતાસાહેબ સાથેના આત્મીય સંબંધથી ન મુક્તિના ઘરમાં વમળ ઉઠે, ન મહેતાસાહેબના સંસારમાં ઉથલપાથલ થાય કે પછી ન સ્વયં મુક્તિના મનમાં ટુ બી ઓર નોટ ટુ બી જેવા પ્રશ્નો ઉઠે! ક્ષાણેક આપણો માની લઈએ કે - આ બધું થયું પણ હશે, પરંતુ વાચકને માત્ર નીતર્થી જળનું દર્શન પ્રતીતિકર નથી લાગતું.

ધસમસતાં પૂરને ખાળવાની મથામજનું બયાન, નાયિકાના મનોસંઘર્ષનો ચિત્તાર રજૂ થયો હોત તો વિશ્વસનીયતામાં વધારો થયો હોત. માત્ર 'ઈથાકા' સુધી પહોંચવાની યાત્રાનું પણ આગતું મહત્વ હોય છે.

મુક્તિએ ઉમળકાથી શાળાજીવનને યાદ કર્યું છે, પરંતુ કોલેજમાં અભ્યાસના દિવસોની વાત લગભગ નથી કરી. એક પ્રોફેચર અધ્યાપક ડેન્સ સીન મહેતા અને એની પ્રતિબાશાળી વિદ્યાર્થીની મુક્તિ વચ્ચેની તરંગ-લંબાઈ કઈ હતી, જેણે એ બંનેને જોડવાં - એના કોઈ સંકેત વાચકને મળતા નથી. હા, જ્યાં ભણી એ જ કોલેજમાં અંગેજની અધ્યાપક થયા પછી મુક્તિને પોતાના પ્રેમસંબંધ અંગે માનસિક સંઘર્ષ પણ વેઠવો પડ્યો છે. મહેતાસાહેબની સામાજિક છબિને ખરડવા ઈચ્છતા લોકોએ મુક્તિ અને અન્ય સ્ત્રીઓ સાથેના એમના સંબંધોને બદનામ કરવાનો પ્રયત્ન કરેલો. એ સમયે હચમચી ઊઠેલી મુક્તિએ પોતાની રીતે સ્થિરતા મેળવી લીધેલી. પરંતુ એ વખતે બંને પરિવારની પ્રતિકિયા અંગે મુક્તિ લગભગ મૌન છે. નેરેટરે એ અંગે ખણખોદ કરી છે, પણ મુક્તિએ માત્ર ઈશારો કરીને વાતને વાળી લીધી છે (પૃષ્ઠ ૧૨૦-૧૨૧). કોલેજની ઠિતર પ્રવૃત્તિઓએ મુક્તિને સામાજિક સેવાનો માર્ગ ગીય્યો. મહેતાસાહેબ અહીં પણ એના રાહબર બન્યા. શિશુસહાય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પછી તો પીડિત સ્ત્રીઓ, સેક્સવર્કર્સ સ્ત્રીઓની સહાયતા સુધી વિસ્તરી. અધ્યાપક તરીકે મુક્તિ એક પૂર્ણ કદની બુદ્ધિજીવી વ્યક્તિરૂપે વાચક સમક્ષ ઊપસે છે. સમાજ, રાજનીતિ અને શિક્ષણના પ્રવાહો વિશેની એની સજગતા સમય આવ્યે સક્રિય રૂપ પણ લેતી રહી. અધ્યાપકોની હડતાલ હોય કે કટોકટી, નવનિર્માણ કે અનામત આંગ્રેઝન, સુરતમાં પ્લેગનો ઉપદ્રવ અને પૂર, કોમી રમખાણો અને પ્રાઇસીઓ પર થતા અત્યાચાર, મુક્તિની જીવન માટેની નિસબ્ધત જાંખી નથી થતી. (પૃષ્ઠ ૬-૭૭) બલકે વર્ષો વીતતાં વધુ તીવ્ર બને છે.

શિક્ષણ, અધ્યાપન, અધ્યયનની અવદશા જોઈ મુક્તિએ નિર્ણય લીધેલો કે પચાસ વર્ષે નિવૃત્તિ લઈ લેવી. શિક્ષણ પ્રત્યે અધ્યાપક અને વિદ્યાર્થીની ઉદાસીનતા અંગે બળપો વ્યક્ત કરતી વખતે મુક્તિ જાતને પણ બક્ષતી નથી.

ભણતી હતી ત્યારથી મુક્તિને વાર્તાનું આકર્ષણ.

કેથેરીન મેન્સાફિલ્ડને ગુરુ માને. પહેલી કૃતિ 'નવનીત'માં છપાયેલી એનો રોમાંચ લેખિકા મા અને વાચક સાથે વહેંચે છે પણ પછીથી સફળ-સમર્થ વાર્તાકાર તરીકે મળેલી ખ્યાતિ વિશે એ સર્વત્ર મૌન છે. આવો અને આટલો આત્મસંઘરસ?

દુર્લભ! તડજોડ, વાટકીવ્યવહાર અને સમાધાનોથી પોતાની નિસબ્ધત અને નિષ્ઠાને ખરડાવા ન દેતી મુક્તિને સાહિત્યકારણ અને સાહિત્યિક સંસ્થાઓથી છેય રહેવાનું યોગ્ય લાગ્યું. વાર્તાકાર મુક્તિમાં રહેલો વિવેચક સદ્ગ સતેજ અને નિર્ભર્મ. માટે જ તો એ કહી શકે કે "બે પુસ્તકો અંગે એવુંયે બન્યું કે એના વિષયવસ્તુનું જેટલું પ્રબળ ખેંચાણ હતું એના પ્રમાણમાં એનો અભિવ્યક્તિ સહેજ નબળી રહી જવા પામી." (પૃષ્ઠ ૮૬).

કાચી વયે ઉમરેઠના બાપીકા ઘરમાં કોઈ વડીલની ડાયરીમાં દેહસંબંધ વિષે પત્નીની અનિષ્ટા અને આણગમો અને પરિણામે દાંપત્યજીવનની વિષમતા વાંચી કોઈ આનુવંશિકતાથી પ્રેરાઈ મુક્તિ લગ્ન નહીં કરવાનો નિર્ણય લે છે. એ કહે પણ છે કે "દરેક સ્ત્રીમાં એક લાક્ષણિક માદાઝીમેલ હાજર હોય છે, અને એ સારા પ્રમાણમાં સક્રિય સુધ્યાં રહે છે. મારામાં એ કંઈક ઓછી સક્રિય અને વધારે સુધ્યાં રહી. છેક અશરીરી નહીં, તોયે ઘણો ઓછો શરીરી, થોડો વાયવ્ય અને માનસિક પ્રેમ મને અદ્ભુત ભાસ્યો." (પૃષ્ઠ ૩૮). પ્રેમ, લગ્ન અને સંતતિ અંગેની મુક્તિની આ સ્પષ્ટતાઓમાંથી અનું માનસિક વલણ પ્રગત થાય છે. પણ, આ ખુલાસાઓનું લંબાણ જોતાં ક્યાંક શંકા પણ જાય કે આ પોતાના પ્રેમને ખેટોનિક લવ ઠરાવવાની કોશિશ તો નથી ને? વળી પોતાનાં પાણેલાં પ્રાઇડીઓની અસંખ્ય પ્રસવપીડા જોઈને એ માતૃત્વથી ભયભીત થતી. જોકે અભ્યાવગ્રસ્ત બાળકો કે પ્રાઇડીઓ કે વૃક્ષો માટેનું મુક્તિનું ખ્યાલ અને ખેવના જોઈને વાચકને મુક્તિમાં એક એવા શાચ્છત માતૃત્વનો અનુભવ થાય છે જે કોઈ કૂખનું મોહત્તાજ નથી! મહેતાસાહેબના અવસાન સમયે લખેલી ડાયરીમાં પરમ સખા માટેના મુક્તિના અપાર્થિવ પ્રેમનો અનુભવ વાચકને પણ થાય એવો છે (પૃષ્ઠ ૧૨૧, ૧૨૨).

સુડતાલીસ વર્ષે વિનોદ મેધાઝી સાથે લગ્ન કરતી મુક્તિ પતિ માટે વિનોદભાઈનું એક ઓછું જાણીતું એવું નીલમણિ નામ પ્રયોજે છે. પોતાના આ સાહસને મુક્તિ આજે

પણ સમજી શકી નથી. સૈચિંહ્યક નિવૃત્તિ પછી નંદીગ્રામમાં એક ઘર બનાવેલું મુક્તિએ. શહેરથી દૂર ગામડામાં સામાજિક કામ કરવાની ઈચ્છા. ત્યાં નીલમણિનો સંપર્ક થયો. જીવનમાં આવી પેદી એકવતાએ એમને જોડાયા. બે સ્વતંત્ર વ્યક્તિત્વ, બંનેની કેટલીક દઢ માન્યતાઓ, બંનેની ખાસ ઢળમાં ઢળેલી જીવનરીતિએ - અધરો માર્ગ લીધો હતો બંનેએ! પણ બંનેમાં સાહિત્ય માટે, સમાજ માટે કશુંક કરવાની ધખના એકસરખી! લગ્ન પછી 'સખ્ય' માણવાના આશયથી સુરત છોડી વલસાડ અબ્રામામાં સ્થાયી થયેલા આ દંપતીના જીવનમાં 'સખ્ય' ખાસ ન રચાયું. "સહજીવન મારી કલ્યાનમાં જેવું હતું એનાથી જરા જુદી ઠબે આકાર લઈ રહ્યું હતું. નીલમણિ સાથેના સંબંધમાં જે અંતર પડી ગયું હતું એને નકરી વાસ્તવિકતા લેખે સ્વીકારવાની મારી તેયારી અને હિતત હતો. મને એ ખાતરી પણ ખરી કે પરસ્પર આદર અને કાળજીને આધારે અમે માળો સાચવી રાખીશું..." (પૃષ્ઠ ૭૫) પરસ્પરનું સખ્ય માણતાં પણ એકબીજા પર પ્રેમના દાવે કોઈ અધિકાર દાખવી ન શકતાં બે પ્રવાસી એક જ માર્ગ ચાલવા છતાં એકલાં જ રહ્યાં! દાંપત્યજીવનની ગુંગળામણમાંથી મુક્ત થવા પોતાના દિવંગત સસરા જવેરચંદ મેધાઝીને મુક્તિ પત્ર લખે. નીલમણિને ગમશે કે નહીં - એવા વિચારે મુક્તિની લાગણીની અભિવ્યક્તિ અભ્યક્ત રહી! "...એક તીવ્ર ભાવ જાગેલો, નીલમણિનો બરડો પસવારવાનો, એને કપાળે અને માથે હાથ ફેરવવાનો. આ સહજ ઉમળ્ણો યે અભ્યક્ત જ રહ્યો. નીલમણિને આવું વર્તન ગમશે કે કેમ, એ દ્વિધામાં પેલી કાણ તો વહી ગઈ" (પૃષ્ઠ ૧૩૪).

અચંતુ સરેદનશીલ, અન્યના અને પોતાના સ્વતંત્ર્ય વિષે સભાન, પોતાના વિચારોમાં દઢ અને વર્ષોથી પોતાની રીતે જ જીવવા ટેવાયેલાં બે જણનું સહજીવન એકબીજાની કાળજી અને આદરથી રણયાત હોય તોય ભયો ભયો. નીલમણિના ગયા પછી મુક્તિ અને વાચક પોતે પણ એની ખરી ખોટ અનુભવે છે. મુક્તિ, સોનુ (આવો પરિચય લખતાં કલમ ઠરડાય પણ... સોનુ એમનો કૂતરો) અને નીલમણિ, એમ ત્રણ ભેરુની દોસ્તી ભૂલી ભુલાય એવી નથી. નીલમણિની વિદાય પછી તીથલના દરિયે

અસ્થિવિસર્જન કરવા ગયેલા બે ભેરુનો ખાતીપો આપણી આંખમાં પણ ભરતી લાવી હે એવો હૃદયદાવક!

મુક્તિના પ્રેમમાં અરધોઅરધ ભાગ પડાયો છે બિલાડીઓ અને કૂતરાંએ. એનું એક અલગ પુસ્તક પણ છે - 'વિકટર'. અહીં આત્મકથામાં સોનુ 'સખ્ય'ના બીજા જીવોમાં અનોખો. નીલમણિના ગયા પછી જાણે મુક્તિનું સર્વસ્વ. સાવ અસહાય અવસ્થામાં જીવતા વૃષ સોનુને છેવટે વિદ્યાય આપવી જ પડી. "ચમ્મા અને કાંચનાર વચ્ચે સોનુને પોઢણ દીધાં. માટી વાળી તોયે એનો ભારે શાસ સંભળતો રહ્યો, મારી આગળ પાછળ હોય એમ. એ બપોરથી આ ઘરમાં મારાં આગમનના ઓચ્ચવ વિલાયા, હરબે ઊછળતું આંગણું ગમગીન" (પૃષ્ઠ ૧૬૨). મુક્તિની સાથોસાથ વાચક પણ કોઈ અંગત સ્વજનની વિદ્યાયનો અનુભવ કરે છે.

વર્ષ ૨૦૧૪ના જૂનની પહેલી તારીખે હૃદયરોગનો ઝુમલો આવે છે ને ક્ષણેક પેલી પારની દુનિયાનો સાક્ષાત્કાર મુક્તિને થાય છે. સમયસર સારવાર મળતાં એ બચી જાય છે. પણ આ અનુભવ આપી ગયો એને અંદર-બહાર પ્રગાહ શાંતિનો. (પૃષ્ઠ ૧૬૮). હવે એક જ ઈચ્છા છે, રૂંઠનાથ મહાદેવના મંદિરની અગાશીમાં ધૂમમટ ફરતે હવામાં બેદ હાથ ફેલાવી, એને પાંખો પેઠે ફંડાવતી, પૂરજોશમાં ચક્કર પર ચક્કર લેતી ખુદમસ્ત છોકરીને ઊડતી જોવી છે.

આરંભે અને અંતે રવીન્દ્રનાથની કાલ્યાંપ્રક્રિતાઓ મુક્તિની મુક્તિઆકંક્ષા અને માનુષજીવનની ધન્યતાને અભિવ્યક્ત કરે છે. મુક્તિને અસાધારણ જીવન મળ્યું, એણે પોતે જીવન, જગત અને જાત પાસેથી જે અપેક્ષા સેવી એને કારણો તો સંઘર્ષો છે. અસ્તિત્વ નહીં, અસ્મિતા ટકાવવાની મથામણ છે. આ બુદ્ધિથી આકર્ષાતી અને હૃદયથી દોરવાતી મુક્તિ ક્યારેક સાવ સરળ તો ક્યારેક અપારદર્શક લાગે છે. પ્રાણીઓના પ્રેમ સાથે માનવના પ્રેમની તુલના કરતી મુક્તિ અસહિષ્ણુ બની જાય છે. નાનામાં નાના ગલ્લૂડિયાને કે બિલાડીના બચ્ચાને વિગતે યાદ કરતી મુક્તિ પોતાના મોટાભાઈ-ભાભી કે નાની ભાભીને ખાસ યાદ કરતી નથી. નાનો ભાઈ ડો. કેતન શિશુસહાય ટ્રસ્ટ કે સુરતમાં ફાટી નીકળેલા ખેગ સંદર્ભે આવે છે. મિત્રોમાં અંજનીબહેન કે જગટીપ સ્માર્ત સાથેનાં સ્મરણો નહીં જેવાં છે. કદાચ એવું યે બન્યું હોય કે મુક્તિનું

જગત એવું તો વિસ્તરી ગયું કે એમાં પરિવારને માટે બહુ તક ન રહી! નિવૃત્તિ પછી નંદીગ્રામમાં શેષજીવન ગાળવું હતું, ત્યાં ઘર પણ બનાવેલું એ અંગે અછિડતો મભમ ઉત્તેખ કરીને વાત છોડી દીધી છે.

કલાત્મકતા અંગે સભાન એવાં લેખિકાએ અહીં નિરૂપણની એકાધિક રીતિઓ અપનાવી છે. ક્યાંક સંવાદ, વાદવિવાદ, સંભાષણ, સ્વગતોક્રિત, વર્ણન, કથન, ડાયરી, પત્ર વગેરે દ્વારા આત્મકથાને એક આકાર આપ્યો છે. પુસ્તકમાં રેખાંકનો પણ આગવો અર્થ પ્રગટ કરતાં રહે છે.

આ રચનાનું સધન ગદ્ય રસ અને ચિંતનનો સમાનાંતર અનુભવ કરાવે છે. આ આત્મકથાની ભાષા આપણી ગુજરાતી ભાષાનું આગામું દરેરું છે. ચિત્રાત્મકતા, સંકેતિકતા, વંગ, હાસ્ય અને લાઘવ એમાં અસરકારક છે. હિમાંશીએ વાર્તાવેખનના આરંભે સારી વાતાની એક કસોટી રાખેલી. જો વાર્તા બે થી વધુ વાર વાંચતાં કંયાળો ન આવે તો એને સફળ માનવી. સફળતા અને સાર્થકતાની દિશિએ કહેવું જોઈએ કે આ આત્મકથા વાચકને ફરી ફરી આકર્ષે એવી રસપ્રદ અને વિચારોતેજક બની આવી છે. □

### વડફળિયું - મણિલાલ રાનવેરિયા

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ, ૨૦૧૫.

વિશે

ચંદુ મહેરિયા

### સંઘર્ષનો જીવંત દસ્તાવેજ

મરાઠી દલિત સાહિત્યનો એક વિશે તે યુવાન દલિત સાહિત્યકારોની આત્મકથાઓ છે. ગુજરાતી દલિત સાહિત્યમાં એનો સંદર્ભ અભાવ છે. પોણા ચાર દાયકના ગુજરાતી દલિત સાહિત્યમાં આત્મકથાઓ હજુ બે અંકે પણ પહોંચી નથી. અમૃતપર્વ વળોટી ચૂકેલા મણિલાલ રાનવેરિયાની આત્મકથા 'વડફળિયું' ઓછા ખેડાયેલા ગુજરાતી દલિત આત્મકથા-સાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરણ છે.

પદ્મલાલ

ચિત્રપત્ર-જી ૨૦૧૬ ૧૨

૧૯૪૦માં જન્મેલા મહિલાનું ચાનવેરિયાના રૂપમાં  
પ્રગટ આ આત્મકથનમાં (જેને લેખક આત્મકથા અને  
પ્રસ્તાવનાકાર કાંતિ પટેલ આત્મવૃત્તાંત કહે છે) આજાઈ  
પૂર્વના થોડા સમયના, વિસમી સર્દીના ઉત્તરાર્ધની અડવી  
સર્દીના અને એકવીસમી સર્દીના પહેલા દોઢ દાયકના  
દલિત જીવનનો ચિત્તાર મળે છે. આ આત્મકથન દલિતોની  
ગઈકાલ, બહુ ધીમે ધીમે બદલતી આજ અને  
આવતીકાલની ઝાંખી કરાવે છે.

જ્યાં દલિત વસ્તી અલ્ય છે અને તેને કારણે  
આભડછેટ અને અત્યાચાર પણ નથી એવી વ્યાપક છાપ  
છે એવા દક્ષિણ ગુજરાતના એ વખતના સુરત જિલ્લાના  
ચાનવેરી ગામમાં લેખકનો જન્મ. લેખકના વતન ગામમાં  
બહુમતી વસ્તી આદિવાસીઓની. દલિતોમાં ઉપલી ગણાતી  
માદ્યાવંશી પેટાણાતી પ્રત્યે આદિવાસીઓ ભારોભાર  
અસ્પૃશ્યતા રાખે છે તે આત્મકથામાંથી પસાર થતાં જાણીને  
આશ્ર્ય અને આધાત લાગે છે. ભારતની જડ ગણાતી  
શાત્રપ્રથા આદિમ ગણાતી પ્રજામાં પણ કેટલી જડબેસલાક  
છે તે જાણીને રંજ, રમૂજ અને રોષ જન્મે છે. બાલ્યકાળનો  
લેખકનો અનુભવ : ‘વરસમાં બે વાર ગામમાં રોટલા  
ઉધરાવવા જતાં. હિવાળી અને હોળી ઉપર. આ દિવસોમાં  
જોળી લઈને ઘેર ઘેર ફરવાનું. વાસી રોટલા (ક્યારેક પુરી,  
દેબરાં, પુડા) સાથે વેગણ-બાયાનું શાક મળે. બપોર થતાં  
જ કાઈ જમા થાય તે કોઈ એકાઈ આદિવાસીના ઓટલા  
પર બેસીને ખાવાનું. પણ પાણી માર્ગીને પીવાનું. પેલી  
આદિવાસી બાઈ પાણી લોટાથી ઉપરથી રેડે તે ખોબો  
માંડીને પીવાનું. આદિવાસીઓ માટે પણ અમે અસ્પૃશ્ય  
હતા. આજે પણ પણ કેટલાક લોકો અમને અસ્પૃશ્ય ગણે  
છે. એનો આ જાત-અનુભવ.’ (પૃષ્ઠ ૧૨-૧૩).

ભારે અભાવો વચ્ચે લેખક ભાગતરનો આરંભ કરે છે  
પણ ત્યાંય આભડછેટ તેમની સાથે જળોની જેમ ચોટેલી  
છે. શાળાજીવનમાં અનુભવાયેલી આભડછેટ વર્ણવતાં લેખક  
લખે છે, ‘નિશાળમાં જોકે અમે અન્ય બાળકોની સાથે  
ભાગવા બેસતાં હતાં. પણ નિશાળની પરબનું પાણી અમે  
જાતે લઈની પી શકતાં નહીં. પરબના માટલાનું પાણી બીજાં  
બાળકો લોટામાં લઈ ઊંચેથી રેડતાં તે અમારે ખોબો માંડીને  
પીવું પડતું. પરબમાં અમે ચૂડી શકતાં નહીં. તે જ પ્રમાણે

કુવાથળ ઉપર ચઢીને પાણી ભરી શકતાં ન હતાં. આ  
પ્રકારના ભેદભાવથી મન વ્યથિત બની જતું. ઘણીવાર  
તરસ્યાં બેસી રહેતાં. રિસેસમાં ઘેર જઈને પાણી પીતાં. જો  
પાણીને અડી શકાય નહીં, તો ખાદ્યપદાર્થોને અડવાનો તો  
પ્રશ્ન ઉપસ્થિત થતો જ નહોતો. વડફળિયાની નિશાળમાં  
મોટાભાગનાં બાળકો આદિવાસી ગોડિયા પટેલનાં હતાં પરંતુ  
તે બાળકો પણ અમને અસ્પૃશ્ય ગણતાં. જોકે શિક્ષકો એવો  
ભેદભાવ રાખતાં નહીં. ક્યારેક વાતચીતમાં અથવા  
ભણવામાં દિલ દુઃખી જાય એવું બનતું’ (પૃષ્ઠ ૧૭).

આપણને લેખકનો આ અનુભવ કે ભારતની  
આભડછેટ પૂર્ણ ભૂતકાળ કે ગઈ ગુજરી લાગે. પણ અનેક  
કંઈગાઈઓ છતાં તે ભાગે છે. મહાનગર મુંબઈમાં રહે છે,  
કોલેજમાં અધ્યાપક બને છે તે પછી પણ વતનની  
આભડછેટ અમને છોડતી નથી. જોકે તેનું સ્વરૂપ બદલાયું  
છે અને તે કેવું છે? લેખકના શબ્દોમાં, ‘અસ્પૃશ્યતાની જે  
થોડાથાણી ધાર હતી તે પણ હવે બુઝી બની ગઈ છે. અને  
લોકો તમને કમસેકમ ઉમળકાથી આવકારે છે. દેખાતી  
અસ્પૃશ્યતા પળતી હોય એવું લાગતું નથી. મારી સાથે તો  
રાજપૂતો-આદિવાસી બધાં આદરપૂર્વક વર્તે છે અને ચા-  
પાણી કરાવતા હોય છે. પરંતુ એક વાતનું આશ્ર્ય મને થયા  
કરે છે અને તે એ કે મારે અમને ત્યાં લગભગ ફરજિયાત  
ચા પીવી પડે. જ્યારે મારે ત્યાં એ લોકો નમ્રતાપૂર્વક એ  
વાતને ગણે. આશ્રેપ ટાળવા પાણી પી લે’ (પૃષ્ઠ ૧૮૭). અને  
એટલે લેખક ભારે જેદ સાથે નોંધે છે. ‘આજે પણ  
આદિવાસીઓ દલિતોને અસ્પૃશ્ય ગણે છે. એ વાતનું દઈ  
છેલ્યે સુધી સાથે લઈ જવું પડશે એ બાબત દિલમાં શૂણની  
માફક ભૌંકાય છે આત્મકથનો.’ (પૃષ્ઠ ૧૭).

દલિત આત્મ-કથનો જેમ અસ્પૃશ્યતા તેમ આશ્ર્યક  
અભાવો અને ગરીબીના અનુભવોથી સભર હોય છે.  
‘ગૌરવ પમાડે એવો કોઈ અમારા પૂર્વજનો ઈતિહાસ નથી.’  
અમ જગ્ઘાવીને લેખક પૂર્વજો સાવ જ નિરક્ષર અને ૨૪  
કલાકનાં વેઠવૈતતું કરતાં હોવાનું જણાવે છે. પિતા  
બધાભાઈઓ બાળપણમાં મા-બાપ ગુમાવેલાં. લોકોનાં ઢોર  
ચરાવીને બાળપણ વીતાવેલું. ઢોર ચરાવતાં ચરાવતાં  
કપાસની કુલડી ભેગી કરી તે વેચીને ગાડીભાડાનો જોગ  
કરી છ વરસની ઉમરે મુંબઈ ગયેલા. ત્યાં અગ્રેજચાહેબના

કૂતરા ચરાવીને મોટા થયેલા. તે પછી ઘરનોકર બનેલા. મહિને ૫ રૂપિયાનો મનીઓડર મોકલતા. મા ગામમાં રહી મહેનતમજૂરી કરી છોકરાં ઉછેરતી. જેમની જન્મતારીખ અને જન્મસ્થળ ચોક્કસ નથી એવા વડફળિયુંના લેખકે કેવી ગરીબીમાં બાળપણ બસર કર્યું છે તે 'કપરો કાળ' પ્રકરણમાં એમણે વર્ણાવ્યું છે. 'ઘરમાં અનાજ નહીં એટલે ખાલી હંડલાં ખાખડે. લગભગ ભૂખમરાના દિવસો, લાલ જુવાર અને અમેરિકાનાં હોરને ખવડાવવાના ઘઉં રાશનની દુકાને મળે. દુકાન ગામથી ૧૦ ગાઉ દૂર. ચાલતા મળસ્કે અંધારામાં જવાનું. આસપાસનાં દસેક ગામના લોકો આવે. રાશનકાર્ડના ઢગલા થાય. મળસ્કે ગયા હોઈએ તે બપોરના બે-ન્રાશ વાગે નંબર લાગે. જે કંઈ મળે તે માથે મૂકી પાછા દસ ગાઉ ચાલીને ઘરે આવવાનું. આજો દિવસ પેટની ભૂખ પાડી પીને ઠારવાની.' (પૃષ્ઠ ૧૦).

ભારતના આઝાદી વરસે લેખકનો શાળપ્રવેશ થાય છે. જેના પરથી આત્મકથાનું નામકરણ થયું છે તે ગામની વડફળિયામાં આવેલી ૧ થી ૪ ધોરણની શાળામાં. લેખકના જીવનમાં આવેલો આ મહત્વનો વળાંક છે. ગરીબી અને આભડહેઠ છતાં લેખક ભાજવામાં હોશિયાર બની રહે છે. પરંતુ કુંઠની સ્થિતિ એટલી સારી નથી. એટલે મા મહિલાલ(ઘરનું નામ મગન)ને જેટ ભરતો થાય' માટે મુંબઈ મોકલે છે. વતનની ચાર માઈલ છેટેના ધોળીકૂવા સેશને મળસ્કે પહોંચ્યા. ૧૨ વરસના પુત્રને એકલો અડધી ટિકિટ કપાવીને મા મુંબઈ મોકલે છે. રસ્તામાં બાળીમોરાથી ગાડી બદલીને છેક સાંજે મુંબઈ પહોંચે છે. જોકે બાળક મહિલાલના રોટલા અને ઓટલાનો જોગ માયાનગરી મુંબઈમાં થતો નથી. અને એમ અધૂરું ભાજતર આગળ ચાલે છે - ખાધીપીધે સુખી મામા-મોસાળના ટેકે. વર્નાક્યુલર ફીલ્ડનલની પરીક્ષામાં ચીખલી કેન્દ્રમાં તે પહેલા પાંચમાં સ્થાન મેળવે છે. તે પછીનું શિક્ષણ સર્વોછ્ય આશ્રમ દેવસરના છાત્રાલયમાં રહીને પૂરું કરે છે. ૧૮૮૮ના જૂનમાં લેખક મેટ્રિક થાય છે. એ જ દિવસે બાપુની ઘરનોકરની નોકરી જાય છે. 'હું પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયો. હું અત્યંત ખુશ હતો. બાપુજી પાસે કોલાબા પહોંચ્યો. તે નારાજ થઈને રડમસ ચહેરે બેઠા હતા. મને ધ્રાસકો પડ્યો. મારા પાસ થવાના આનંદને ઉડાવી દે તેવા સમાચાર હતા. બાપુજીને

સવારે જ મેમસાહેબે નોકરીમાંથી રૂખસંદ આપી દીધી હતી. હવે અમારે બે જાણે ક્યાં જવું તે મોટો પ્રશ્ન હતો. અમારા બાપ દીકરાના માથે આભ અને નીચે ઘરતી હતી' (પૃષ્ઠ ૬૨). તે પછીના દિવસો બાપદીકરા માટે ભારે સંઘર્ષના હતા. છતાં લેખકની ભાજવાની હઠ અને લગન જારી રહે છે. લેખકને મુંબઈમાં નાનીમોટી નોકરી મળી જાય છે એટલે જીવનની ગતિ થંભી જતી નથી.

૫૬ પ્રકરણના આ આત્મવૃત્તાંતમાં અડધોઅડધ પ્રકરણોનાં નામ સ્થળનામો છે. મુંબઈનાં સ્થળનામોવાળાં પ્રકરણો છે - બિશપગેટ, આરે કોલોની, બેડી ફ્લેટ્સ, સંગીહામ વિલા, ચર્ચમિશન હાઉસ, ડેર્ક્યાર્ક રોડ. ચૌપાટી, એલ્ફિન્સ્ટન રોડ, મજાસવાડી, સિદ્ધાર્થ કોલેજ, પાંડુરંગવાડી, શિંદેવાડી, મીઠાનગર, દાલમિયા કોલેજ, વસઈ, વગેરે. પરંતુ આ સમૃદ્ધ સ્થળનામો છેતરામજાં છે અને તેના પરથી લેખકના જીવનસંઘર્ષનો ચિત્તાર મળતો નથી. લેખકે થોડા રોટલા અને જાગ ઓટલા માટે કેવા કેવા સંઘર્ષો કર્યા છે તેનાં કેટલાંક ઉદાહરણો.

૧. ગામની નિશાળ છોડી નોકરી કરવા વાસ્તે આ રામ મુંબઈ પહોંચી ગયા. ૧૨ વરસનો ત ચોપડી ભાજોલો છોકરો કઈ નોકરી કરી શકે? વારસામાં ઘરકામ મળેલું પણ આટલા નાના અને માયકાંગલા છોકરાને ઘરકામ માટે કોક્ષ રાખે? બીજો વિકલ્પ કૂતરાં ચારવાનો-dogboy તરીકે નોકરી કરવાનો હતો' (પૃષ્ઠ ૨૧).

૨. મારા બાપુજી તે વખતે મુંબઈમાં નોકરી કરતા હતા. પરંતુ બંગલા ખાતેની નોકરીમાં મને સાથે રાખી શકે તેમ નહોતા. આરે કોલોની એક તો બહુ દૂર અને વળી ત્યાં જંગલમાં સુવિધાનો અભાવ. એકલો રહીને ફાનસના અજવાણે વાંચતો રહ્યો' (પૃષ્ઠ ૫૮).

૩. બેડી કંપનીમાં મને આસિસ્ટન્ટ સ્ટોરકીપરની નોકરી મળી. કંપની પરેલ ખાતે આવેલી હતી અને મારું રહેવાનું આરે કોલોનીમાં. સવારે ૮ની પાણીમાં કામે ચઢવા ઘરથી ખૂબ વહેલા નીકળવું પડતું. શાક રોટલી આગલી રાતના જ બનાવી રાખતો. એટલે વહેલી સવારે ટિફિન લઈ જવાય. વળી ૭-૮ કિલોમીટર ચાલીને ગોરેગાંવ સેશને જવાનું' (પૃષ્ઠ ૫૮).

૪. બાપુજી દક્ષિણ મુંબઈના પોશવિસ્તાર કોલાબા

ખાતે બ્રેડી ફ્લેટ્સમાં એક અંગેજસાહેબના ત્યાં ઘરકામની નોકરી કરતા હતા. મને સાથે રહેવાની પરવાનગી ન હતી. ક્યારેક ચોરીછૂપીથી રહી જતો. વર્તમાનપત્ર પાથરીને સીડી પાસેની ખુલ્લી જગ્યા પર સૂર્ય રહેતો (પૃષ્ઠ ૬૧).

૫. ‘મારા ઝોઈના દીકરો દાળભાઈ સંગ્રહિત વિલામાં ઘરનોકર. તેમણે (બાપુની નોકરી છૂટી ગયા પછી) અમને આશરો આપેલો. હું અને બાપુજી તો ખરા જ. પણ સાથે દાળભાઈના મોટાભાઈનો દીકરો પણ. અમે બધા ચોરીછૂપીથી રહીએ. રાતના ૮ વાગ્યા પછી શેઠશેઠાંડી બગીચામાંથી ઊકી વાળું કરવા જાય ત્યારે ચોર પગલે લપાતા છૂપાતા પાછલી સીડીએથી બંગલામાં પ્રવેશવાનું. અને સવારે શેડ લોકો જાગે તે પહેલાં ત્યાંથી પોબારા ગણી જવાનું.’ (પૃષ્ઠ ૬૪).

૬. ‘લલ્લુભાઈ અને એમનાં પત્ની સાત આઈ રૂમની ચાલી, સર્વન્ટ્સ હાઉસ, ચર્ચિમિશન હાઉસ ખાતે રહે. આમ તો એમની પાસે રહેવાની કોઈ વધારાની જગ્યા નહોતી. પરંતુ જો રૂમની બધાર ઓટલી પર સૂવાની મારી તૈયારી હોય તો તેઓ આશરો આપવા તૈયાર હતા. બાપુજીએ મારું રહેવાનું ત્યાં ગોઈવ્યું.’ (પૃષ્ઠ ૬૬).

૭. મારા માસા પરલુ ગોઈમાં વાયરમેનની નોકરી કરે. કોલીવાડા માર્કેટની બાજુની ગલીની એક ચાલમાં ત્રીજે માળે દસ બાય છની ઓરડીમાં એમનો વસવાટ. એમની સાથે એમના બે દીકરા, મારા મામાનો દીકરો અને ગોઈમાં કામ કરતા લાલભાઈ રહે. દસ બાય છની ઓરડીમાં હું છણો ઉમેરાયો. દરેક માણા પર કોમન સંડાસ. બાથરૂમ જેવું કાઈ નહીં. આટલી નાની રૂમાં છ જણ સૂર્ય શકે નહીં. ત્રણ જણા અંદર અને ત્રણ સીડી પાસેની ખુલ્લી જગ્યામાં સૂર્ય જતા. એકવાર સૂર્ય જાવ એટલે વરચે ઊઈવાની મનાઈ (પૃષ્ઠ ૭૨-૭૩).

૮. મજુગાવથી સ્થળાંતર કરીને એલ્ફિન્સ્ટન રહેવા ગયો (પૃષ્ઠ ૮૮). એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનથી પશ્ચિમમાં ઊતરો એટલે જમણો હથે સૂરજ બિલ્ડિંગ આવે. ત્રણ માળનું ચાલી વાઈપ મકાન. ખોલીઓ ખૂબ મોટી. કોમન સંડાસ બાથરૂમ. (પૃષ્ઠ ૮૭).

૯. મજાસવાડીમાં મોટાભાગની જમીન મુંબઈ સબર્બન કલેક્ટરની માલિકીની હતી. વિશાળ એરિયા ખુલ્લો પડ્યો

હતો. એ વિસ્તારમાં ઉત્તરપ્રદેશના બૈયાઓ સરકારી જમીનમાં ચાલીઓ બાંધી ભાડેથી આપતા. એડવાન્સમાં રૂમદીઠ રૂ. ૨૦૦ ડિપોઝિટ અને ભાડું મહિને રૂ. ૨૦. ચાલીમાં ન મળે પાણી કે ન મળે સંડાસ-બાથરૂમ. સંડાસ માટે નજીકના જંગલમાં જવાનું. મેં રૂ. ૨૦૦માં રૂમ બુક કરાવી (પૃષ્ઠ ૮૧).

૧૦. મજાસવાડી(જોગેશ્વરી)માં પાયાની સગવડોના અભાવે અન્ય જગ્યાની શોધમાં હતા. રજાના હિવસોમાં ગોરેગાંવથી બોરીવલી સુધીની ચાલીઓમાં રખડપણી કરતા. અમારા બજેટમાં જગ્યા મળતી ન હતી. મારી સાથે મારા ખાતામાં નોકરી કરતા નારાણભાઈ મહેતા તારદેવની ઝૂપડપણીનું ગોરેગાંવ પાંડુરંગવાડીની બાજુમાં આવેલા મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં સ્થળાંતર કરી રહ્યા હતા. તેમાં અમારો સમાવેશ કરવા વિનંતી કરી. તેમણે સંમત થઈ ચાલી બાંધવાની અનુમતિ આપી. કાંચી ચાલ બાંધવાનો રૂમદીઠ અંદાજિત ખર્ચ ૫૦૦ રૂપિયા. પણ એટલા પૈસા ભેગા કરવાનું કર્યા’ (પૃષ્ઠ ૧૦૩).

૧૧. મહાનગરપાલિકા તરફથી કર્મચારીઓ માટે બંધાયેલ વસાહત, મીઠાનગરમાં હાયર પરચેઝ બેસીસ પર મને એક રૂમ મળી. એ નાનકડી ખોલીમાં મારા જવનની અનેક ગતિવિધિઓને ચાલના મળી. છેક ૧૯૬૬ દથી આજદિન સુધી એ જગ્યામાં મારું રહેઠાણ ચાલુ છે. અહીં રહીને મારાં બાળકો મોટાં થયાં, ભજ્યાં, તેમનાં લગ્નો થયાં. બંને દીકરીઓનાં બાળકોના જન્મ પણ અહીં જ થયા (પૃષ્ઠ ૧૧૬).

મણિલાલ રાનવેરિયાએ અન્ય અનેક દલિતોની જેમ નોકરી કરતાં કરતાં ઉચ્ચ અભ્યાસ કર્યો. પહેલાં મુંબઈ ભવન્સ અને પછી સિદ્ધાર્થ કોલેજમાં એ ભજ્યા. ઓછી મહેનતે સારી ગ્રહણશક્તિને પ્રતાપે સારા ટક મેળવી બીંગે, એમંગે, થયા. શિક્ષક બનવાનું છેક બાળપણનું સપણું સાકાર કર્યું. સલામત અને લાભદાયી એવી મુંબઈ મહાનગરપાલિકાની બારેક વરસની નોકરી છોડી. ૧૯૭૨માં દાલમિયા કોલેજમાં પાર્ટ્યાર્ટમ લેક્યુરર બન્યા. પોતાની આ નોકરીને લેખક સિદ્ધિ નહીં, સ્વખણસિદ્ધ ગણાવે છે. એક તરફ કાયમી નોકરી છોડી હતી તો બીજી તરફ નવી શિક્ષણપદ્ધતિને કારણે ફાજલ થવાનું આવ્યું. કોલેજની

નોકરીની અસલામતી સતત રહી છતાં હિમત રાખો.' બોમ્બે યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ યુનિયન સાથે જોડાયા. સક્રિય ટ્રેડ યુનિયનિસ્ટ બન્યા. યુનિવર્સિટી સેનેટ અને સિંગિકેના સર્બ્ય થયા. એ વખતની લેખકની લાગણી હતી કે, 'હવે કોન્વોકેશન હોલનાં પગથિયાં પર બેસીને પરીક્ષાની તૈયારી કરનારો એક વિદ્યાર્થી એ હોલની અંદર સેનેટની મિટિઓમાં બેસવાનો હતો. એ હવે સેનેટર બન્યો હતો.' (પૃષ્ઠ ૧૩૮). આ લેખક મુંબઈ વિદ્યાપીઠ અને સંલગ્ન કોલેજોમાં અનામતનો અમલ કરાવ્યો કે બેંકિગ રિસ્ક્યુમેન્ટ બોર્ડ સાથે જોડાઈને દેશ આખામાં ભરતી-બાદતીની પ્રક્રિયા નજીકથી જોઈ અને તેનો વિરોધ અને સફ્ટભાવથી અમલ કરાવ્યો. આ તેમના જીવનનું મૌખીકું સંભારાયું છે.

દલિત જીવનના સંઘર્ષો અને કઠણાઈઓને કારણે દલિત લેખનમાં કડવાશ અને આકોશ સહજ રીતે જ આવે છે. બાળપણથી નિવૃત્તિ સુધી વતનના આદિવાસીઓ લેખક અને દલિતો પ્રત્યે સામાજિક ભેદભાવ રાખે છે. છતાં તે માટે લેખક આકર્ષણ કે કડવા થયા નથી. દાલમિયા કોલેજમાં ૧૯૭૨માં લેખક જોડાય છે અને ૧૯૮૮માં નિવૃત્ત થાય છે. અધ્યાપક તરીકેનો પોતાનો આ કાળ લેખક સહજ રીતે આ શબ્દોમાં મૂલવે છે. "કોલેજ સાથેના મારા અંગત સંબંધો ઉભાભાબડ રહ્યા હતા. એટલે કોલેજ છોડવાનું દઈ કે એવું કાઈ સામાન્યપણે બનતું હોય છે તે બન્યું ન હતું. અલબત્તા, મિત્રોથી છૂટા પડવાનું દઈ હતું પરંતુ એ તો નિશ્ચિત જ હતું એટલે કોલેજમાંથી મારી વિદ્યાય સામાન્ય પ્રકારની રહી" (પૃષ્ઠ ૨૦૦).

અધ્યાપકની જેમ સામાજિક કર્મશીલ તરીકે પણ લેખકનું મોટું પ્રદાન છે. 'માન્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ'ની ઘણી પ્રવૃત્તિઓ સાથે લેખક સંકળાયેલા હતા. સંસ્થાના સામયિક 'તરસ'ના લેખક આવસ્થાપક છે. ભારે મહેનત કરીને દસ્તાવેજ પુસ્તક 'માન્યાવંશી સંઘર્ષ કથા' આવેખી છે. પરંતુ કેટલાક લોકોને તેમાંનું લખાજી વાંધાજનક લાગે છે. લેખકને ધમકીઓ મળે છે. આગળ વધીને એક ટિવિસ સંઘના કાર્યાલય પર આવીને કેટલાક લોકો પુસ્તકની ૭૦૦ નકલો ફીડી નાંબે છે. આ સમયનો લેખકનો ગુરુસ્થો સ્વાભાવિક હતો પણ આ બનાવનું વર્ણન

લેખક સ્વસ્થતાથી કરે છે અને લખે છે. 'જે સમાજ માટે આખું જીવન સંઘર્ષ કર્યો તે સમાજના કહેવાતા નેતાઓએ આ પ્રાણઘાતક હુમલો કર્યો. આ હુમલામાં તાર્કિક કે બૌદ્ધિક ચર્ચાને અવકાશ ન હતો. જો આ પ્રકાશનથી કાયદેસર ગુનો બનતો હોય તો તેઓ મારી વિરુદ્ધ કાયદેસરનાં પગલાં ભરી શક્યા હોત પણ એવું કશું કર્યું નહીં' (પૃષ્ઠ ૨૧૬).

મણિલાલ રાનવેરિયાનું આ આત્મવૃત્તાંત સંઘર્ષનો જીવંત દસ્તાવેજ છે. સુરત જિલ્લાના એક નાનકડા ગામનો કિશોર સ્વબળો સંઘર્ષ કરતો, ઠેબાતો ઠેબાતો મહાનગર મુંબઈમાં પોતાની જગ્યા બનાવે છે, કુટુંબ અને દલિત સમાજની હક્કાપરિત માટે મથે છે, તે સ્પિદ્બિની નાનીસૂની નથી. લેખકને તેમના આ કાર્યમાં બિનદલિત શિક્ષકો, સહકાર્યકરો અને સહાધ્યાયીઓનો સહકાર મળ્યો છે અને લેખક સતત તે માટે ઓશિંગાણભાવ અનુભવે છે. આજે લેખકની બે દીકરીઓ અને બે દીકરા સારી રીતે ઠરીઠામ થયાં છે. રાનવેરિયા કુટુંબ મશે દલિતોનો શૈક્ષણિક-આર્થિક વિકાસ દેખાઈ આવે છે. લેખકના સાત પેઢીના કુટુંબવૃક્ષનાં નામો પર એક નજર કરીએ તો પહેલી પાંચ પેઢીના કાનજી, વિશારામ, બધો, છનો, ડાહી, છીબી, પરલુ, મણિલાલ છણી પેઢીએ લોપા, રસેલ અને સાતમી પેઢીએ વૃષનીપ, શૈલી, આયુષી નામો ધરે છે. દલિતોની હાલની પેઢીનાં આ આધુનિક અને સંસ્કૃત નામો જ શિક્ષણ થકી થયેલું સાંસ્કૃતિક પરિવર્તન દર્શાવે છે. એ રીતે પુસ્તકનું નામ સાર્થક છે.

વડળિયુના લેખક છાએક દાયક મહાનગર મુંબઈમાં રહ્યા છે. જાહેરજીવનમાં સક્રિય છે. એટલે વાચકને તેમની આત્મકથામાં મહારાષ્ટ્રની આંબેડકરી દલિત ચળવળ અને દલિત સાહિત્યની ભરપૂર સામગ્રીની અપેક્ષા રહે. પણ વાચકને તેના આછા નિર્દેશો પણ મળતા નથી. તે આશ્રય પમાડે છે. મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ભાલચન્ડ્ર મુંગેકર દ્વારા યુનિવર્સિટીમાં અનામત નીતિના અમલના પાયોનિયર તરીકે નવાજાયેલા લેખક મુંબઈની થોકબંધ દલિત ચળવળોથી આટલા અધ્યૂતા રહ્યા તેનું કે તેમની વાચનકથાનું એકાદ પ્રકરણ પણ અહીં નથી તે ભારે અચરજની બાબત છે.

લેખક ગુજરાતીના અધ્યાપક, લેખક અને કોલમિસ્ટ છે. પરંતુ આત્મકથાને અહેવાલદેખન કે વૃત્તાંતથી આગળ લઈ જઈ શક્યા નથી. લેખકની અભિવ્યક્તિની સાંદરી ગમે એતી છે. પરંતુ એથી વધુની અપેક્ષા હતી. જોકે લેખક આ અંગે સભાન છે. એટલે સ્વીકારે છે કે, ‘આ આત્મકથા પ્રસ્તાવી બની છે. અને જાણે કે માહિતીનો ખડકલો રજૂ કરવામાં આવ્યો હોય એવું લાગે છે. અનુભવોનું રસાયણ સાહિત્યસ્વરૂપ પાયું નથી.’ આત્મકથામાં દક્ષિણ ગુજરાતની ભાષા-બોલીના શબ્દો(વાવલાની જમીન, ઠરકો હોકરો, ખેંખિયા કરે, સગન, ડાકુ ભરવું, તામડી, ખાપરાં, દરવેટ, ચલિયાં... વગેરે) પ્રયોજાયા છે. લેખકની શૈલી રસાળ અને સરળ છે. આત્મકથામાં મોટેભાગે પોતા વિષે વાત કરતાં ‘અમે’ કે ‘લેખક’ શબ્દનો જ ઉપયોગ થયો છે અને ત્રીજા પુરુષ એક વચનમાં વાત કરી નથી. વિગતો, વાક્યાંડો અને પ્રસંગોનાં પુનરાવર્તનો પણ ખાસ્સા છે. આરંભે અનિવાર્ય ગણાય એવું વતન વિશેનું પ્રકરણ છીક પ૧૧મા કમે અને ૧૯૮૭માં ધ્યાયેવા લેખનું પુનર્મુદ્દશ છે. એવું જ મા વિશેનું પ્રકરણ ઝ૦મું (માયોઈ) છે. દલિત સાહિત્યની સંસ્થાઓએ કે સ્વયં દલિત લેખકોએ કરેલાં દલિત સાહિત્યનાં પ્રકાશનો જોહરાઈદોષો-ભાષાદોષો-મુદ્રણ દોષોથી ભરપૂર હોય છે. આ પુસ્તક પણ તેમાં અપવાદ નથી.

મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકો છું, એવો હું સંતોષ લઈશ.” ૧૮૮૮ના સાટેમબરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બહેરામજી પટેલ. એ વળી કોણ? તમે પૂછુશો. કારણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસ, વિવેચન, કે સંદર્ભનું કોઈ પણ પુસ્તક જોઈ જાવ. આ બહમનજીનું નામનિશાન ક્યાંય જોવા નહિ મળે. જો એક વાક્યમાં ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર ગ્રંથના બનાવનાર. જેને અંતે આ શબ્દો છાપાયા છે તે પહેલું દફ્ફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાંનું છે, અને તેથી મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. એ જમાનાના ચાલ પ્રમાણે (નર્મકોશ અને નર્મકવિતા જેવાં નર્મદનાં પુસ્તકો પણ આ રીતે પ્રગટ થયેલાં), પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલાં દફ્ફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફ્ફતર પણ પહેલાં આઈ ભાગમાં છાપાયું અને પછી ૧૯૭૧માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફ્ફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલ કર્યું હતું. કારણ ૧૯૦૮ના સાટેમબરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા. જોકે આ બીજા દફ્ફતરની પ્રસ્તાવના છીક જૂન ૧૮૮૧માં બહમનજીએ લખી રાખી હતી તે પુસ્તકમાં મૂકવામાં આવી છે. તેમાં તેઓ લખે છે: “આ જગોએ હું ફરીથી જણાઉં છું કે આ પુસ્તક રચયામાં મેં એક જ ધોરણે કામ લીધું છે, અને એક ખરેખરી બીનાઓનો સંગ્રહ કરનાર તરીકે જે ખાતરી થઈ શકે એવું મલયું તે એકદૂં કીદ્યું છે.” ત્રીજા દફ્ફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોંબે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરાઝોરજી પેમાસ્તરે. આ દફ્ફતર પણ ૧૮૨૦માં ગ્રંથ રૂપે છાપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે. પ્રસ્તાવનામાં પેમાસ્તર જણાવે છે કે આ દફ્ફતર માટેની કેટલીક નોંધો પણ બહમનજી તૈયાર કરી ગયા હતા તેમાં સુધારાવધારા કરીને પોતે અહીં રજૂ કરી છે. અલબાત,

પારસી પ્રકાશ – બહમનજી પટેલ  
દફ્ફતર આશકાચા, મુંબઈ, ૧૮૭૮-૧૮૮૮

તિશે  
દીપક મહેતા

### પારસી તવારીખનો અમૃત્ય આકર્ષણ્ય

“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફ્ફતર અતરે ખતમ થયું છે. એ દફ્ફતર ૧૦ વર્ષે છિપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોક્યો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉષ્યોગી થઈ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દીલમાંની

પોતાને યોગ્ય લાગ્યા તેવા કેટલાક ફેરફાર પણ તેમણે સામગ્રીની પસંદગી અને રજૂઆતમાં કર્યા છે. આ ગ્રંથનાં કુલ દસ દફ્ફાતર પ્રગટ થયાં હોવાની માહિતી આ લખનારને મળી છે. દસમાં દફ્ફાતર ૧૮૬૭ વિદેશ રના વર્ષ આગળ આવીને અટકે છે. પણ ગીજા દફ્ફાતર પછીના ભાગો એક પછી એક આંદ્રા અને ઉપરાંત્વા થતા ગયા. સંદર્ભ માટેનાં સાધનો તો વીસમી સદીમાં વધતાં ચાલ્યાં હતાં, પણ તેનો સૂઝ અને સમજપૂર્વક ઉપયોગ કરી શકે તેવા, બહુમનજી જેવા સંપાદકો પછીથી મળ્યા નહિ.

ઓગણીસમી સદીનો મુંબઈ ઠિલાકો, તેમાં વસતા પારસીઓ, તેમનાં ધર્મ, ભાષા, સાહિત્ય, છાપાં અને સામયિકો, નાટકો અને રંગભૂમિ, તેમનાં છાપાણાં, તેમનાં પુસ્તકાલયો, આ બધાં સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ – આ અને આવા બીજા અનેક વિષયો અંગે ખરેખરી લગન અને જહેમતથી સંશોધન, અભ્યાસ, વિવેચન, સંદર્ભ, વગેરે કરનાર માટે પારસી પ્રકાશનાં પહેલાં પણ દફ્ફાતર સોનાની ખાણ જેવાં છે. પણ કમનસીબે આજ સુધી એમાંનું કોઈએ એકાદું કિરણ પણ જીલ્યું નથી. હકીકતમાં, પારસી પ્રકાશની સહાય વગર લખાયેલું ૧૮મી સદીનાં ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, નાટક, રંગભૂમિ, વગેરે વિશેનું કોઈ પણ પુસ્તક અધૂરું જ ગણાય, પણ આપણાને આવી તો ઘડી અધૂરપો કોઠે પરી ગઈ છે.

પણ આ પુસ્તકમાં એવું તે શું છે? પહેલા દફ્ફાતરના ગાઈટલ પેજ પર છાયું છે : "પારસીઓ ઠિચાનથી હિન્દુસ્તાન આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં તેઓના સંબંધમાં બનેલા અગત્યના બનાવોની વર્ષોને અનુકૂમે નોંધ." 'અત્યાર સુધી' એટલે ૧૮૬૦ સુધી. એ જમાનાના ચાલ પ્રમાણે શરૂઆતનાં પાણાં ગુજરાતી તેમ જ અંગેજમાં છે. પ્રસ્તાવના પણ આ બંને ભાષામાં છે. પારસીઓના આગમન અંગેની થોડી વિગતો શરૂઆતમાં આપી છે. તે પછી પુસ્તકમાં સૌથી પહેલી તારીખ-વાર સાથેની એન્ટ્રી ઈંસો ૮૮૮૮ના ડિસેમ્બરની બીજી તારીખની છે. મુંબઈ પાસે આવેલી કેનેરીની ગુજરાતી જોવા એ દિવસે ૧૭ પારસીઓ આવ્યા હતા. તેમણે પોતાનાં નામ ત્યાં આગળ એક તખ્તી પર કોતર્યાં હતાં. પુસ્તકમાં પાદટીપમાં આ ૧૭ નામ પણ આપ્યાં છે. અને આ પહેલી એન્ટ્રીથી જ પુસ્તકની કેટલીક

ખાસિયત હતી થાય છે. બધાં દફ્ફતરોમાંની બધી જ માહિતી કાલાનુકૂમે રજૂ થઈ છે. જે બાબતો અંગે તારીખ-વારની ખાતરી ન થઈ શકી હોય, પણ વર્ષ નક્કી થઈ શક્યું હોય તેની માહિતી જેને વર્ણને અંતે મૂકી છે. મોટા ભાગની એન્ટ્રીઓની બાબતમાં મૂળ એન્ટ્રી એક-બે લીટીની હોય, પણ તેની સાથેની પાદટીપ લાંબીલયક અને વધુ ઉપયોગી હોય તેવું બન્યું છે. ઘણી વાર તો પાદટીપ એક-બે પાનાં પણ રોકે છે. પાદટીપ વગરની તો આ પુસ્તકમાં ભાગે જ કોઈ એન્ટ્રી જોવા મળે છે. એટલે પુસ્તકનો ઘણો મોટો ભાગ પાદટીપો રોકે છે. એક નમૂનો જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. ભાષા તથા જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે.

૧૮૪૮. તા. ૬ સપ્ટેમ્બર.

આજ દીને "સ્ટુંટસ લીટરરી એન્ડ સાએન્ટીઝીક શોશાઈટી"ની તરફથી ગુજરાતી તથા મરાઠી ભાષામાં આપણા દેશીઓમા જ્ઞાનનો ફેલાવો કરવાને બે શાખા મંડલીઓ સ્થાપવામાં આવી હતી, અને તેમનાં નામ ગુજરાતી તથા મરાઠી 'જ્ઞાન પ્રસારક મંડલી' એ પ્રમાણે રાખવામાં આવ્યાં હતાં. ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડલીમાં મોટો ભાગ પારસી વિદ્યાર્થીઓએ લીધો હતો.

મૂળ એન્ટ્રી તો આટલી જ છે, પણ તેની સાથેની પાદટીપ લગભગ દોડ પાંનું રોકે છે. તેમાં જે માહિતી આપી છે તે આ પ્રમાણે છે :

૧. પહેલી કમિટીના પાંચ પારસી સભ્યોનાં નામ, ત્યાર બાદ એ મંડળીનું કામકાજ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી તેની કમિટીના પારસી સભ્યોનાં નામ.
૨. એ મંડળી તરફથી 'જ્ઞાન પ્રસારક' નામનું ચોપાનિયું ઈંસો ૧૮૪૮ના જુલાઈથી ૧૮૬૦ના ડિસેમ્બર માસ સુધી પ્રગટ થયું હતું તેની માહિતી અને વખતોવખત તેના 'અધિપતિ'ના સ્થાને રહેલા પારસીઓનાં નામ.
૩. તેને આર્થિક મદદ કરનારાઓનાં નામ અને રકમ.
૪. મંડળી તરફથી યોજાયેલી ઇનામી નિબંધસ્પર્ધાઓની તથા નિબંધોના પ્રકાશન અંગેની વિગતો.
૫. ૧૮૪૮ના ઓક્ટોબરથી ૧૮૫૮ના ફેબ્રુઆરી સુધીમાં પારસી ગૃહસ્થોએ વાંચેલા નિબંધો અને આપેલાં ભાષણોની વિગતો. (પારસી પ્રકાશ દફ્ફાતર ૧, પૃષ્ઠ ૫૧૨-૫૧૩)

બીજું એક ઉદાહરણ :

૧૮૭૩. ૧૦મી ઓગસ્ટ.

શેઠ બહમનજી ડોશાભાઈ મુનશીએ ઇન્ગ્રેજી, ગુજરાતી, ડિઝ્યુન્યાની અને ફારસી ભાષાઓની વાક્યાવળીની એક મોટી ચોપડી રચી પ્રગટ કીધી હતી. એ ચોપડીની શરૂઆતમાં એવાં પોતાના બાવા મરહુમ શેઠ ડોશાભાઈ શોહરાબજી મુનશીની જીન્દગીનો થોડોક હેવાલ આપ્યો હતો.

આ એન્ટ્રી સાથેની પાદ્ટીપમાં એ પુસ્તકના અંગ્રેજી મુખપૃષ્ઠ પરનું બધું લખાણ આપ્યું છે, જે નીચે પ્રમાણે છે

A new self-instructing work entitled Idiomatic Sentences, in the English, Gujarati, Hindustani, and Persian languages. The whole in oriental and Roman characters; in seven parts, with notes explanatory and illustrative: to which are added copious vocabularies in military, political, naval, mercantile, fiscal, and medical words and expressions. By Bahmanji Dosabhai, Munshi, with a memoir of the late Mr Dosabhai Sohrabji, Munshi. Bombay: printed at the Reporters Press by Merwanji Nowrojee Daboo, ૧૮૭૩.

આ વાંચતાં એ પુસ્તકનાં સ્વરૂપ અને સામગ્રી અંગેની ઘણી વધુ માહિતી મળી રહે છે.

એ વખતે સરકારી દફતરોમાં, લાયબ્રેરીઓમાં, અંગત સંગ્રહોમાં જે-જે હસ્તપત્રો, પુસ્તકો, સામયિકો, છાપાં, અહેવાલો, દસ્તાવેજો, વગેરે મળ્યાં તેમનો આધાર લેખકે આ પાદ્ટીપોમાં આપ્યો છે. એટલે 'નાડમૂલમૂલ' વિષ્યાની ડિચિતનું આ પુસ્તક એક ઉત્તમ ઉદાહરણ છે. આ પાદ્ટીપો બીજા એક કારણસર પણ ખૂબ મહત્વની બની રહે છે. લેખકે જે વર્તમાનપત્રો, સામયિકો, દસ્તાવેજો, વગેરેને અહીં ટંક્યાં છે તેમાંનાં ઘણાં આજે નાશ પામ્યાં છે, અથવા અત્યંત દુર્લભ બની ગયાં છે.

કેવી છે આ પારસી પ્રકાશમાંની સામગ્રી?

૦ રતનજી ફરામજી વાઇના પુસ્તક 'મુંબઈનો બાહાર' (આજે અત્યંત દુર્લભ બનેલું પુસ્તક)ને આધારે લેખક જણાવે છે કે ઈંસં ૧૬૪૦માં પહેલવહેલો પારસી, નામે

દોરાબજી નાનાભાઈ, સુરત પાસેના સુમારી ગામમાંથી પોતાના કુટુંબ સાથે મુંબઈ આવી વસ્યો હતો.

૦ ગુજરાતી ભાષાનું પહેલું સામયિક 'વિદ્યાસાગર' નવરોજી ફરહુનજીએ ૧૮૪૦ના સાટેમબરની પહેલી તારીખે શરૂ કર્યું હતું. આ માસિકના અંકની કિમત દોઢ રૂપિયો હતી. ૧૮૪૬ના જૂન સુધી નવરોજીએ આ માસિક ચલાયું હતું. એ દરમાન તેઓ જામે જમશેદના તંત્રી પણ હતા. પછી કુંવરજી મોદીએ એ ચલાવવા લીધું, પણ તે જ વર્ષના ડિસેમ્બર અંક પછી તેમણે તે બંધ કર્યું.

૦ મુંબઈમાં પહેલવહેલું ગુજરાતી નાટક ૧૮૫૭ના ઓક્ટોબરની ૨૮મી તારીખે સાંજે ગ્રાન્ટ રોડ પરના શિયટરમાં બજવાયું હતું. તેનું નામ રૂસ્તમ અને સોરબ. સાથે ધનજી ગરક નામનું ફારસ પણ બજવેલું. તેમાં જે પારસીઓએ ભાગ લીધો હતો તેમનાં નામ પણ આપ્યાં છે. તેમાં નર્મદ અને કરસનદાસ મૂલજીના મિત્ર અને યુનિયન પ્રેસના માલિક નાનાભાઈ રાણીનાનું નામ પણ જોવા મળે છે. ટેલિગ્રાફ એન્ડ ફુરિયર નામના અંગ્રેજ છાપાનો હવાતો આપીને લેખક કહે છે કે "પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટકશાળા તમાસગીરોથી ઉભરાઈ ગઈ હતી."

૦ આપણી ભાષાનું સ્ત્રીઓ માટેનું પહેલું માસિક 'સ્ત્રીબોધ' ૧૮૫૭ના જાચ્યુઆરીની પહેલી તારીખથી શરૂ થયું હતું. તેનો હેતુ 'દેશી સ્ત્રીઓને ફૂરસદને વખતે નીરદોશ રમૂજ અને ઉષ્યોળી જ્ઞાન' આપવાનો હતો. તેના સંચાલકો માત્ર પારસીઓ જ નહોતા. નાનાભાઈ હરિદાસ જેવા બિનપારસી પણ તેમાં હતા. શરૂઆતમાં સ્ત્રી બોધનું વાર્ષિક લવાજીમ માત્ર એક રૂપિયો હતું એટલે ખોટ જતી હતી. એ ખોટ સરબર કરવા માટે ડોસાભાઈ ફરામજી કામજીએ બે વર્ષ સુધી ૧૨૦૦ રૂપિયાની મદદ કરી હતી. પણ પછી વધુ ખોટ ખમી શકાય તેમ ન હોવાથી ૧૮૫૮થી દફીતર આશકારા છાપાખાનાના માલિકો બેહરામજી ફરહુનજીની કંપનીને 'સ્ત્રીબોધ' સોંપવામાં આવ્યું. (આ બેહરામજી તે મુંબઈ સમાચારના સ્થાપક ફરહુનજી મર્જબાનના દીકરા.) 'સ્ત્રીબોધ'ના પહેલા અધિપતિ (એ વખતે તંત્રી માટે વપરાતો શબ્દ) હતા બેહરામજી ખરશેદજી ગાંધી. તે પછી અનુક્રમે સોરાબજી શાપુરજી બંગાલી,

જાંગીરજી બરજોરજી વાટા, નાનાભાઈ હરિદાસ, સોરાબજી જાંગીરજી તાવેયારખાં, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રસ્તમજી રાણીના, નાનાભાઈ નશરવાનજી માસ્તર, વગેરે ‘ક્રીબોધ’ના અધિપતિ બન્યા હતા. ૧૮૭૦થી કેખશરૂ નવરોજજી કાબરાજી તેના તંત્રી બન્યા હતા.

૦ ‘અમેરિકાની મુસાફરી’ નામનું એક પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયું હતું પણ તેમાં ક્યાંય તેના લેખકનું નામ છાયું નથી. પણ પારસી પ્રકાશના બીજા દફ્તરમાં શેડ પીરોજશાહ પેસ્તનજી મેહરહોમજી તેના લેખક હતા અને લીવરપ્લૂલથી ન્યૂ યૉર્ક સુધીની દરિયાઈ મુસાફરી તેમજે દોસ્ત ડોસાભાઈ ફરામજી કામાજી સાથે કરી હતી એમ જજાબ્યું છે. આ પુસ્તક ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે મુંબઈમાં પ્રગટ થયું હતું. પણ આ પીરોજશાહ હતા કોણ? તેનો જવાબ પણ પારસી પ્રકાશમાંથી મળે છે. ઇન્નંદંમાં રહેતા જરથોસ્ટીઓની સંખ્યા વધવાથી ત્યાં એક ધર્મનું ફૂડ કરવાની જરૂર જણાઈ અને એટલે ૧૮૬૧ના ઓક્કોબરની ઉ૧મી તારીખે લંડનમાં એક સભામાં ‘ધૂરોપના જરથોસ્ટીઓનું ધર્મનું ફૂડ’ સ્થાપવામાં આવ્યું હતું. તેની પહેલી કારોબારીના પીરોજશાહ એક સભ્ય હતા. વળી આ જ પીરોજશાહે ૧૮૭૭ના માર્ચની ગીજ તારીખે મુંબઈમાં માટીના ‘ઈનેમલ’ કરેલાં વાસણો તથા બીજી શાણગાર માટેની વસ્તુઓ બનાવવાનું કારખાનું ‘પીરોજશાહ પોટરી વર્ક્સ’ નામથી શરૂ કર્યું હતું. એટલે કે પીરોજશાહ રહેતા હતા ઇન્નંદ, પણ મુંબઈ સાથે તેમના વ્યાપારી સંબંધો હતા.

૦ ૧૮૬૦ સુધીમાં પારસીઓએ કુલ ૨૬ વર્તમાનપત્રો શરૂ કર્યા હતાં. તેમાંનાં કેટલાંક ઓછાં જાઇપીતાં : અમબારે સોદાગર, ચીતર ગનેરાન દરપણ, પારસી મીતર, પુણા આભીરવર, બાગે નશીહત, બેલગામ મેસેન્જર, મુંબઈ દૂરબીન, સુરતના શમાચાર, સૂરીઅ પરકાશ.

૦ ૧૮૬૦ સુધીમાં પારસીઓએ ૧૭ ‘ચોપાનિયાં’ (સામયિકો) શરૂ કર્યા હતાં. તેમાંનાં કેટલાંક ઓછા જાઇપીતાં : ખોલાસે જાદુ, જગત પરેમી, જગત મીતર, જગત વરણન, વીઠાસ સાગર, શાશ્ત્રી વીઠાસ, સુરતના પરહેજગાર.

૦ ૧૮૬૦ સુધીમાં પારસીઓનાં બનાવેલાં ૧૭૭

પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં કેટલાંક : અઝીજના વેપારની તવારીખ, ઈન્દ્રોજના રાજનું સુખ, દરએક માઝસનો વેદ, દેશીઓની કેલવણી તથા તેના પરીજામ, બચાંઓની સંભાલ વીશે પુસ્તક, બાલક દીકરીની હત્યા બાબત ગ્રંથ, રમુજે શેતરંજ, રાગશથાન પોથી, શરીર શાન્તી, હિંદુસ્થાનના બળવાનો ગરબો, જ્ઞાન ગરબી.

આ ગ્રંથની એક મુશ્કેલી છે તેમાંથી હગલાબંધ સામગ્રી. છાપાંઓ, ચોપાનિયાં વગેરેમાંથી જે માહિતી મળી તેમાંથી શું લેવું અને શું જતું કરવું તેનો આજો વિચાર બહુમનજીએ અને પેમાસ્તરે કર્યો નથી. પરિણામે જેનું દસ્તાવેજ મૂલ્ય નહીંવત્ત હોય તેવું ઘણું અહીં છે, અને તેમાંથી જરૂરી અને ઉપયોગી સામગ્રી તારવવાનું કામ મહેનત માગી લે તેવું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અંગે ટકોર કરતાં લખ્યું હતું :

Practically the chronicle is confined to the nineteenth century which occupies all its spacious pages with the exception of hardly a hundred devoted to the preceding eight or ten centuries since their arrival in India. The early centuries are dismissed in barely ten pages for paucity of materials available to the compiler, whilst the nineteenth century is treated in such superfluous detail to the extent of some fifteen hundred pages for its first eighty years, because there was plenty of material in the shape of newspapers, and Mr. Patel actually recelled in old files, paying little heed to the intrinsic value of the extracts he printed and their bearing on the growth of the community in his zeal for gleaning information about his people.

તો બીજી બાજુ માહિતીની બહુલતાને ‘સાંજ વર્તમાનના અવલોકનકારે આ પુસ્તકની આગવી વિશીષ્ટતા ગણવી હતી અને કહ્યું હતું :

“ટુંકમાં મુંબાઈ તથા દેશાવરના પારસીઓને લગતી દરેક ધાર્મિક, સંસારીક, અભ્યાસ, કેળવણી, સાહીત્ય, સખાવત વીગેરે અનેક બાબતો, માનઅકરામ, ઓધાઓ, સુધાં જે જે બાબદોથી આપણી કોમના નબીયાઓએ કીર્તી મેળવી હોય યા કોમના પ્રકાશમાં વધારો થયો હોય એ અને

વીસતારવામાં આવી છે. એ રીતે કોમની તવારીખ જાહેરમાં લખવાને બની શકે તેને માટે પુરતાં સાધનો અને તૈયાર કરેલાં છે જેનો ઉપયોગ હજી સુધી કોઈ લાયક નરે કીધો નથી તે જોઈ અજાયબી ઉપજે છે.

તો જામે જમશેદના અવલોકનકારે આ ગ્રંથનું મહત્વ સ્વીકારવાની સાથોસાથ તેમાં પારસીઓની માત્ર ઉજળી બાજુ જ બતાવી છે, સાથોસાથ કાળી બાજુ પણ બતાવવી જોઈતી હતી એવી ટકોર કરતાં કહ્યું છે :

"પારસી પ્રકાશ એ પારસી કીરતીનો સંગ્રહ છે, તેમાં કોમને લગતી થોડીક કાળી બાજુ પણ દેખાડી હોય તો તે આગળ જતાં કોમને, લેખકોને, વરતમાનપત્રોવાળાઓ, અને વક્તવ્યાને ઘણી કામની થઈ પડ્યો. કોમના મહત્વના સવાલની તપાસ કરવા માટે કોમની statistics એ જ મુખ્ય આધાર છે, અને તે નોંધનારું એકલું પુસ્તક પારસી પ્રકાશ છે."

તો રાસ્ત ગોફ્ફતારે ડેંક વિચિત્ર શૈલીમાં બહુમનજીની મહેનતને બીરદાવી હતી. લખ્યું હતું:

"આ કામ એટલું કંયાળાનું, પુષ્ટ વાંચન અને મહેનતનું છે, કે ખા. બા. બહુમનજી પટેલ જેવા જ ઠંડા સ્વભાવવા અને ગધ્યાઈ મહેનતને મહેનત નહિ પણ રમત ગણનારા શોકીન ગૃહસ્થો જ તે ઉપાડી શકે."

પણ પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફ્ફતરમાં માહિતીનો જે ભંડાર બર્યો છે તેમાંથી જોઈતી માહિતી શોધવી કર્દી રીતે? જે વખતે 'રિડર ફેનદલી' જેવો શબ્દપ્રયોગ પ્રચારમાં આવ્યો નહોતો ત્યારે વાચક, અભ્યાસી, સંશોધકને અત્યંત ઉપયોગી થાય એવી સૂચિ ત્રણે દફ્ફતરને અંતે મૂકી છે. દરેક સૂચિને પહેલાં બે ભાગમાં વહેંચી છે. એક, વ્યક્તિ નામ સૂચિ, જેને 'આ પુસ્તકમાં આવેલા પારસી નામોનું સાંકળિયું' તરીકે ઓળખાવી છે. તેમાં જેને વ્યક્તિના મૃત્યુ અંગેની માહિતી જે પાના પર આવતી હોય તે પાનાનો આંકડો બોલ્ડ ટાઇપમાં છાપ્યો છે. બીજું સાંકળિયું છે 'આ પુસ્તકમાં આવેલી બાબદોનું' એટલે કે આજની પરિભાષામાં વિષય સૂચિ. વળી તેમાં વિષયોનું ચ્રૂપિંગ કર્યું છે, જેમ કે, પુસ્તકો પારસીઓનાં, ચોપાનિયાં પારસીઓનાં, વવસાયો પારસીઓનાં, વગેરે. આથી વાચક શોધતો હોય તે માહિતી ઉપરાંત તેની આસપાસની બિજી માહિતી પણ તેને

સાથોસાથ મળી રહે તેમ છે. પહેલા દફ્ફતરમાં વ્યક્તિ નામોની સૂચિ ૮૮ પાનાં રોકે છે તો વિષય સૂચિ ૪૭ પાનાં. બીજા દફ્ફતરમાં વ્યક્તિ નામ સૂચિ ૮૮ પાનાંની છે, તો વિષય સૂચિ ૭૨ પાનાંની. ત્રીજા દફ્ફતરમાં બંને સૂચિ કુલ ૨૨૦ પાનાં રોકે છે. આ બધી જ સૂચિઓ બે કોલમમાં છિપાઈ છે.

પણ પારસી પ્રકાશના આ ગ્રંથો જોવા કયાં મળે? આજે બહુ ઓછાં પુસ્તકાલયોમાં તેની નકલો સચ્ચવાઈ છે, અને જ્યાં સચ્ચવાઈ છે ત્યાં પણ તે ઝર્ણ હાલતમાં છે. મુંબઈમાં કે. આર. કામા ઓલિયેન્ટલ ઇન્સ્ટીટ્યુટ અને જે. એન. પિટિટ લાઈબ્રેરીમાં નકલ જોઈ શકાય. ફાર્લસ ગુજરાતી સભા પાસે બે દફ્ફતરની ઝર્ણ થઈ ગયેલી નકલ છે. નવસારીની મહેરજી ચાણા લાઈબ્રેરીમાં પણ પહેલાં સાત દફ્ફતરની નકલ સચ્ચવાઈ હોવાની માહિતી મળે છે. પણ ૧૮મી સહીના અભ્યાસી માટે તો આ ગ્રંથનાં પહેલાં ત્રણ દફ્ફતર જ મહત્વનાં છે. તેની ડિજિટલ નકલ સીડી/ડીવીડી પર ઉપલબ્ધ છે. અમેરિકાની સ્થુમેનિટીજ કમ્પ્યુટિંગ લેબોરેટરી પાસેથી તે મેળવી શકાય. વધુ વિગતો માટે આ સરનામે ઈમેલ મોકલવો: rkunst@humancomp.org

આવું ગંજાવર કામ એકલે હાથે કરનાર આ બહુમનજી હતા કોણ મુંબઈના પટેલનો હોદ્દો લાગલગાટ ૧૬૫ વર્ષ સુધી ભોગવનાર દોરાબ પટેલ અને કાવસજી પટેલના ખાનદાનના આ નબીરાનો જન્મ ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૮મી તારીખે મુંબઈમાં. ૧૮૦૮ના સાએમ્બરની નવમી તારીખે મુંબઈમાં જ એ બહેસ્તનશરીન થયા. અંગ્રેજ કેળવણી એલિન્સ્ટન હાઈસ્ક્વુલમાં, ફારસીનું શિક્ષણ મુલ્યાં ફિરોજ મદરેસામાં. ૧૮૭૧માં જરથોસ્તી ધર્મ વિશેનો એક ઈનામી નિબંધથી તેમણે લખવાનું શરૂ કર્યું. એ જ વર્ષ 'અહેવાલે ફિરદોસી'નો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો. 'ઈરાનની મુખ્યેસર હકીકત' નામનું તેમનું પુસ્તક ૧૮૭૨માં પ્રગટ થયું, જેની ચાર આવૃત્તિઓ થઈ હતી. ૧૮૭૧થી જ તેમણે 'પારસી પ્રકાશ' માટેની સામગ્રી ભેગી કરવાનું શરૂ કર્યું હતું. તેમના અવસાન વખતે આ સામગ્રીની ૨૦૦ જેટલા ચોપડામાં બનાવેલી 'સ્કેપ બુક' તેઓ મૂકતા ગયા હતા. આ સામગ્રી ભેગી કરવા માટે તેમણે અવારનવાર મુસાફરીઓ કરી હતી. છાપાં અને ચોપાનિયાંની ફાઈલો

ઉપરાંત જૂના દસ્તાવેજો, લેખો, પત્રો, અહેવાલો, વગેરે જોયાં હતાં. જરૂર પ્રમાણે જુદી જુદી વ્યક્તિઓને મળ્યા હતા. પણ આ બધું તેમને માટે પોથીમાંનાં રીંગશાં જેવું ન હતું. તેમાંની ઘણી માહિતી તેમની યાદદાસ્તમાં પડી સચ્ચવાઈ હતી, અને કોઈ જિજ્ઞાસુ તેમને પૂછી તો ઘણી વાર પોતાની નોંધો જોયા વગર યાદદાસ્ત પરથી જ તેઓ જવાબ આપી શકતા. ‘પારસી પ્રકાશ’ કરતાં ઓછું જાણીતું, પણ તેટલું જ મહત્વનું અને મહેનતભર્યું તેમનું બીજું પુસ્તક છે ‘પારસી મરત્યુકો.’ મુંબઈમાં અંગ્રેજ અને ગુજરાતી છાપાં શરૂ થયાં ત્યારથી માંગીને ૧૮૬૦ સુધીમાં તેમાં પારસીઓ માટેની જે જે મૃત્યુનોંધો પ્રગટ થઈ હતી તેનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. આવી પણ નોંધો અહીં આપી છે. તેમાંની ૪૧૬ ગુજરાતી અને બાકીની અંગ્રેજ છાપાંઓમાંથી લીધેલી છે. ૧૮૭૩થી બહમનજી શાન પ્રસારક મંડળી, રાહનુંમાંએ માજદીઅસના સભા, અને એન્થ્રોપોલોજિકલ સોસાયટી સાથે નિકટતાથી સંકળાયેલા હતા અને તેમાં તેમણે અવારનવાર નિબંધો લખીને ૨૪૪ કર્યા હતા. મુંબઈમાં પહેલી વાર મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ પારસી વિસ્તારોમાં ઘરે ઘરે ફર્યા હતા અને મરકી અટકવવાની દવા લેવા માટે લોકોને સમજાવ્યા હતા. તેમની આ સેવાની કદર રૂપે બ્રિટીશ સરકારે તેમને ‘ખાન બહાદુરનો ઈંડ્કાબ આપ્યો હતો, અને ૧૮૮૪માં તેમને ‘જિસ્ટિસ ઓફ પીસ’નો માનભર્યો હોક્યો આપ્યો હતો. ૧૮૦૦-૧૮૦૧માં તેઓ મુંબઈની મ્યુનિસિપાલીટીમાં ચૂંટાઈ આવ્યા હતા. ૧૮૦૧માં પહેલાં ૨૬ વર્ષની ઉમરના એકના એક દીકરાનું અને પછી એકના એક ભાઈનું અવસાન થતાં તેના કારી ઘાને પરિણામે બહમનજીની તબિયત લથડવા માંડી. ‘પારસી પ્રકાશ’નું તેમનું કામ કેટલું તો મહત્વનું છે એ વાત ધ્યાનમાં આવવાને લીધે બહમનજીની હૃતીમાં જ તેમની યાદને કાયમ રાખવાના હેતુથી એક ફેંડ શરૂ કરવામાં આવેલું. ‘બ. બે. પ.’ની સહીથી જ્ઞમશોદમાં પ્રગટ થતા તેમના લેખો પણ સારા એવા લોકપ્રિય થયા હતા. સાંજ વર્તમાન’ તેમને અંજલિ આપતાં લખે છે કે “જો કે મરહુમ મી. બમનજી પૈસે તવંગર ન હતા, તોબી દિલે તવંગર હતા. તેઓએ પારસી કોમ માટે જે રંજ ખેંચી હતી તે ઘણાક શ્રીમંતુ ગૃહસ્થોએ ગોખી રાખવા જોગ દાખલો પૂરો પાડે છે.” ‘રાસ્ત ગોકૃતાર અને સત્ય પ્રકાશ’

તેમને અંજલિ આપતાં લખે છે: ‘જાતે સાદા, સ્વભાવે મિલનસાર, ખવાશે ઉમદા હોવાથી મી. બહમનજી પટેલ ઘણું સાંભળતા, ઘણું કરી બતાવતા, પણ થોડું જ બોલતા હતા.’ કેસરે ડિંડે’ તેના અંજલિ લેખની શરૂઆત આ રીતે કરી હતી. “પારસીઓને પ્રકાશમાં લાવનાર તારો અસ્ત પાખ્યો છે.” આખી જિંદગીની મહેનતના ફણ જેવી પારસીઓ અંગેની બધી જ નોંધો પોતાના મરણ પછી પારસી પંચાયતને આપવાનું તેમણે પોતાના વસ્તિયતનામામાં જગ્ઘાવ્યું હતું. કુટુંબોના, શાતિઓના, ગામ કે શહેરના ઇતિહાસ કે તવારીખનાં પુસ્તકો આપજો ત્યાં છે. પણ એક આખી કોમની આટલી વિગતવાર, સાધાર, સરંગ, લાંબા સમય ગાળાને આવરી લેતી, વિસ્તૃત એવી બીજી કોઈ તવારીખ આપણી ભાષામાં તો લખાઈ નથી જ, પણ દેશની પણ બહુ ઓછી ભાષાઓમાં લખાઈ હશે. □

## પારસી પ્રકાશ,

અથવા

પારસીઓએ દીરંનથી હિંદુસ્થાન આવ્યા ત્યારથી ત ઈં સં ૧૮૬૦  
સુધીમાં તચ્ચોના સંબંધમાં બનેલા અગત્યના બનાવેની

વર્ણન અનુક્રમે નાથ.

દ્વારા ૧ લું;—૧૧ લાગેનાં.

૨૪ ના ૨,

બહુમનજી બેહદાંમજી પટેલ.

સુંદરી,

દ્વારા આશકારા ધારાધારા મધે,

દ્વારા નવેનજી નવેનજી મધે,

દ્વારા:—પ્રકાશન પટેલ સી, નાં ૧૦. ૮૦.

૧૯૫૧ ચં ૧૧૧ ઈં ૧૮૭૮ ઈંદ્રિય—૧૨૪૮ માનદારી;

અતિમ અને ૧૧૧૮ ઈંદ્રિય—૧૨૪૮ માનદારી.

પારસી

અધ્યાત્મમાન ૨૦૧૯ ૨૨

[‘પરિચય ભિત્તાક્ષરી’માં પુસ્તકોનો બાબ્ય પરિચય આવરી લેવામાં આવે છે ને ‘સમીક્ષા’માં પુસ્તકોની અંતરંગ, સદદ્ધારણ, મૂલ્યાંકનલક્ષી વિશેષ તપાસ કરાવવાનો ઉપકમ હોય છે. પણ સમીક્ષા લખાઈને આવવામાં વિલંબ થવાના, ક્યારેક સમીક્ષા ન પણ થયાના પ્રસંગો બનતા રહે છે. એટલે, મળેલાં પુસ્તકોમાંથી શક્ય એટલાં વધારેના સમીક્ષિત પરિચયને આવરી લેવાના આશયથી ‘અવલોકન’ વિભાગ દાખલ કરીએ છીએ. વર્ષો પહેલાં ‘પ્રત્યક્ષ’માં ‘ટૂંકાં અવલોકન’ નામે આવી સંક્ષિપ્ત સમીક્ષાઓ કરેલી, કરાવેલી.

આમાંનાં કોઈ પુસ્તકોની આગામી અંકોમાં વિગતવાર સમીક્ષા પણ આવી શકશે. – સંપાદક.]

### ‘બંધ બારણાં’, ઘનશ્યામ ડેસાઈ.

રનાદે, અમદાવાદ, ૨૦૧૪.

‘ટોળું’ (૧૯૭૨) ઘનશ્યામ ડેસાઈનો બહુ જ્યાત થયેલો એકમાત્ર વાર્તાસંગ્રહ. એ પછી ચાર દાયકે પ્રગટ થતા આ મરણોત્તર સંગ્રહની વાર્તાઓ ઊર્મિ ઘનશ્યામ ડેસાઈએ સંકલિત કરી છે. એમાં બે વાર્તાઓ ૧૯૬૪ની છે એટલે કે લેખક પોતે પહેલાં સંગ્રહમાં એ સમાવી ન હતી. એમાંની પહેલી વાર્તા ‘વાત પૂરી થઈ’ કંઈક અંશે ઘનશ્યામ ડેસાઈની બાળવાર્તાઓની લઢણવાળી રસપ્રદ વાર્તા છે. આ સંગ્રહમાં લેખકે ૨૦૦૫ સુધી લખેલી વાર્તાઓ છે. (દરેક વાર્તાને અંતે અનુનું રચના-વર્ષ લખવાની કાળજી સંકલનકરે રાખી છે.) છેલ્લી, ‘બંધ બારણાં’ નામની તર પાનાંની લાંબી – ‘ટોળું’ના કુળની કહી શકાય એવી વાર્તાને બાદ કરતાં, બાકીની વાર્તાઓ ટૂંકી, છ-છ, આઠ-આઠ પાનાંની છે. ઘણીખરી વાર્તાઓ રસપ્રદ અને ઉત્તમ કહી શકાય એવી છે, થોડીક વાયામમું, સરેરાશ વાર્તાઓ પણ છે.

પરંતુ આ સંગ્રહની વાર્તાઓને અંતે, જુદે જુદે સમયે ને પ્રસંગો નીતા રામેયા (૧૯૭૮), હીના શાહ (૧૯૮૭), ‘નિશાની’ માસિક (૧૯૯૮), રાધેશ્યામ શર્મા (૨૦૦૪) અને કિરીટ દૂધધાત (૨૦૦૬) દ્વારા લેવાયેલી મુલાકાતો/

પ્રશ્નોત્તરી મૂક્યાં છે. એ વાર્તાકાર-સંપાદક ઘનશ્યામ ડેસાઈના જીવનસંદર્ભનો, એમની સર્જકારીયતનો, એમના સંપાદન-કાર્યનો, વિચાર-નીતિનો એક સરસ આવેખ આપે છે. એમાં છેલ્લી (૨૦૦૬ ની) મુલાકાત વિશેષ ધ્યાનપાત્ર છે. એમાંનો એક અંશ જોઈએ.

ઘનશ્યામ: પ્રસિદ્ધ હંમેશા મને નિરથક લાગી છે. એક દાખલો આપું ‘નવનીત સમર્પણ’ના સંપાદનનાં વરસો દરમ્યાન એક ભાઈ મને આવીને મળ્યા. મને કહે, મેં ૧૦૦ પુસ્તક લખ્યાં છે. કેટલાં? ૧૦૦. મને મનમાં થયું હું આ લાઈનનો જ માણસ હોવા છતાં તેનું નામ પણ સાંભળ્યું નથી, તો એનો કોઈ અર્થ ખરો? મને થયું લખાણો ભૂલી જવાય છે. કેટલાંકનાં તેમની હ્યાતીમાં તો કેટલાંકનાં થોડા સમય પછી. લખાણનું પણ એક આયુષ્ય હોય છે.’ (૫૦-૫૩).

૦

‘રોમાંગક વિજ્ઞાનકથાઓ’ – રવીન્દ્ર અંધારિયા,

પ્રવીષ પ્રકાશન, રાજકોટ, ૨૦૧૫.

પત્રો રૂપે, પ્રવાસ-પિકનિકનાં બયાનો રૂપે, વાર્તાઓ રૂપે અહીં વિજ્ઞાનનાં કેટલાંક તથ્યો, શોધો, પ્રયોગો, વિગતોની ખરેખર ‘રોમાંગક’ અને રસપ્રદ કથાઓ છે. ‘સસ્વલાના કાન:

મિતાલીને સાન', '૦૦૭ રેટ-બોન્ડ', 'થેક્યૂ મિં હોંચી.... હોંચી....' એવાં શીર્ષકો વિસમયપ્રેરક છે અને એ જ રીતે, આવેખેલી ઘટનાઓ, મિત્રો કે શિક્ષકોએ કરેલાં એનાં સ્પષ્ટતાઓ ને અર્થઘટનો જિજ્ઞાસાપ્રેરક છે. વાતચીત-સંવાદની રીતે કથન થયેલું હોઈને કથાઓ બાળ/પૌઢ બંને પ્રકારના વાચકોને પ્રવાહમાં ખેંચી રાજે એવી બની છે. સસલાના કાન કેમ સરવા હોય છે, 'ત્રણ ચાર માળનાં ઝડ' અને બાયોઓગ્રા જિનેટિક્સ શું છે, રોબોટનાં કરતબ કેવાં છે - એ બધું, વિસમય જગાઈને, વિજ્ઞાનનાં તથ્યોપ્રયોગોને કથારૂપે ખોલી આપે છે. આ પુસ્તકનું સ્વાગત કરનાર ડોં સુશૃત પટેલે સાચું કહ્યું છે કે, બંગાળી, મરાઠી, હિન્દી...માં આ [વિજ્ઞાનકથા] સાહિત્યનું જેટલું ખેડાણ થયું છે તેટલું ગુજરાતીમાં થયું નથી.' રવીન્દ્ર અંધારિયાનું પુસ્તક એવી વૃદ્ધિમાં પ્રેરક બની શકે. લગભગ પાને પાને રેખાંકન-ચિત્રો મૂક્યાં છે એ પણ આ વિજ્ઞાનકથાઓની રસ્પદતા વધારે છે.

પરંતુ, આમાંની કેટલીક વાર્તાઓ 'વાહ! કમાલ કરી તે!', 'જાહુગર કાનિયો', સામાન્ય તરકીબો રજૂ કરતી હોવાથી આ સંગ્રહમાં અનિવાર્ય ન હતી. વળી, કેટલીક ભાષાકીય ભૂલો પર પણ ધ્યાન રાખવા જેવું હતું. અહીં અનુસ્વાર અંગે અરાજકતા છે : 'તેના વખાણ ખૂબ સાંભળ્યા છે.' 'ત્યાં ફરતા ફરતા અમને અનેક પશુ-પક્ષીઓ જોવા મળ્યા', 'કહો, ઘરે બધા મજામાં છે?' 'સરોવરના જળ સ્થિર હતા.' 'વારંવાર અમારા વાડામાં આવીને ઘેટાં-બકરાં કાચા ને કાચા ચાવી જાય છે' વગેરેમાં જરૂરી અનુસ્વારચિહ્નો ખવાઈ-ચવાઈ ગયાં છે!

૦

જિસ્સીની રૂપકક્થાઓ, અનું માવજી કે સાવલા,

ઇમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૧૫.

ખલીલ જિભાનના 'The Wanderer' નો આ વિશાદ અનુવાદ છે. આમાંની બાવને વાર્તાઓ એક એક પાનામાં સમાઈ જતી ટૂંકી, મર્મદ્વારા બોધ-સંકેત કરતી, જિભાનની લાક્ષણિક રીતએ લખાયેલી વાર્તાઓ છે. પુસ્તકને અંતે, સદ્ગત માવજી સાવલાએ ખલીલ જિભાનનો, ૧૪ પાનામાં સરસ વિગતલક્ષી પરિચય આય્યો છે.

જિસ્સી-રખડુ-વોન્ડરર દ્વારા કહેવાયેલી આ લઘુકથાઓમાં જીવનની તારવેલી સમજ - શાણપણ - રૂપકાત્મક રીતે, ઘણુંખરું પશુ-પક્ષી-કથા/કથન રૂપમાં, રજૂ થયેલી છે. પિડ રચાય છે તે દાખાંતકથાનો જ છે, બોધ કોઈ તારવણી-વાક્ય દ્વારા પણ મુકાતો નથી, માત્ર એનો સંકેત કથામાંથી પામી શકાય છે. અનુવાદ ગુજરાતી ભાષાનો તળ-સ્પર્શ પામેલો હોવાથી સુવાચ્ય ને સુવાચ્ય બને છે. જેમકે, 'જાણો કે અમારામાંનો જ કોઈ આંગણામાં બેઠો હોય...', 'ગરુડ કહ્યું: આપણે નાતીલા એવું તમને કોણે કહ્યું?', 'હે દંભી અને લબાડ - ઠાલા શબ્દોના મદારી!' વગેરે.

મૂળના સ્વાદ માટે એક કથા ઉત્તાં : 'એક શિયાળ મગરને મળ્યું, બંનેએ એકલીજાને અભિવાદન કર્યું. શિયાળે મગરને કહ્યું - 'વડીલ, બધું ઠીક ચાલે છે ને?' મગરે જવાબમાં કહ્યું - 'આજકાલ મારા નસીબે મુસીબતો જ છે; કેટલીક વાર તો મારી પીડા અને વિશાદથી ઘેરાઈને હું રડતો રહું છું. મારાં અશ્વ જોઈને બીજાં પ્રાણીઓ ટીકારૂપે કહેતાં રહે છે - 'આ તો મગરનાં આંસુ!' ... પછી શિયાળે કહ્યું: '... હું તો આ જગતનાં સૌંદર્યો સામે તાકીને જોતો રહું છું. જગતમાં બધું કેવું વિસ્મયકારક અને ચમત્કાર જેવું છે! આ બધું જોઈને મારા આનંદના ઊભરાથી ખડખડાટ હસતો રહું છું. મારાં એવાં હાસ્યોને જોઈને આ જંગલમાં બધાં કહેતાં ફરે છે - 'ઠીક છે, આ તો લુચ્યા શિયાળનું હસવું.'

૦

પંદરમું રતન - કલ્યાન દેસાઈ,

ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૫.

'ચાલતાં ચાલતાં સિંગાપોર' એ હાસ્યરસિક પ્રવાસકથાથી કલ્યાન દેસાઈની શાખ બંધાયેલી, 'Punch ત્યાં પરમેશ્વર' નામના પુસ્તકના હાસ્ય-લેખોમાં પણ એમની હાસ્ય-વિનોદ-શક્તિના ઝબકાર દેખાતા રહ્યા. 'પંદરમું રતન' પુસ્તકમાં એમની હાસ્ય-શક્તિ થાળે પડી છે એટલે કે એ સ્થિર રહી છે પણ નવા ઉન્મેષોની દિશામાં આગળ જવાનું એમણે કર્યું નથી. એનું દેખીતું અને મહત્વનું કારણ કોલમ-લેખન છે. આ પુસ્તક એમણે અર્પણ કર્યું છે: 'કોલમને (તેરા) તુજુકો

પંદર

અમદાવાદ-૩૮૦૧૧૯ ૨૭

અર્પણ).’ એમાં સરસ રમૂજ-ચાતુર્ય તો અલબત્ત છે જ, પણ એમાં જ વક્તાથી એમની સીમારેખા પણ અંકાઈ ગઈ છે. હવે કલ્યાના દેસાઈએ આ સીમારેખા ઉલ્લંઘીને આગળ જતું જોઈએ.

‘આગળ જતું જોઈએ’ એટલા માટે કહ્યું કે એ આગળ જઈ શકે એવી નર્મ-મર્મની શક્તિઓ તો એમનામાં છે. જેમકે –

‘અર્ધાંગિની’નો અર્થ તો દૂર રહ્યો, ‘પત્ની’ પણ પરિચિત નહીં, ‘વાઈફ’ કે ‘મિસિસ’ જ પરિચિત – એવી આજની વિલક્ષ્ણ પણ બહુ પરિચિત ભાષાસ્થિતિની વાતનો ઠણી કરતાં કરતાં કલ્યાના દેસાઈ ‘ગુજરાતીઓને હુંગલીશ કેટલું બધું આવડી ગયું છે?... ગુજરાતી પણ હુંગલીશમાં સમજે?’ એવો માર્મિક હડદોલો(પંચ) મારી લે છે. ને ‘મારા ભાઈ’ (= તમારા પતિ) અને ‘તમારા ભાઈ’ (= મારા પતિ)ના ગોટાળાને ચીલાચાલુથી જુદી રીતે બહેલાવી શકે છે. ને મરમાળા આરંભ પણ કરી શકે છે. જેમકે, ‘બેટા, આવતી કાલે કયું પેપર છે?’, ‘ખબર નથી પણ્યા, મેં ટાઇમટેબલ તો મમ્મીને મૂકવા આપેલું.’ વગેરે. વળી વાતચીત/સંવાદોમાં હળવાશને વહેતી કરવાની એમને સારી ફ્રાંટ છે. કેટલાક નિબંધો તો સરણી દ્વિ-પાત્રી સંવાદોમાં જ ચાલે છે. ‘લેખક શું બોલે?’ ‘એક પુસ્તકનું નામકરણ’, ‘પ્રસ્તાવના કોની પાસે લખાવવાની?’ – એવા, કંઈક કેફિયતરૂપ લેખો, બીજા ઘણા હાસ્યકારોએ લખ્યા છે તે છતાં કલ્યાના દેસાઈની પોતીકી લાક્ષ્ણિકતાને ઊંચકી આપે એવા બન્યા છે.

પરંતુ મુશ્કેલી એ થાય છે કે હાસ્ય જ્યારે સપાટીની નીચે ઊત્તરંતું નથી ને નિર્ધારિત કરેલાં કોલમ-પૃષ્ઠોમાં ફેલાતું જાય છે ત્યારે પુસ્તકમાં આવ્યું હોવા છતાં પણ એણે હજુ છાપાનો ઢાલાકો ન છોડ્યો હોય એવું લાગે છે. આવું ઘણા હાસ્યલેખકોમાં બને છે. એથી જ હવે આજે લખતા હાસ્ય લેખકમાં તો એ ન બનવું જોઈએ એવી અપેક્ષા રહે. મૂળ વાત તો એ જ કે છાપાના વાચકોની રુચિને પણ પંપાળવી જ છે કે સંકોરવી પણ છે – એ નક્કી કરવાનું રહે.

કલ્યાના દેસાઈને એ દ્વિશા પણ ઈછ હશે જ, ને તો આગમી પુસ્તક, આ પુસ્તકને ઉલ્લંઘીને આગળ જશે.

‘અદશ્ય પાત્રો’ – હરેશ ધોળકિયા.

ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૫.

ખ્યાત અને પ્રભાવક ઐતિહાસિક પાત્રોને લઈને કલ્યાનામૂલક વાર્તા/નવલકથાઓ લખાતાં હોય એ તો જાણીનું છે પણ ખ્યાત ઐતિહાસિક કથાઓમાંનાં, મુખ્ય પાત્રોની આસપાસનાં ગૌણ પાત્રોની આધીપાતળી રેખાઓનો ઉચિત આધાર લઈને એમાંથી કાલ્યાનિક, રસપ્રદ ને યાદગાર વ્યક્તિ-ચરિત્રા રચવાં – એવો ઉપકમ આ પુસ્તકમાંનાં ચરિત્રાંકનોમાં ઘણો સફળ થયો છે. અને એવાં ૧૦ ‘અદશ્ય’ ચરિત્રો આપુસ્તકમાં આપણી સામે સર્જનાત્મક રીતે મૂર્ત થયાં છે.

સર્જનાત્મકતા જેમ એના પરિણામમાં એટલે કે આવેખાયેલી ચરિત્રકથામાં છે એમ એની ઉદ્ભવકથાણે પણ છે. લેખકે ક્યારેક તો, મૂળ ઈતિહાસકથામાં જેને વિશે બે જ વક્યો હોય એવાં પાત્રોને પણ ઊંચક્યાં છે. એમનો વિચાર જ કલ્યાનાત્મક છે. જેમકે, ‘વિવેકાનંદ માંડવીમાં ગાયિકા સાથે દુપદ રાગ ગાયો’ એટલીક વિગત એમની કલ્યાનામાં પ્રસરે છે ને ‘ગાયિકા’ નામની એકસરસ ચરિત્રકથા રચાય છે.

આ ચરિત્રકથાઓમાં કથનની પ્રવાહિતા તો છે જ, પણ વિવિધ વાર્તારીતિઓની અજમાયશ પણ છે – ક્યાંક જાણીતી વાર્તા/આવેખન પ્રવૃત્તિ છે.(‘હોલી’); ક્યાંક ઐતિહાસિક વાર્તા/નવલકથાની વર્જનાત્મકતા છે. (‘સમગ્ર વંશની માતા’) તો ક્યાંક લોકકથા જેવી સાક્ષાત્ કથન પદ્ધતિ છે (‘લંઘો’), વગેરે. મોટે ભાગે સૌરાષ્ટ્રી-કદ્યી કથાઓના જેવો બહેલાવ આમાં છે જે વાતને રસપ્રદ જ નહીં, રસાળ પણ બનાવે છે. લેખકની સર્જકતાનું એ એક સીમાંકન પણ રહે છે.

લેખકમાં વાર્તાકાર ઉપરાંત શિક્ષક ને સામાજિક વિચારકની હાજરી પણ છે, પરંતુ એ પ્રચ્છન છે, કંઈક ઉદ્દીપક છે. એથી, નાની-ગૌણ-ભુલાયેલી વ્યક્તિઓનો પણ ઈતિહાસની રેખાને બદલવામાં જે ફણો છે એને ઉપસાવવા એમને ઉદ્યુક્ત કર્યા દેખાય છે.

ચરિત્રો મનમાં વસી જાય એવાં જીવંત બન્યાં છે.

‘અહુરંગી’ – સંપાદ સ્વાતિ મેઢ,

ગુજરાત, અમદાવાદ, ૨૦૧૫.

ઈં ૧૯૯૫માં ‘હાસ્યમંદિર’ પ્રકાશિત થયું એમાં રમણભાઈ નીલકંઠની સાથે વિદ્યાગૌરી નીલકંઠની હાસ્યરચનાઓ પણ હતી. ત્યાંથી લઈને ૨૦૧૫ સુધીની, ૧૦૦ વર્ષ દરમાનની, સ્ત્રી-લેખકોની હાસ્ય-કટાક્ષની ગાંધી અને પદ્ધતિઓમાંથી આ પુસ્તકમાં, દરેકની એક એમ ઉત્ત કૃતિઓ સમાવવામાં આવી છે. પરિશિષ્ટોમાં ‘કર્તા-કૃતિ પરિચય’ તથા ‘ગુજરાતી લેખિકાઓનાં હાસ્ય-કટાક્ષ લેખનાં’ પણ પુસ્તકોની યાદી મૂકવામાં આવી છે. એની સંદર્ભ-ઉપયોગિતા પણ મોટી છે.

પુસ્તકમાંનો સંપાદકીય લેખ મુદ્રાસરનો અને ઘણી બાબતોનો વ્યોતક છે. સો વર્ષના હાસ્યલેખનમાંથી પસંદગી કરવાનું, પુસ્તકો ઉપરાંત સામયિકો-વર્તમાનપત્રોમાંથી પણ કૃતિઓ શોધવાનું કામ સંપાદક જહેમતથી અને પૂરી નિષ્ઠાથી કર્યું છે. અલબત્ત, કયાંક એનાં લેખકોની પણ મદદ એમને – સામગ્રી મેળવવા માટે – મળી છે, પણ પુસ્તકો/કૃતિઓ (ક્યારેક તો બબેલાર) વાંચીને પસંદગી કરવાની સંપાદક-કામગીરી વધુ મહત્વની રહી છે.

સ્ત્રી-લેખકો દ્વારા થતું હાસ્યલેખન ભલે સાવ જુદી નહીં પણ કેટલીક લાક્ષણિક રેખાઓ તો ઉપસાવે જ. અને અહીં મૂકેલી કેટલીક કૃતિઓ એનાં સર્જકોની વિનોડવૃત્તિ તેમજ કટાકદિસ્ટ બંનેમાં બૌદ્ધિકતાનું અને સર્જકતાનું ઊંચું સ્તર બતાવે છે એ રીતે પણ આ સંપાદન મહત્વનું ઠરે છે, ને હાસ્ય-વિનોદની વિવિધ સ્વરૂપની કૃતિઓના આનંદદાયક વાચનની રીતે પણ રસપ્રદ બને છે.

છેલ્લે મૂકેલી પુસ્તકયાદીમાં – તેમજ દરેક લખાજાને અંતે નોંધીલા પુરુષ/સામયિકમાં – પ્રકાશનવર્ષનો – નિર્દેશ નથી એ એક ખૂટતી કિડી ગણાય. અલબત્ત, કૃતિઓનો અનુકુમ તેમજ પુસ્તકયાદી-કમ સમયાનુકૂમી છે એ વરતાઈ આવે છે.

૦

‘જિંદગી ના મિલેગી દોબારા’ – રોહિત શાહ.

ગુજરાત, અમદાવાદ, ૨૦૧૫.

હિન્દી શીર્ષકવાળો ને ૫૦ ઢૂંઠાં વિચાર-ચચ્છિન્દી લખાણોનો.

આ સંચય આજની જીવનપદ્ધતિની કેટલીક પ્રાસંગિકતાઓને લક્ષ્ય કરે છે – ઉપશીર્ષકમાં લેખક કહે છે એમ આમાં ‘જનરેશા-ગોપનો આદર કરવાનું શિખવતા લેખો’ પણ છે. ‘અભિવ્યાન’, ‘ગુજરાત ટાઈમ્સ’માં આ લેખો પ્રકાશિત થયેલા છે.

નવી યુવા-કિશોર પેઢી લેખકના ધ્યાનવર્તુળમાં હોવાથી આ લેખોની ગુજરાતી ભાષા, આજે બોલચાલમાં છૂટે મોંએ વપરાતા અંગેજ શબ્દોથી ભીચોખીય છે! ‘એ તો બિલકુલ ઈમ્પોસિબલ છે કે કોઈ માણસ લાઈફમાં કશાયથી ક્યારેક ઈમ્પોરેસ ન થયો હોય,’ ‘કમ્પોરિઝન પ્રોપર હોવી જોઈએ અને કોમ્પાટિશન ઈક્વલ લેવલે થવી જોઈએ’, ‘આપણી પોતાની અલટિનેસ-સ્માર્ટનેસ જેવું યે કંઈક હોવું જોઈએ ને?’ ‘મેખાસ માર્ક કર્યું છે કે દુનિયામાં જેટલા ટોપમોસ્ટ સક્રોસફુલ માણસો થયા છે...’ – એવી અભિવ્યક્તિ-ભાત આખા પુસ્તકમાં છે. ઉપરાંત, અત્યારે પ્રચાલિત ઉર્દૂ-હિન્દી શબ્દો પણ વાક્યોમાં ગુંથાતા રહે છે: ‘ગલત કંપેરિઝન’, ‘પંખીઓ ઘોસ્લા છોડીને...’, ‘મહિલાઓ એમ સ્ટોચે છે કે’, વગેરે. રોજબોરેજ લોકો જેવી ગુજરાતી(!) ભાષા ‘બોલે’ છે એવી ભાષામાં ‘લખાયેલા’ આ લેખો બોલચાલનો પ્રવાહ તો બરાબર જીલે છે – આજની ઘરેણું સંપર્કભાષાનું એક લાક્ષણિક સ્તર પણ એમાં ઊઘડું છે. પરંતુ, આવી ભાષામાં લખવું એ જ જીવંત સંપર્કનો રસ્તો છે એવો લેખકનો ઘાલ ચિંત્ય છે. જોકે એમની જૂની કે ખરી ટેવવશ એમનામાં ‘દ્વિતીય વિશ્વયુદ્ધ, કર્તવ્યભાન, આચોજિત, પરમાર્થકાર્ય’ – એવા થોડાક તત્ત્વમ શબ્દો (એના અંગેજ પર્યાયો પ્રચાલિત હોવા છતાં!) પણ પ્રવેશી ગયા છે જે શબ્દો કદાચ આ નવીનતર પેઢીએ ફૂટી જવા પડશે.

એટલે એમ થાય છે કે અંગેજ શબ્દોનો આવો ભરપૂર વપરાશ કરવાથી જ વાત પહોંચાડી શકાશે? એનો બીજો વિકલ્પ પણ છે જ : ‘ગુજરાતીમાં, તત્ત્વમ પદાવલીને છોડીને પણ એવા અસંખ્ય શબ્દો છે જે સુભોધ અને રસપ્રદ બની શકે. લેખના પ્રવાહમાં અનિવાર્યપણે થોડાક અંગેજ શબ્દો કે ઉર્દૂ-હિન્દી શબ્દો પણ આવી શકે... મજાની વાત એ છે આ લેખકમાં પણ કયાંક એવો વાક્યપ્રવાહ આવી જાય છે ખરો જેમાં એક પણ અંગેજ શબ્દ હડ્ફેટે ન ચડતો હોય! એક લેખક તરીકે, સરેરાશા

માર્ગદાર

અધ્યાત્મમાં ૨૦૧૫ ૨૮

વાચકના સીમિત ભાષાજ્ઞાનનું જ મીંડુ ઘૂંઠવાને બદલે - એને તળ (ક્યારેક તળપદ્ધિ) ગુજરાતીની ટેવ પણ પાડતા જવું જોઈએ. એવા શબ્દો એને કાને નાખતા જવું ને અભિવ્યક્તિને સરળ-પ્રવાહી પણ રાખવી એવું જરૂર કરી શકાય, બલકે કરવું જોઈએ - એક ગુજરાતી લેખક તરફે.

અને રોહિત શાહનાં આ લખાણોમાં દણાંતોવાળી મરમાળી બોધકતા-સૂચનપરકરતા પણ છે. ક્યાંક સીધાં સૂચનો - આમ કરવું/ન કરવું જોઈએ પ્રકારનાં - પણ છે. ઉધાર ખરીદીનાં ભયસ્થાનો, દુશ્મની અને દુષ્ટતા વચ્ચેના ભેદ, ખોટી સરખામણીઓનાં નુકસાન, આર્થિક પગભર સ્ત્રીના પરિવારજીવનના પ્રશ્નો - એવી એવી બાબતો એમણે, દણાંતોપૂર્વક ખૂબ સારી રીતે મૂકી પણ છે. 'આપણી લાઈફને પોઝિટીવ થીકીગની પાઠશાળા બનાવી દઈએ' એવાં શીર્ષકોવાળા લેખો પણ એનું સમર્થન કરે એવા છે.

નવી પેઢી જો આ પ્રકારનાં લખાણો વાંચતી હોય તો એની ઉપયોગિતા તો દેખીતી છે. જરૂર છે ભાષાની અને વિચારોની રજૂઆતને સપાઠીથી સહેજ અંદર તરફ જવા દેવાની. કોલમી લખાણો પણ ચૂસીને ફેંકવા માટેનાં નહીં પણ પુસ્તકમાં સંચરવા જેવાં - ખરેખર તો, પુસ્તકના મોભાનાં - બને એ જ ઈચ્છનીય. લેખકે શક્તિઓને એક નાનોસરખો વળાંક આપવાની જ જરૂર છે.

૦

### 'ગુજરાતી બાલવાર્તા' - ઈશ્વર પરમાર.

ગુજરાત, અમદાવાદ ૨૦૧૫.

ઈશ્વર પરમાર એક સાથે ભાળસાહિત્યના મરમાળા સર્જક અને સહદ્ય વિવેચક છે. વળી ઈશ્વરભાઈના વિવેચનને એમનામાં રહેલા સર્જકનો તેમ શિક્ષકનો પણ ટેકો છે. એટલે ભાળવાર્તા વિશેની આ નાનકડી પુસ્તિકામાં રજૂઆતની વિશાદતા સાથે વિશ્વસનીયતા, એક પ્રકારની અધિકૃતતા આવી છે. આ સંંગ પુસ્તિકાનાં પેટાઘટકો છે - બાલવાર્તાની અગત્ય, એનું સ્વરૂપ અને એના પ્રકારો; ગુજરાતી બાલવાર્તાનાં પાત્રો; બાલવાર્તા અને બાલવિકાસ, વયાનુસારી બાલવાર્તા, બાલવાર્તાનું કથન, અને શાલેય શિક્ષણમાં બાલવાર્તા, વગરે.

સૈદ્ધાન્તિક ઘટકોના આ વર્તુળમાં નરી શાસ્ત્રચર્ચાનથી, સતત ગુજરાતી ભાળવાર્તામાંથી દખ્યાંતો લઈ લઈને એમણે વૈચારિક મુદ્દાઓને સ્પષ્ટ કર્યા છે ને લખાણને સઘન રાખીને પણ સુવાચ્ય બનાયું છે. ગુજરાતી ભાળવાર્તાનું એક લાક્ષણિક રેખાચિત્ર જાણો કે એમણે આ ઘટકબિંદુઓને જોડિને દોરી આપ્યું છે.

ઈશ્વરભાઈમાં સહદ્ય ગુજરાતીચિત્રાળા છે એટલે ક્યાંય એ કશી ટીકા-ટકોરમાં ઊતર્યા નથી કે એમનાં અન્ય વિવેચનપુસ્તકોમાંની સમીક્ષાઓમાં એમણે ક્યાંક માર્મિક સંકેતો કરેલા છે એવા સંકેતો પણ અહીં કર્યા નથી.

પુસ્તિકાને અંતે, ભાળવાર્તાનાં સંપાદનો, સંદર્ભગ્રંથ સૂચિ અને સર્જકસૂચિ આપીને એમણે શાસ્ત્રીય પરિપાઠીને સાચવી છે.

'કેફિયત' નામની પ્રસ્તાવનામાં, 'ગુજરાતી બાલવાર્તા ક્ષેત્રની ગુજરાતી ઘટતી જતી હોવાનું મંત્રબ્ય ક્યારેક વ્યક્ત થતું હોય છે, પરંતુ એનો આધાર સીમિત અવલોકન હોઈ શકે છે.' એવો મત એમણે પ્રગટ કર્યો છે એ ચિંત્ય છે. એને સમર્પિત કરવાનું આ પુસ્તિકમાં શક્ય ન હતું. તો, એમના આ નમ્ર દાવાને એ, સામૃત ગુજરાતી ભાળવાર્તા અંગે સમીક્ષિત અભ્યાસ આપતી બીજી એક પુસ્તિકાથી ચરિતાર્થ કરે એવી અપેક્ષા. એ પડકાર ખરેખર જીલવા જેવો છે.

૦

### 'વહીવટની વાતો' - કુલીનગંડ યાણિક.

દર્શક ઈતિહાસનિધિ, વડોદરા, ૨૦૧૫.

એક આઈ. એ. એસ. અધિકારી સૌભ્ય વ્યક્તિત્વવાળા બૌદ્ધિક પણ હોય અને સાહિત્યના રસિક અભ્યાસી પણ હોય ત્યારે એમના વહીવટના અનુભવોની વાતો અંગે જિજ્ઞાસા જાગે એ સ્વાભાવિક છે. જાહેર વહીવટ, સનદી સેવાઓ, શાસનનું કારોબારી તંત્ર - એ શબ્દોની આસપાસનું જગત, એમાં કેટલાને રસ પડવાનો? લેખકે તો ફરિયાદ પણ કરી છે કે સમાજ 'એમાં ઓછો ને ઉપરછલ્યો જ રસ લે છે. એટલે, સાહિત્ય-માર્ગાંઓને તો એ જગત આધેનું ને કંઈક શુષ્ણ, અટપદું લાગવાનું.

પરંતુ વિશ્લેષક છતાં સંવાદી દિઝિએ, એ જગતના

ચાળીસ વર્ષના સીધા અનુભવોને કુલીનચંદ યાણિકે એવા સાફ અને મરમાળા ગદ્યમાં આવેખ્યા છે કે આ પુસ્તકમાં પ્રવેશ કર્યા પણી વાંચનારમાં જિજ્ઞાસા અને રસ બંને જગતાનાં. સરકારી અધિકારી તરીકે એમનાં પદ-મોભો એવાં હતાં કે પોતાની વાત કહેતાં કહેતાં જાતને આગળ ધરવામાં સરકી જવાય, પણ કુલીનચંદ યાણિકે તો જાત-તપાસને આગળ રાખી છે ને ‘તંત્ર’માં પણ ‘માણસ’ને જાણવા-ઓળખવાની વિધાયકતાને ઉપર રાખી છે. જરૂર પડી ત્યાં અલબત્ત અસંદિગ્ધપણે સરકારી અધિકારીઓનાં કૃપણતા અને અપ્રામાણિકતાના બેચાર કિસ્સા પણ નોંધા છે – કટાકભાવે નહીં પણ રમૂજભાવે.

આ બધું ઉપરાંત, આગળ નોંધ્યું એમ, એમના દુંઘાયેલા સાહિત્ય-વિદ્યા રસને કારણે વિચાર-માહિતી-વિશ્લેષણલક્ષી ગદ્ય પણ જોરવવાળું ને સ્વાદ બન્યું છે. અનેક પ્રકરણો અને પેટાઘટકોમાં વહેંચાયેલું આ લખાજ સરંગ આત્મકથાનાત્મક અભિવ્યક્તિનો પણ એક લાક્ષ્ણિક ને હવે નમૂનો બન્યું છે.

કેટલાક આસ્વાદ અંશો : પહેલા પ્રકરણના આરંભે – ‘સરકારે મારું પાણિગ્રહણ કર્યું (એટલે કે હાથ જાલ્યો), તે પહેલાં ૧૮૪૮માં મેં હાથ લંબાતેલો ખરો. પણ તે કમજોર પડ્યો હતો’ [ઠંરવ્યુમાં નાપાસ થવાયેલું.] વહીવટની વાર્તાની વર્ચયે, એના પાતળા તંતુએ, વડોડરામાં ચેં. ચી.૦ મહેતાને મળ્યાની વાત પણ ગુંથાઈ છે. એક લસરકામાં ચેં. ચી.૦ના વ્યક્તિત્વનું એક પાસું ઊપસે છે

ને એમાં લેખકના માર્મિક ગદ્યનો પરિચય મળે છે : ‘ચંદ્રવદન એટલે વાતોનો અખૂટ ખજાનો. [...] કોઈવાર લેખની નકલ કે પુસ્તક બેટ આપે, કે ચા બનાવીને પાય. એકવાર જાતે બનાવેલો શીરો આપોલો. જોકે એમના કહેવાથી જ ખાતરી થયેલી કે એ શીરો જ છે!’ (૫૦ ૨૮૧). ઘડીવાર તથ્ય કલ્પનાથી પણ ચિદિયાતું હોય છે : ‘એકવાર કમિશ્રરશીનો મુક્કામ ધોરાજીમાં હતો. આખો દિવસ કામમાં ગાળી રાતે સૂવા જતી વખતે ખબર પડી કે તેમના સામાનમાં પાયજામો મૂકવાનો રહી ગયો છે! પાયજામા વગર સાહેબને નીંદર આવે નહીં. સાહેબ ધૂઅં કૂણાં, ને બીજાની મુંજુવણનો પાર નહીં! હેવ સ્થાનિક બંદોબસ્ત તો મામલતદાર જ કરે ને? કોઈ પણ કામ એની ફરજની બહાર નહીં! રાતવરત કાપડિયાની દુકાન ખોલાવી સેનો લીધો. દરજાને જગાડચો ને કામે લગાડચો. હાલોહાલ પાયજામો સ્થિવાયો અને કમિશ્રર સાહેબ નીંદર ભેળા થયા.’ (૫૦ ૪૧). આ કિસ્સો ફરીવાર વાંચવાથી એના માર્મિક ગદ્યનો ને કાકુઓનો જ્યાલ પણ આવશે.

‘ગુજરાત સમાચાર’માં સાડા ચાર વર્ષ આ લેખમાળા ચાવેલી. એટલે સ્વાભાવિક જ વર્ચ્યે જોલા પણ આવ્યા હોય – એવો આવેખ પણ પુસ્તક સરંગ વાંચતાં ઊપસે છે. પણ યાણિકસાહેબ સનદ્ધ હોવાથી એમાં શિથિલ ઘટકો જવલે જ છે.



## જગદીશ ગુજરાતને સેહાંજલિ

સ્વાધ્યાયશીલ અધ્યાપક તરીકે અને સૌભ્ય પ્રસન્ન વ્યક્તિ તરીકે સૌનાં સ્મરણમાં રહેલા જગદીશ મૂળજીભાઈ ગુજર (૪૦ ૫, સાએમ્બર ૧૯૫૭)ની અકાણે વિદ્યા (૨૮ એપ્રિલ ૨૦૧૬) દુખદાયક છે. અંકલેશ્વરમાં અધ્યાપક અને આચાર્ય, દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટીમાં ડીન અને ગુજરાતીના અધ્યક્ષ તરીકેની એમની કારકિર્દી દરમ્યાન એમનું વિવેચનકાર્ય પણ અવિરત ચાલ્યું. ‘કૃતિનિમજ્જ્ઞન’(૨૦૦૩), ‘કવિતાનો સૌંદર્યલોક’ (૨૦૦૪) ઉપરાંત, પ્રમોદકુમાર પટેલ પાસે રહીને કરેલો શોધગ્રંથ એમનાં ઉલ્લેખનીય પ્રકાશનો છે. એમનું વિવેચન પૂર્વઆધુનિક તેમજ આધુનિક સાહિત્યમાંની એમની સમાન રૂચિને પ્રતિબિંબિત કરે છે.

## કાચની શક્તિ(૧૯૭૮) : રામનારાયજી વિશ્વનાથ પાઈક



ગુજરાતી વિવેચનનો અશાસ્ત્રી ગ્રંથ

ચાન્દ્રકાન્ત ટોપીવાળા

ગુજરાતી વિવેચનગ્રંથોના ઈતિહાસમાં રામનારાયજી પાઈકનો વિવેચનગ્રંથ ‘કાચની શક્તિ’ પ્રશિષ્ટ તો રહ્યો છે જ, પણ સાહિત્યકલાને પહેલીવાર અન્ય કલાઓ વચ્ચે મૂકી, અન્ય કલાઓના પરિદ્ધિ સાથે સાહિત્યકલાને તપાસવાનો એમનો અભિગમ વિશિષ્ટ પણ રહ્યો છે.

‘કાચની શક્તિ’ ગ્રંથ, આમ જુઓ તો રામનારાયજી પાઈકના અન્ય વિવેચનગ્રંથ ‘સાહિત્યવિમર્શ’ સાથે સંબંધ ધરાવે છે. ‘ચુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ જેવાં સામયિકોમાં એમની પ્રવાહબદ્ધ પ્રવૃત્તિમાં, કાવ્યકલા ઉપર સીધા કે આડકતરા સંબંધ ધરાવતાં સંગીત, ચિત્રકલા, નૃત્યકલા વગેરેના વિવેચનલેખો ‘કાચની શક્તિ’માં લીધા છે અને વાર્તા નાટક વગેરે કાવ્યેતર પ્રકારના વિવેચનલેખો ‘સાહિત્યવિમર્શ’માં મૂક્યા છે. આ બંને ગ્રંથોના ઉત્તરાર્થમાં બીજા વિભાગમાં જે તે પ્રકારનાં પુસ્તકોનાં અવલોકનો સામેલ કર્યો છે. ઉપરાંત રામનારાયજી પાઈક એ પણ સ્પષ્ટ કર્યું છે કે બંને પુસ્તકોના પહેલા વિભાગમાં મુકાયેલા

સૈદ્ધાન્તિક લેખો માસ્ટિકના પ્રયોજનથી નિરપેક્ષ કેવળ અભ્યાસ માટે લખેલા લેખો છે; જ્યારે બંને ગ્રંથોના ઉત્તરાર્થમાં મુકાયેલા અવલોકનલેખોમાં તત્કાલીન પ્રશ્નો, દસ્તિઓ, વાતાવરણ ઉપરાંત તત્કાલીન જરૂરી ઉત્ત્વાળ અને અવકાશની મર્યાદા પ્રવેશેલાં છે.

‘કાચની શક્તિ’ની પ્રસ્તાવના કીમતી છે. એમાં પોતાના અભિગમનો અને પુસ્તકો વાંચવાનો નકશો એમજો સુપેરે આય્યો છે. અહીં વ્યાપક અર્થમાં એમજો સ્પષ્ટ કર્યું છે કે ‘વિવેચન માત્રને હું મારા માટે સાહસ ગણું છું.’ તો જરાક હળવી રીતે મજાકના સૂરમાં એમજો લેખકથી સ્વતંત્ર રચનામાં નવો અર્થ જોવાની વિવેચકને સત્તા છે તેમ જ કાચનાર્થ વિસ્તારવામાં ભાવકને સહાયક થવાની પણ વિવેચકને સત્તા છે, એ દર્શાવ્યું છે. સાથે સાથે સંસ્કૃત આલંકારિકોની ભૂમિકાને સ્વીકારી કવિમાં નૈસર્જિક સર્જનશક્તિનો (કવયિત્રી પ્રતિભાનો), તો વિવેચકમાં નૈસર્જિક વિવેચનશક્તિનો/ભાવયિત્રી પ્રતિભાનો) સ્વીકાર

કર્યો છે.

આ ગ્રંથનું નામ એમના જે યશસ્વી વિવેચનલેખથી પડ્યું છે, તે ‘કાવ્યની શક્તિ’ લેખ કાવ્યના ભાષામાધ્યમને, વ્યવહારજગત અને કલાજગતને, કાવ્ય અને ફિલસ્ફોઝને, નીતિ અને અનીતિને તેમજ રહસ્યને સવીગત ટાઈક રીતે સર્વો છે; અને કેટલાંક સ્થાનોને બાદ કરતાં આજની સાહિત્યસમીક્ષામાં હજુ પણ ઘોટક રીતે માર્ગદર્શક બની રહે છે. સામાન્ય અર્થપ્રતિપાદક શબ્દશક્તિને કાવ્ય અલંકારરીતિ દ્વારા વિશેષ અર્થપ્રતિપાદક શક્તિમાં કઈ રીતે રૂપાન્તરિત કરે છે, કાવ્યની વિશેષ અર્થપ્રતિપાદક શક્તિ કઈ રીતે માનવભાવોના નિરૂપણમાં અગ્રેસર થાય છે – વગેરેનું આ લેખમાં બારીક વિશ્લેષણ થયું છે.

આ લેખમાં કલાનો અનુભવ અને વ્યવહારિક અનુભવ તત્ત્વદિશાએ મિન્ન નથી, એવા એમણે ઉપસાવેલા મુદ્દામાં અહંકારવિગલન અને કાર્યપર્યવસાયી પરિણામની એમણે ચર્ચા જરૂર કરી છે. પરંતુ કલાના અનુભવ અને વ્યવહારના અનુભવની એરિસ્ટોટેલની આદ્વિ-મધ્ય-અંત દ્વારા સૂચ્યવાતી સાહિત્યની સંપાદનરીતિ (editing)નો ઉપયોગ એમણે કેમ ઉપયોગમાં લીધો નથી તે સમજાતું નથી. એટલે જ રામનારાયણ પાઈક એવું વિધાન કરવાને પ્રેરાય છે કે, ‘કાવ્યમાં અહંકાર ગવિત થાય છે તે જીવાય વ્યવહારની રસદાસ્તિ અને કાવ્યની રસદાસ્તિ એક જ છે; જોકે શાસ્ત્રીય રીતે વ્યવહારમાં ‘રસદાસ્તિ’ હોઈ ન શકે. માત્ર બાવદાસ્તિ જ હોઈ શકે. એ વાત પણ અહીં વિસરાઈ ગઈ છે. વળી, ‘કવિનું કૌશલ એ કે તે પોતાનો ભાવ પોતાની ફૂતિ દ્વારા સહદ્યમાં સંકાન્ત કરી શક્યો’ જેવું વિધાન પણ હવે અભિગ્રહણ સિદ્ધાંત (Reception Theory)ની ભૂમિકામાં તેમજ વાચક-વાચનના મનોવિજ્ઞાનની ભૂમિકામાં નવેસરથી તપાસવું પડે.

નીતિની ચર્ચામાં રામનારાયણ પાઈક યોગ્ય રીતે છેવટે આનંદશક્ર ધૂવના વ્યાપક કાવ્યપ્રતિમાનને સમાવ્યું છે અને કહ્યું છે કે ‘નીતિ આત્માની એક-દેશીય પ્રવૃત્તિ છે... સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાવવો એ કાવ્યનું કામ છે, કાવ્યની શક્તિ છે.’ આગળ ચાલતાં લોન્જાઈનસના સિદ્ધાંતને અભાનપણે એમણે આત્મસાત કર્યો છે અને ફિલસ્ફોઝ તેમજ કવિતાનો ભેદ કરતાં કહ્યું છે કે, ‘ફિલસ્ફોઝ

માત્ર તર્કપરંપરાથી બહુ બહુ તો કોઈ ઉચ્ચ સ્થાનનો અંગુલીનિર્દેશ કરે છે. કાવ્ય તો તે સ્થળો જ આપણાને લઈ જઈને મૂકે છે.’

આ વિવેચકના સાહિત્યવિવેચનનું હાઈ એમણે સૂચ્યવેલા ‘રહસ્યદર્શન’માં પકડાય છે. કહે છે : ‘કાવ્ય જીવનનું એવું કોઈ દસ્તિબંદુ આપે છે કે જ્યાંથી અમુક ભાવ તેના ખરેખર રહસ્ય પ્રમાણે દેખાય’ આમ છતાં લેખને અંતે રામનારાયણ પાઈક ફરી પાછું વ્યવહારજીવન અને કાવ્યજીવનને ભેળસેળ કરી નાખતું વિધાન કર્યું છે : ‘વ્યવહારજીવન અને કાવ્યજીવન બંને આપણા રહસ્યજીવનને સમૂદ્ધ કરે છે તેનો અર્થ એ કે બંને એક જ જાતનાં છે’ આ લેખ એકદરે બહુમૂલ્ય ધરાવે છે તેથી લંબાણપૂર્વક એની આજના સંદર્ભમાં ચર્ચા કરી છે.

‘કાવ્યની શક્તિ’ મુખ્ય લેખ પછી શબ્દની સામાન્ય અર્થપ્રતિપાદક શક્તિ, કઈ રીતે વિશેષ સ્વરૂપે પ્રગટ થાય છે એનો ‘કાવ્યમાં વર્ણનું મહત્વ’ અને ‘કાલિદાસના અલંકારો’ જેવા પછીના લેખોમાં વિસ્તાર કર્યો છે. ‘કાવ્યમાં વર્ણનું મહત્વ’ લેખ વર્ણનું, શોભાવર્ધનનું, અર્થવર્ધનનું અને રસવર્ધનનું કાર્ય નજીકથી તપાસે છે; તો ‘કાલિદાસના અલંકારો’ લેખમાં, કાવ્યના મર્મને વ્યક્ત કરવામાં અલંકારો કઈ રીતે કામગીરી બજાવે છે તે એમણે સોદાહરણ ઊંડી સૂફ્ફુર્વક સમજાવ્યું છે.

આ પછી પ્રેમાનંદ ઉપરના રામનારાયણ પાઈકના લેખો મધ્યકાલીન સાહિત્યચેતના અને પ્રેમાનંદની પ્રતિભાને સમજવામાં અત્યંત ઉપકારી લેખો છે. ખાસ કરીને પ્રેમાનંદનો હાસ્યરસસ્તુઃ સુદ્ધામાચયિતિ’માં એમણે કરેલી હાસ્યરસની ચિકિત્સા એવા નિર્દેશ પર પહોંચે છે કે પ્રેમાનંદનાં ‘કાવ્ય માત્ર તેના હાસ્યને લીધી ઉત્તમ થયાં છે એમ વિવક્ષા નથી પણ એ નોંધવા જેવું છે કે પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યોમાં જ તેનો હાસ્ય પણ સૌથી વધારે માર્મિક છે.’ ‘મામેરુંના હાસ્યસંદર્ભ દર્શાવ્યું છે કે ‘દીઢુરની પ્રસાદશક્તિ એ કાવ્યમાં એક સદ્વસ્તુ છે અને છતાં પ્રાકૃતજનો તે માનતાં નથી એ રીતે હાસ્ય વ્યક્ત થાય છે’ પછી સૂક્ષ્મ તારણ આપે છે કે ‘મશકરી કરવા જનારની મશકરી થાય તેના જેવું ઉપહસનીય બીજું કશું નથી.’ તો, ‘નળાખ્યાન’ના મર્મને પ્રગટ કરતાં તેઓ લખે છે :

‘નળદમયંતી વૃત્તાન્તમાં દાંપત્યપ્રેમનું એક મહાન રહસ્ય રહેલું જ છે. પ્રેમાનંદે એ રહસ્ય પકડયું એ રહસ્યને અવલંબીને નળદમયંતીનો શૃંગાર વાર્તામાં આપ્યો. એ જ રહસ્યને અવલંબીને નળદમયંતીના વિરહનો કરુણ આય્યો. એ જ રહસ્યને અવલંબીને પ્રેમાનંદે તેમાં હાસ્યને પણ અવકાશ આપ્યો.’ અહીં જોઈ શકાશે કે ‘કાવ્યની શક્તિ’ લેખમાં ફૂટિના રહસ્યબિન્દુ પર મુકાયેલો સૈદ્ધાન્તિક ભાર ઉદાહરણચર્ચામાં મૂર્ત રૂપે પ્રગટ્યો છે. આ જ દાંપત્યના રહસ્યબિન્દુને આગળ કરીને રામનારાયણ પાઠકે ‘મહાભારતનું નલોપાખ્યાન’ અને પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ની તુલનાચર્ચા કરતાં કંધું છે કે પ્રેમાનંદે નળાખ્યાનને સ્વતંત્ર કાવ્ય તરીકે નિરૂપ્યું છે અને તેમ કરતાં તેના હાથે નળાખ્યાનનું રહસ્ય, માત્ર એક અભિજાત અને ઉચ્ચ સ્થિતિના માણસ પર કેવી આપદા પડી એ બતાવતું, એટલું જ નહીં, પણ એક દંપતીના પ્રેમનો, ખાસ કરીને પત્નીના પ્રેમનો વિકાસ તેના આદિ અને વિકાસની અંતિમ મર્યાદા બતાવવી એ થઈ ગયું છે.

‘કવિશ્રી નહાનાલાલનું સાહિત્યજીવન’ લેખ સુધારક અને પંડિતયુગમાં, અને પછી પણ, પદ્ધિમનો પ્રભાવ હાવી રહ્યો હોઈ. ચીમકી ઉચ્ચારે છે કે ‘સાહિત્યદશા ઉન્નત થવાને પણ તેનાં મૂળ દેશના ભવ્ય પ્રાચીન સાહિત્યથી પોષાય છે’ અને પછી એને નહાનાલાલના સાહિત્યજીવન સાથે જોડે છે. પ્રાચીન સાહિત્યને જોયા વિના, તેને વંદવાની કે નિન્દવાની ફેશન થઈ છે, પણ સાહિત્યને પુષ્ટ કરવાનો, હિતાવહ કરવાનો, બલિષ્ઠ કરવાનો એ જ માર્ગ કવિએ સ્વાભાવિક રીતે ગ્રહણ કર્યો છે.

આ પછીના ‘લોકસાહિત્ય’ ‘ગરબામાં હીંચ’ મુંબઈના નવરાતરના ઉત્સવો, ‘ઉદ્યશંકરનું નૃત્ય’ ‘કથકલી નૃત્ય’ ‘યક્ષદૂપતી’ ‘સંગીત’ જેવા લેખો સાહિત્યેતર કલાઓની ચર્ચા કરે છે. અલગતા, નૃત્ય, ચિત્ર અને સંગીતકલા વિશે વિચારવાનું ગુજરાતી સાહિત્યમાં આ પહેલાં ભાગ્યે જ બન્યું છે અને તેથી આ પ્રારંભિક લેખોમાં પરિભાષાથી માંડી અભિવક્તિ સુધીની પ્રાથમિકતા કળાય છે, છતાં સાહિત્યને સમજવા અન્ય કલાઓને સમજવાની મથામજાનું આ સાહસ ગમે એવું છે. એટલું જ નહીં પણ એમાં લેખકની પોતાની રીતની એક ગતિ પણ છે, અને દસ્તિ પણ છે.

‘લોકસાહિત્ય’ તે સાહિત્ય નથી પણ સાહિત્યની સામગ્રી છે તેમ લોકસાહિત્ય શુદ્ધ ઇતિહાસ પણ નથી, ઇતિહાસની સામગ્રી છે. એવું લોકસાહિત્ય વિશેનું વિધાન લોકસાહિત્યની સાચી સમજ દર્શાવે છે. એ જ રીતે ‘કથકલી’નું પ્રાણતત્ત્વ બરાબર પકડાયું છે. ‘કથકલીમાં શબ્દોથી વાત થતી જ નથી. આવા સંવાદો હાથની મુદ્રાઓથી થાય છે. આ સમજવાને તેનો સંકેત જાણવો જોઈએ એ એક જ સાચો ઉપાય છે. ગમે તેવો કુશળ કલારસિક પણ એ સંકેતજ્ઞાન વિના એ સમજ શકે નહીં.’ તો, અજન્તાના યક્ષદૂપતી ચિત્રને અવલોકનાં કહે છે કે, ‘અજન્તાનાં ચિત્રો રંગચિત્રો હોવા કરતાં રેખાચિત્રો વિશેષ છે’ અહીં રામનારાયણ પાઠકની સહજ ચિત્રાવલોકનની ગતિને પણ જોઈ શકાય છે.

કદાચ ‘સંગીત’ ઉપરનો એમનો લેખ પ્રમાણમાં પકવ અને ખાસ્યો તુલનાત્મક બની શક્યો છે. કલા એ અનુકરણ નથી જ. અનુકરણને તે સાધન તરીકે વાપરે છે’ જેવું ઓરિસ્ટોટલના અનુકરણવિચારને અજવાળી નાખતું એમનું વિધાન આ જ લેખમાં આપણને મળે છે. ‘સંગીત’ની વૈયક્તિતતાને બરાબર ઉપસાવતું એમનું આ વિધાન જુઓ : ‘સંગીતમાં એક પછી એક થાતો સ્વરનો અનુભવ ચિત્રને વિક્ષિપ્ત નથી કરતો તેનું કારણ શું? એ જ કે એ બધા એક પછી એક આવતા સૂરોથી એક જ સ્વરચિત્ર, એક જ સ્વરઘટના, સ્વરની એક જ આકૃતિ ખડી થાય છે; જેને આપણે અમુક રાગ કહીએ છીએ.’ સંગીત પરના આ લેખમાં રામનારાયણ પાઠક કલાની વિશીષ્ટ શક્તિ પર અનાયાસ આંગળી મૂકી શક્યા છે : ‘જીવનમાંથી જ ઉલ્લસતી કલાનો અનુભવ આ રીતે જીવનના અનુભવો અને જીવનના અનુભવના નિયમોની પાર જાય છે. પોતે પોતાથી પર જવું એનું જ નામ કલાનો અને જીવનનો ઉલ્લાસ.’

રામનારાયણ પાઠકની અન્ય કલાઓની વિચારણા સાથે પોષાયેલી સાહિત્યકલાની વિચારણાએ એમના રુચિતંત્રને અને મૂલ્યાંકનતંત્રને સાબદું રાખ્યું છે; અને તેથી જ ‘કાવ્યની શક્તિ’ ગ્રંથના બીજા વિભાગનાં પુસ્તકાવલોકનોમાં અંગત રુચિને જગી પ્રવેશવા દીધા વગર પુસ્તક હેતુ, સામગ્રી, વર્ણન, વિશ્લેષણનો ઉપયોગ કરી પ્રમાણો સાથે સાધિકાર મૂલ્યાંકનો આપ્યાં છે, જે આજે પણ

ટકી રહ્યાં છે. એમજો પસંદ કરેલાં પુસ્તકોમાંનાં આજે ઘણાંબધાં તો પ્રશિષ્ણની વ્યાખ્યામાં પ્રવેશોલાં છે. કોઈ પણ અવલોકનકાર માટે, એ શું પસંદ કરે છે, જે પસંદ કરે છે એને એ ડેવી રીતે જુએ છે, અને જે રીતે જુએ છે એમાં એની મૂલ્યાંકનશક્તિ અંકિત થાય છે કે કેમ અને છેવટે એના અભિપ્રાયનું મૂલ્ય વીતેલા કાળમાં સંગત રહે છે કે કેમ - વગેરે બાબતો અત્યંત મહત્ત્વ ધરાવે છે. રામનારાયજી પાઠક, આ સંદર્ભે જોતાં એમના યુગના અન્ય વિવેચકો કરતાં અત્યંત ભરોસાપાત્ર અવલોકનકાર તરીકે પાર ઉંતરે છે.

આપણો કાવ્યપ્રવાહ અંગેજ અસરથી મુક્ત રહ્યો હોતો તો કયો માર્ગ લેત એ અટકળ પર એમજો અરજુન ભગતનાં ભજનો સાભિપ્રાય તપાસ્યાં છે, તો સંગ્રહક રણજિતરામ વાવાભાઈ મહેતાનું ‘લોકગીત’ કઈ રીતે સાહિત્યના યા વિભાગ તરફ તરફ સમસ્ત ગુજરાતના કેળવાયેલા વર્ગનું પ્રથમ ધ્યાન ખેંચવાનું માન મેળવે છે એનો યોગ્ય પરિપ્રેક્ષ્ય બતાવ્યો છે. રમજભાઈ નીલકંઠ અને નહાનાલાલની એક જ ગ્રંથમાં સમાવાયેલી વિરોધી પ્રસ્તાવનાઓનો સંદર્ભ રચીને રામનારાયજી પાઠકે પૃથુલાલ હ. શુક્લના કાવ્યસંગ્રહ ‘કૂલપાંડિ’ અંગે સ્પષ્ટ પ્રશ્ન કર્યો છે કે ‘આ કૂલપાંડિમાં જે છે તે પદ્ય નથી તો પણ કાવ્ય છે?’ અને ઝાટકીને કહી દીધું છે કે ‘સર્વ વિચારોને એકરસ કરી વ્યક્ત કરવાની, એકાગ્ર કરવાની જે કલાથી જ કવિ થવાય છે એની અમને ઘણી જગાએ ખોટ જણાય છે.’ ખબરદારની ‘કલિકા’ વિશે સ્પષ્ટ કર્યું છે કે ‘એક સાથે આ કાવ્ય વાંચવાથી એમાં એકતાના લાગ્યા વગર રહેશે નહીં’ એ જ રીતે નટવરલાલ રણજીતરામ શાહના ‘સરલ ગીતગોવિદ’માં ‘કેશવલાલના અનુવાદમાં છે તેવું અસલનું માધ્યર્થ અનુભવી શકતું નથી.’ એવું સ્પષ્ટ મંત્ર્ય આપ્યું છે.

‘પુલોમા અને બીજાં કાવ્યો’ના કવિ અમૃતલાલ ના. ભણ લાંબા સમયથી લખતા આવ્યા હતા પણ એમજો એક પણ કાવ્ય પ્રસિદ્ધ નહોતું કર્યું. તેમ છતાં એમની કાવ્યપ્રૌઢી જોતાં રામનારાયજી પાઠકે કહ્યું છે કે ‘અમને ખાતરી છે કે કર્તા પહેલેથી કાવ્યો પ્રસિદ્ધ કરતા રહ્યા હોત તો અત્યારના કેટલાક કાવ્યલેખકો કરતાં વધારે પ્રસિદ્ધ થઈ

ગયા હોત.’ આ રીતે આત્મસંયમથી લખતાં આ કવિ પર રામનારાયજી પાઠકે આજાં અવતરણો સાથે ટિપ્પણ કર્યું છે અને તત્કાલીન પરિસ્થિતિની સમીક્ષા સાથે યોગ્ય રીતે પ્રોત્સાહિત કરતાં લખ્યું છે : ‘તેમજો કોઈ કવિનું અનુકરણ કર્યું જણાતું નથી. અને પોતાના સરલ કાવ્યમાર્ગે ચાલ્યા જવાની એમની ઈચ્છા છે તે આ અતિ અનુકરણોના દિવસોમાં અનુકરણ કરવા યોગ્ય છે.’

‘લિરિક’ ‘ભણકાર : બીજી ધારા’ ‘વિશ્વશાંતિ’ ‘કલાપીનો ડેકારવ : શ્રીકલાપીની પત્રધારા’ ‘ઈલાકાવ્યો’ ‘કાવ્યમંગળા : કોયાભગતની કડવી વાણી’ ‘જ્યોતિરેખા’ ‘ગંગોત્રી’ ‘ખાખનાં પોયણાં’ ‘આલબેલ’ ‘મારાં સોનેટ’ જેવાં તત્કાલીન પ્રકાશનો જે આજે લગભગ પ્રશિષ્ણ બની મૂક્યાં છે, એમના સત્તવને રામનારાયજી પાઠકે બરાબર પારખ્યું છે, તો સાથે સાથે એ દરેકની ધાતુને પણ બરાબર ચકાસી છે. અલખભાત્ત લિરિકમાં લિરિકનું બીજ ઠેઠ પ્રાચીન ગ્રીક સમયમાં જરૂર છે, તો ગુજરાતી કાવ્યચર્ચા પણ આપકા ઈતિહાસ ઉપર રચાવી ન જોઈએ? એવો જે પ્રશ્ન અહીં કર્યો છે એ વિચાર માગી લે તેવો છે. મધ્યકાલીન ગુજરાતી ગેય રચનાઓનું રૂપ અને અર્વાચીન કાળથી ચાલુ થયેલું લિરિકનું રૂપ – એ બે એક નથી. અને તેથી ‘આપણી વિવેચનામાં એ લિરિક’ શબ્દ પેસી ગયો એમ જે નિદાન કર્યું છે એ ફેરવિચારણ માગે છે. પણ ‘લિરિક’ પરનું રામનારાયજી પાઠકનું અવલોકન ઠાકોરની ક્લિષ્ટ ગવદીલીનું વિશ્વેષણ કરી જે રીતે ઠાકોરને વાંચવાની વાચ્યકને રીત દર્શાવી છે તે અવલોકનકાર તરીકેનું એમનું ઉત્તમ પાસું છે. એટલું જ નહીં ‘ભણકાર : બીજી ધારા’ને પ્રસ્તુત કરતાં એમજો બ. ક. ઠાકોર જેવા કવિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે : ‘કાવ્ય એટલે કંઈક પોચી પોચી લાગણીવાળી વાણી અને હવાઈ વસ્તુ એમ મનાતા જતા આપકા જમાનામાં અમે ખાસ પ્રો. ઠાકોરનાં કાવ્યો વાંચવાની ભલામજી કરીએ છીએ.’

‘વિશ્વશાંતિ’ પરત્વેનો અભિગમ પણ પૂરો વસ્તુલક્ષી છે અને સાથે સાથે પૂરી મૂલ્યાંકનશક્તિ એમાં કામે લગાડાયેલી છે. ‘કોઈ જગ્યાએ કૃત્રિમ અલંકારોથી કે લાગણીવેડાથી ભાવ નિષ્પણ કરવા પ્રયત્ન કર્યો નથી. અને છતાં એટલું કહેવું પડે છે કે વિષયની ભવ્યતા પૂરેપૂરી

તેમના કાવ્યમાં પ્રગટ થતી નથી. મહાત્માજીના અપૂર્વ કારુણ્યને પૂરેપૂરી આર્ધવાળી મળી નથી અને તેમાં અમે આ જીવાન કર્તાનો દોષ ગણતા નથી. વિષયની મહત્તમ જ એવી છે.’ ‘શ્રી કલાપીનો કેકારવ : શ્રી કલાપીની પત્રધારા’ – આ બે અવલોકનો કલાપીના કોઈ પણ અભ્યાસમાં ધ્યાન પર ન લેવાય તો કલાપીની વાત અધૂરી રહી ગણાય એટલા દસ્તિપ્રેરક છે. આ લેખમાં રામનારાયણ પાઠકે એક બાજુ કલાપીની ‘કવિતાનું મુખ્ય પ્રેરક બળ ઈશ્વરભાક્તિ નહીં’ પણ તેમના પોતાના જીવનમાં અતૃપ્ત રહેલી વ્યક્તિપ્રીતિની છે’ એમ કહ્યું, તો બીજી બાજુ વાચકને પ્રિય થતી કલાપીની કવિતા અંગે નિદાન કર્યું કે ‘કલાપીની કવિતા લોકપ્રિય છે તેનું ક્રાણ તેનો ભક્તિરસ નથી પણ આપણી ચાલી આવતી લગ્નપ્રથા તરફનો અસંતોષ, સંવનનની અતૃપ્ત ઈચ્છા, ઈચ્છની અપ્રાપ્તિનું દર્દ વગેરે નવા જમાનાના યુવાનોની મનોભાવનાને કલાપી પ્રગટ કરે છે તે છે.’ તો, કલાપીનો કેકારવના સંપાદક સાગરે એના ટિપ્પણીમાં કલાપીની પત્રધારાનો વધારે ઉપયોગ કરવાની જરૂર હતી એવું સ્પષ્ટ કર્યું છે.

‘ઈલાકાવ્યો’માં બહેનભાઈના પ્રેમનાં કાવ્યો છે પરંતુ એહી ભાઈ-બહેનને માત્ર બાલ્યકાળીની નિર્દોષ ઊર્ભિઓમાં કે મૃત્યુ સ્વર્ગ મોક્ષના તરંગોમાં જ ઊડવાનું રહે છે એવી એની સીમિતતા પણ દર્શાવી છે. તત્કાલીન નજીકના પરિપ્રેક્ષયમાં ‘વિશ્વશાંતિ’ ‘કાવ્યમંગલા’ ‘કોયા ભગતની કડવી વાણી’ કે ‘ંગોત્રી’ અંગેનો અભિપ્રાય ઉચ્ચારવો વિવેચકની સ્થિરમતિ વિના શક્ય નથી. અને આ સર્વમાં રામનારાયણ પાઠકની ગતિ અનિરુદ્ધ રહી છે. તેઓ ‘કાવ્યમંગલા’માં વિષય અને છંદ અને રીતિ ન્રણોયના પ્રકારોમાં કવિની પસંદગી સંજાગ અને ઉચિત તો જુઓ છે જ. ઉપરાંત ‘કોયા ભગતની કડવી વાણી’માં કવિતાની નવી જ દિશા પણ જુએ છે. વળી, સુન્દરજી ગો. બેટાઈના ખંડકાવ્યોના સંગ્રહ ‘જ્યોતિરેખા’ને નરસિંહરાવનું ગુણદર્શન સાંપડ્યું હોવા છતાં સ્પષ્ટ કરે છે કે ‘કવિતાની વિષય

પસંદગી અને મનોભાવ ઉપરનો સંયમ એવા પ્રકારનાં છે કે એક જ ભાવથી આખું મનઃપાત્ર ભરાઈ જઈને ઊભરાઈ ને છલકે એવો અનુભવ ભાગ્યે જ થાય.’

ઉમાશંકર જોશીના ‘ંગોત્રી’ કાવ્યસંગ્રહનું અતલોકન ઉચિત રીતે સરીગત થયું છે. રામનારાયણ પાઠકનું નિદાન છે કે ‘સંગ્રહની વિશિષ્ટતા માનવ-અનુભવના નવા જ ભાવોને કવિતામાં વિષયભૂત કરવામાં રહેલી છે અને એમ કરતાં લેખક આધુનિક ચિત્તશાસ્ત્રનાં નિરીક્ષણોનો પણ ઉપયોગ કરે છે’ અને ઉમેરે છે કે ‘ચિત્તનું પૃથક્કરણ કરવા છતાં બાની અને કલ્યાણ કવિતાનાં જ રહ્યાં છે.’ આના સમર્થનમાં રામનારાયણ પાઠકે ‘બળતાં પાણી’ આખું સોનેટ ટાંક્યું છે, અને વિશ્વેષ્યું છે. કરસનદાસ માણેકનું કરુણવિરહનું ઊર્ભિકાવ્ય ‘આખનાં પોયણાં’ આજે પણ ફરીને ઉચિત ધ્યાન માગે છે એને અહીં સોદાહરણ ઉપસાયું છે, અને પાશ્ચિમની કરુણપ્રશાસ્ત્રિ (elegy)થી એ કઈ રીતે બિન્ન છે એ પણ દર્શાયું છે. એમાં ચિંતન પ્રધાનભાવે નથી આવતું. પણ લાગણીની પ્રધાનતા સાથે એમાં વિચારો અને સત્યો છે – એવું કહીને કાવ્યને પાঁખ્યું છે. બ. ક. ડાકોરના ‘મારાં સોનેટ’માં આવતાં વિવરણો સંબંધી રામનારાયણ પાઠકનો સ્પષ્ટ અભિપ્રાય છે કે ‘અમની નિરૂપણપદ્ધતિ માત્ર વિચારો આપે એવી નહિ પણ આપણને વિચાર કરતાં કરે એવી છે.’

‘કાવ્યની શક્તિ’ ગ્રંથમાં પુસ્તકાવલોકનના બીજા વિભાગના અંત ભાગમાં કનુ દેસાઈનાં ‘છાયાચિત્રો’ અને ‘રંગચિત્રો’ જેવા ચિત્રસંગ્રહો પર તેમજ સોમાલાલ શાહના ‘રંગરેખા’ ચિત્રસંગ્રહ પર જે અવલોકનો આખ્યાં છે એમાં ચિત્રસંગ્રહોની અવલોકનપદ્ધતિને નિશ્ચિત કરવાનો પ્રાથમિક અને પ્રારંભિક સફળ પ્રયાસ છે – એની સહર્ષ નોંધ લેવી જોઈએ.

‘કાવ્યની શક્તિ’ એવો વિવેચનગ્રંથ છે, જેને અંગે ખાસ્સો સમય ગતિ કરી ગયો હોવા છતાં એની પોતાની ગતિ મન્દ પડી નથી.

[રોજેરોજની ટપાવોમાંથી ઝડપીને જલદી ખોવવાનું મન થાય એવા લિફ્ઝલિફ્ઝ આવે ત્યારે હાથ પરનાં ચાલુ કામો એક બાજુ પર મુકાઈ જાય, અંખો એમાં ખોવાઈ જાય. નવી ચોપડીઓના ખબર લાવતાં સામયિકોના અંકોનાં પાનાંઓ પર ચિત્ત ચોંટી જાય. હિલ્લીથી આવતાં એ ‘બીબ્લીઓ’ અને ‘ધ. બૂક રિવ્યુ’, વર્ધાથી બહાર પડતું હિટી દ્રેમાસ્ટિક ‘પુસ્તક-વાર્તા’, પુષેથી રવાના થતું મરાઈ માસ્ટિક ‘વાલિત’, – એ બધાં પ્રિય મિત્રો બની ગયાં છે. ખ્યાતનામ અખબાર ‘ધ. હિન્દુ’ની દર મહિને આવતી સાહિત્યપૂર્તિમાં પુસ્તકો અને લેખકોની દુનિયાની વિવિધરંગી વાતો, કયારેક વળી ઠન્નરનેટના પગથારે આવેલી શાનસ્મૃદ્ધિની વાતો, અને ગ્રંથજગતની પ્રત્યક્ષ સોબત... આ બધાંમાંથી તારવેલું ને સારવેલું, એનું અહીં માત્ર આચમન ધરવાની નેમ છે. – ૪૦]

### સમરણમાં સચચાચેલું ગામડું

નામ તો એમનું માયસોર નરસિંહચાર શ્રીનિવાસ, પણ સમાજવિજ્ઞાનની દુનિયામાં એમની ઓળખ છે એમ. એન. શ્રીનિવાસ નામે. રૂઢિવાદી બ્રાહ્મણ મા-બાપને ઘરે જન્મેલા યુવાને ભણતરમાં કાઢું કાઢું. મુંબઈ યુનિવર્સિટીમાં સમાજ માનવવંશવિદ્યા (એન્થ્રોપોલોજી)માં ડૉક્ટરેટની કલગી લઈને એમને ઓક્સફર્ડમાં કામ કરવાની ખવાહિશ હતી; એ બર આવી; એક દિવસ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સમાજવિજ્ઞાની ધૂરંધર પ્રો. રેડકલીફ-બાઉનનું તેડું આવ્યું અને શ્રીનિવાસે ખ્વન્ખની વિદ્યાભૂમિની વાત પકડી. પ્રોફેસરે આ નવયુવાનને સૂચ્યવ્યું, “ભારત જા, અને તારા કણ્ણાટકના કોઈ ગામનો માનવવંશીય અભ્યાસ કર, યુનિવર્સિટી તરફથી.” પછી તો એ પ્રોફેસર નિવૃત્ત થયા પણ એમના અનુગામી બીજા એક પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી પ્રા. ઠવાન્સ-પ્રિચાર્ડ આ નવા સમાજવિજ્ઞાનીને સંભાળી લીધો. શ્રીનિવાસે કણ્ણાટકનું એક ગામડું પસંદ કર્યું અને તેનું નામ રાખ્યું રામપુર. રામપુરની વિવિધ જ્ઞાતિઓના શંભુમેળા જેવી વસ્તી અભ્યાસ માટેની ફળાઉ ભૂમિ હતી. પછી તો શ્રીનિવાસે રામપુરના વતની બનીને, ગામલોકો સાથે દોસ્તી કરીને, વિપુલ સામગ્રી ભેગી કરી. આ ‘ટેટા’ એમના અભ્યાસનો કાચો માલ બનવાનો હતો, પરિપાકરૂપે સમાજશાસ્ત્રીય તારણો નીકળવાનાં હતાં.

એવામાં ૧૯૫૦ના દાયકમાં વડોદરામાં મોટી યુનિવર્સિટીની તૈયારીઓ શરૂ થયેલી, તેનાં પહેલાં વિદ્યામોવડી હંસાબહેન મહેતા નવા નવા વિદ્યાવિભાગો વિકસાવવા માટે અભ્યાસીઓની ખોજમાં હતાં. એમની નજર ઓક્સફર્ડ પહોંચી અને શ્રીનિવાસને એમણે ઊંચ્યકી લીધા, ‘વડોદરામાં એક નમૂનેદાર સમાજશાસ્ત્ર-ભવન વિકસાવી આપો.’ એમ કહીને. વડોદરાનું લેણું હશે ને ઓક્સફર્ડની આશાસ્પદ કારકિર્દી મૂકીને શ્રીનિવાસ આવ્યા. આઠ વરસમાં તો વડોદરાના સમાજશાસ્ત્ર-ભવનની નામના ચોતરફ ફેલાઈ ગઈ. શ્રીનિવાસ ત્યાંથી દિલ્હી સ્કૂલ ઓફ ઇંજિનિયરિંગમાં ગયા. અને ત્યાં પણ યશદાયી કામગીરી કરીને અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં સંશોધન માટે પ્રયાશ કર્યું. ૧૯૭૦માં સ્ટેનફર્ડમાં એમના અભ્યાસ-ભવનમાં આગ લાગી અને રામપુર વિશેના વીસ વરસના સંશોધનનો થોકબંધ ‘ટેટા’ પલકમાં ભર્સીભૂત થઈ ગયો. કારકિર્દીભરની શોધ-સામગ્રી શ્રીનિવાસ ખોઈ બેઠા, મનથી હારી ગયા. પણ સમભાવી શાંખા સાથી અધ્યાપકે એમને ધરપત આપી : “ભેગા થયેલા ‘ટેટા’ના સાવ નાના ભાગને જ સંશોધક આખરી અભ્યાસમાં ખપમાં લે છે. તમે એમ કરો : તમને જે યાદ હોય એ સામગ્રી પરથી સંશોધન ધાપાવો.” બસ, આ ચિનગારીએ શ્રીનિવાસમાં આત્મવિશ્વાસનો દીપક પેટાવ્યો.

યાદ્વાસ્તને ફંઝોચી, દિલ્હીમાં પડી રહેલી સચવાયેલી અથ્ય સામગ્રીને પણ સંયોજ, તેમાંથી એમણે પુસ્તક લખ્યું : ‘ધરીમેભર્ડ વિલેજ’ (ઓક્સફર્ડ, ૧૮૭૬, અપ્રાય), ‘સ્મરણશરીરમાં સચવાયેલું ગામદું’: રામપુર તો જેણું કાલ્પનિક નામ છે એ ગામને વરસ સુધી ઘર બનાયું. ખાવા-પીવા-હળવામળવામાં ગ્રામજનો સાથે સંબંધોના તાણાવાણા જેમાં વજાવા છે એ ‘ધરીમેભર્ડ વિલેજ’ એક શુષ્ણ અભ્યાસગ્રંથ ન નીપજ્યો, માત્ર ‘દેયાનું પૃથક્કરણ આપતું શાસ્ત્રીય નિરૂપણ ન બન્યું, પણ તેમાં માનવીય વ્યવહારોની ઉષ્ણા પણ સિંચાઈ, તળપદ ભારતીય જીવનની નવલક્ષણમાં હોય એવો રસ પણ એમાં ભરપૂર નીતયો. વિદ્વાનના ગ્રામનિવાસના બહુરંગી અંગત અનુભવો પણ આ અભ્યાસગ્રંથનું નવીન પાસું ખોલે છે. એક વિદ્વાને તો એને એક કલાકૃતિ કહ્યો, તો પુસ્તક ભારતની માનવવંશવિદ્યાનું, ‘એથનોગ્રાસીનું કલાસિક પણ લેખાયું, વિદ્યાજગતમાં ચોતરફ સન્માન પામ્યું. ભારતમાં શાન્તિપ્રધાન સમાજને સમજવા અર્થે આ પુસ્તકે નવી વિભાવનાઓ પ્રસ્થાપિત કરી જેનો શાસ્ત્રીય જગતમાં મહિમા થયો. નવા અભ્યાસો માટે એ આધાર બની. બીજાં કેટલાંક વિદ્યાધામોમાં અધ્યાપન-સંશોધન-કામગીરીઓ બજાવી, પદ્ધતિશરીરી સન્માનિત થઈ ૧૮૮૮માં ત્યાશી વરસને વયે એ નમ્ર અભ્યાસીએ આંખો મીંચી દીધી.



### એક ખાધસંસ્કાર કથા

કોઈના કહેવાથી આંધળુક્યાં કરીએ અને દલ્લો હાથ લાગો એવો અનુભવ થયો : કોઈ સામયિકમાં આવેલું ‘થીજીન : મેમરીજ ઓન્ડ રેસિપિઝ ઓફ ઇંડિયન રેજટેરીઅન ફૂડ’ લેખક : રૂક્મિષ્ણી શ્રીનિવાસ. (પકાશક : રૂપા, ૨૦૧૫, ૩. પટ્ટ્ય) નામે પુસ્તકનું નાનું અવલોકન કાનમાં કહી ગયું કે ‘રસ પડશે, હો!’ અને ખાદ્યરસના મારા નાના સંગ્રહમાં આવીને એ પુસ્તક બેસી ગયું. પ્રવેશક પહેલાં જ આવેલી અનુકમણિકાએ અણસાર આપ્યો કે ના, આ માત્ર વાનગી બનાવવાની રીત શીખવતી ચોપડી નથી.

તો વિશેષ વળી શું છે? પ્રવેશકમાં પેસીએ અને ઘડીક કોઈ અભ્યાસ-નિબંધ વાંચતા હોઈએ એમ લાગે, તો વળી લેખિકા પ્રસંગો-ઘટનાઓ પણ કહેતાં જાય. આ ‘થીજીન’ શું

છે? ખાસ તો દક્ષિણ ભારતમાં સવારનો નાસ્તો, ‘પાકો’ નાસ્તો કહે છે એવો નાસ્તો, અથવા ઢળતી બપોરે ફરી લેવાતો નાસ્તો, ‘હાઈ ટી’, આપણા ખેડૂતોનો રોંગો. હા, એ જ ‘થીજીન’. આ સાદા, લઘુ ભોજનમાં ખવાતી મુખ્યત્વે દક્ષિણ ભારતની વાનગીઓની વાત આવે છે. ‘વાત આવે છે’ એટલે એ વાનગીઓ લેખિકાના જીવનના જુદાજુદા પડાવમાં કયારે એમને મળી, સહુ પહેલાં કોણે રંધી ખવરાતી એની વાત અને પછી એ બનાવવાની પદ્ધતિ, વ્યવસ્થિત રીત, મા તો દીકરીઓને લાડકોડથી ખવરાવતી, બધી મા કરે છે તેમ, પણ રૂક્મિષ્ણી – ઘરનું નામ રુક્કા – તો એક ખાદ્યપ્રવીણ માનાં દીકરી. અવનવી વાનગીઓ નીપજાવવાનાં રસિયાં માનો વારસો રુક્કાએ જીલ્યો. નિશાળે જતી ત્યારે મા કેવો નાસ્તો બંધાવતાં એની વાત કરતાં જાય અને એ વાનગીઓની રીત કહેતાં જાય – અણાઘડ રીતે નહીં, કોઈ ‘શેફ’ કહે એ રીતે પદ્ધતિસર. મા ખાસ જાતનો મૈસૂર પાક (મેસૂર) બનાવતાં તેની વાત પણ કરે. રજાઓમાં કાકાને ઘેર જાય. રસોઈરસિક કાકા શાની-રવિએ નિરાંત હોય એટલે રસોડું હાથમાં લે અને અવનવી વાનગીઓ બનાવે. બીજા કાકા મુંબઈમાં વસતા ત્યાં રજાઓ ગાળવા નાની બહેન સાથે પ્રવાસમાં પુણેથી મુંબઈના પ્રવાસમાં સ્ટેશને સ્ટેશને એ જીવાની પ્રખ્યાત વસ્તુઓ – કયાંક ચીકી, કયાંક વળી મેવા-કઠોળ ભરપૂર ચેવડો, ખજૂર ને ડેરીના રસની સૂક્ષ્મવણીની વાનગીઓ બાલમોજની વાતો વેરાતી જાય. રસે આવતાં રમ્ય દશ્યોનાં ચિત્રાંકનો પણ વિરામો મૂકે. મુંબઈમાં કાકાની દીકરીઓ સાથે ફિલ્મ-કલાકાર નરગીસના ઘર પાસેથી પસાર થવાનો અને અણાઘડ રીતે એમનાં ‘દર્શન’નો લહાવ કેવી રીતે આવ્યો તેની વાતો પણ વશય. પોતાના પિતા, અધ્યા, કેવી સ્વાદિષ્ટ રેજટેબલ કટલેટ બનાવતા તેની વાત કહેતાં થાકે નહીં અને પછી એ બનાવવાની અધ્યાની રીત ઉત્પારે, અરે, મોંચાં પાડી લાવે એવાં વાનગી-ચિત્રો પણ આપતાં જાય. કોલેજકાળમાં હોસ્ટેલના અખાદ ખોરાકથી કંટાળીને હોસ્ટેલ સામે હાજરાહજૂર હરતીફરતી કેન્ટીનમાંથી જાતજાતની વસ્તુઓ મગાવીને રૂમ પર જે નાની જ્યાફ્ફો થતી તેની વાતો કરે, એ દુકાનમાં રંધાતી વાનગીઓની – મેનગલોરી વડા, ચીક વડા, કટલેસ, ફુટીના-નાળિયેરની ચટણીની – રેસિપિ આપે.

રુક્મિણીની દાંપત્યકથા પણ અહીં વશાતી આવે છે. વડોદરા યુનિવર્સિટીમાં શિલ્પના અધ્યાપક શંખો ઘોધરી અને એમનાં પત્ની ઈરા કોઈ કામસર મદાસ ગયાં હતો, કોઈ પરિચય-દાદે રુક્મિણીને ઓળખે. રુક્મિણી ભણી ઉત્તરીને ભૂગોળનાં અધ્યાપિકા બનેલાં. વડોદરાનાં આ કલાકાર-દંપતીની નજરમાં એ વસી ગયાં અને સમાજશાસ્ત્ર એમના સાથી-અધ્યાપક શ્રીનિવાસ સાથે એમનો પરિચય કરાયો. શ્રીનિવાસ અને રુક્મિણી પરસ્પરનાં મનમાં વસ્યાં અને દામ્પત્ય પરિણમ્યું, લગ્નની મિજબાનીમાં પિતાની પ્રિય વાનગીઓ, જલેની અને બાસુંદી, પીરસાઈ તેની રેસિપી પણ અહીં આપી છે! બંને સંસાર વડોદરામાં મંડાયો. પણ વડોદરા યુનિવર્સિટીમાં ભજાવવા રહ્યા ત્યારે રુક્મિણીબહેનના રસોઈ-પ્રયોગોએ વળાંક લીધો. એમણે ગુજરાતી વાનગીઓ સાથે પરિચય કેળવવા માંડયો. વડોદરામાં શ્રીનિવાસને જે મૈત્રીઓ મળેલી તેમાં નાનુભાઈ-સવિતાબહેન અમીન-દંપતી પણ હતાં. નાનુભાઈ કાબેલ ઈજનેર અને ઉદ્યોગપતિ હોવા ઉપરાંત ઘણું હતા, પણ રુક્મિણીને જેમાં વધુ રસ પડ્યો એ તો નાનુભાઈની રસોઈવિદ્યામાં. અને પછી તો ગુજરાતી અને દક્ષિણ ભારતીય પાકકળાની જે જુગલબંદી ખીલી તેની રસપ્રદ વાતો અહીં આવેખાઈ છે. નાનુભાઈના વાડામાંથી કેટલાંય શાકભાજ મેળવીને રુક્મિણીબહેન ગુજરાતી વાનગીઓના પ્રયોગો કર્યા. નાનુભાઈના રસોયા મનુ પાસેથી ખમણીઠોકળાં, મેથીભાજુના થેપલાં, હંડવા જેવી વાનગીઓ શીખ્યાં, અને વળતાં એમણે મનુને દક્ષિણાની વાનગીઓની અસલ રીતો શીખવી. લગ્ન પછીને વરસે જ શ્રીનિવાસને અમેરિકાની ડેલીઝેર્નિંઆ યુનિવર્સિટીમાં ફેલો તરીકે જવાનું થયું. ટાંકણે ત્યારે જ, જાઇતા લેખક આર. કે. નારાયણ પણ એ જ યુનિવર્સિટીમાં રહીને પોતાની નવલકથા ‘ધ ગાઈડ’ લખવાના હતા. અગાઉનો પરિચય હતો. નારાયણ એકલા હતા. દરોરજ લેખક આ દંપતીને ઘેર સાંજ ગાળીને, વાળુ કરીને પોતાના મુક્કમે પાછા ફરે એવો સિલસિલો ચાલ્યો, એ સાંધ્ય-ભોજનો નાના ખાદ્યોત્સવો બનતાં ચાલ્યાં. રુક્મિણીની પાકકળાનો એક વધુ કદરદાન આવ્યો જાણે! પોતીકી શૈલીથી રસોઈના પ્રયોગોનાં રેસિયાં રુક્મિણીએ એકવાર અમેરિકન મિત્રને પૂછ્યું ‘ચટણી અને મસાલા

વાટવા માટે પથ્થરની પાટલી મળે? મારે વીજળીક ગ્રાઇડર નથી વાપરવું.’ પેલાએ આંખો મિચકારીને કહ્યું, ‘એ વસ્તુ એક જ જીવાએ હોય : આદિવાસી સંગ્રહાલયમાં!’ – એટલે કે આવું જીનવાણી સાધન આદિવાસીઓ જ વાપરતાં! યુનિવર્સિટીના એ સંગ્રહાલયમાં અમેરિકન આદિવાસીઓનાં પથ્થર અને લાકડાનાં રસોઈ-સાધનો સચવાયાં હતાં, એમાંનું એક આપણાં પાકશાસ્ત્રી સનારી ઉછીનું લઈ પણ આવ્યાં – ચટણી વાટવા માટે! અમેરિકામાં!

અમેરિકાના વસવાટ દરમિયાન પતિ સાથે વારતહેવારે પાર્ટીઓમાં જવાનું થાય અને રુક્મિણીબહેન ભૂખ્યાં રહે : એ ચુસ્ત અન્નાભારી માટે મોટા ભાગની વાનગીઓ અગરાજ, કારણ કે કચ્ચાંક તો માંસ નહીં તો ઢાનો અંશ તો હોય જ. એક દિવસ ત્રણ અધ્યાપક-પત્નીઓ આવી, કહે, ‘અમારાં ટીન-એઈજ સંતાનો શાકાહારે ચડ્યાં છે અને એવી વસ્તુઓ દાબે છે કે એ જાડિયાં થતાં જાય છે; અમને માટે કોઈ સાંદુ ભારતીય શાકાહારી ભોજન શિખવશો?’ પછી તો એમણે સ્થાનિક અખબારમાં રેસિપિઓ મોકલી, વિસ્તારનાં ભાગકો માટે પોતાને રસોડે વર્ગો શરૂ કર્યા, અને, બસ, અમેરિકનોને ભારતીય શાકાહારી ભોજન શિખવવાનો સિલસિલો આમ શરૂ થયો. શીખનારાગોને લઈને નજીકની શાકભાજની વાડીઓ પર જતાં ને તાજાં શાક અને ફળ વીજતાં. શીખનારાંનાં માબાપો કહે, ‘તમે ફી લ્યો.’ ‘અરે, હોય! શિખવવાનો લાખાવ એ જ ફી!’ આજથી સાઈ વરસ પહેલાંના અમેરિકાની આ વાત છે. એમણે જે પહેલાં સોળ ભાગકોને શીખવ્યું એમણે પછી બીજાંઓને શિખવવાના વર્ગો શરૂ કર્યા. ૧૯૭૦માં પ્રોફેસર પતિને એક વરસ માટે ફરી નોતરું મળ્યું ત્યારે તો યુનિવર્સિટીએ જ કહ્યું, ‘પેલા જેવા વર્ગો ચલાવો.’

શ્રીનિવાસ-દંપતીને બે દીકરીઓ. આજે તો ઘરસંસારી અને અધ્યાપિકાઓ તરીકે અમેરિકામાં વસે છે. સત્તર વરસ પહેલાં પ્રા. શ્રીનિવાસ પરલોક ગયા પછી રુક્મિણીબહેન થોડા મહિના બોસ્ટન જાય, બાકીનો સમય વતન બેન્ગલોરમાં રહે. દીકરીઓને પોતાના ખજનામાંથી ઘણી રેસિપિઓ મોકલ્યા કરે. આ બધી રીત સાથે ઘણાં પ્રસંગો ને સ્મરણો સંકળાયેલાં છે એની વાત પણ દીકરીઓને કહે. એ તુલસી અને લક્ષ્મી માને લખે, ‘મા, વધુ રેસિપિઓ

મોકલો ને!’ તેનો અર્થ એ કે વાનગીઓ સાથે વણાયેલી વાતો લખી મોકલો! પછી તો પુન્નોએ જ માને કહું બધાં વાંચી શકે એ માટે લખો. લેખિકા કહે છે, ‘એ દાયકા સુધી દીકરીઓને કહેલા પ્રસંગોનું આ પહેલું ઝૂમખું રજૂ કરું છું’ રુક્મિષી મારી (હવે એ નેવું આસપાસનાં હશે) અમેરિકામાં ભારતીય શાકાહારી ભોજનના વર્ગો ચલાવે છે. ટેલીવિઝન-શો પણ આપે છે. આપણે ત્યાં પણ જ્યાં ખાદ્યસંસ્કારો સિંચાયા હશે, દફ થયા હશે, પરંપરા બન્યા હશે એવાં કુટુંબો. ગામેગામે-શહેરેશહેરે હશે. એમાં કોઈ રુક્મિષી સરખી અન્નપૂર્ણાઓ પણ હશે. જે ઘરોમાં સવારે સવારે વલોણાં ગાજતાં હશે, જ્યાં દાળના વધાર શેરીના છેડે પણ ધીકાઈં મચાવતા હશે, સરખી સાહેલીઓ ગાણાં ગાતી રસોડે લાપસીનાં આંધાણ મૂકતી હશે, કાં ચૂરમાના લાડુ વળતા હશે ત્યારે ગોળ-ધી-જાયફળની સોડમો ચોગરદમ ફરી વળતી હશે, નાતજમજુ જમતાં હશે ત્યારે દાળશાકના સબડકાના તાલ મચતા હશે.... આવા

આવા ખાદ્યસંસ્કાર સાથે બૃહદ પરિવારભાવ પણ ગુંથાયા હશે. આપણને પણ આવી થોડીક ખાદ્યકુલકથાઓ કેમ ન મળે? અરુણાબહેન, સરવા કાને સાંભળો છો ને!

○

પુસ્તક વંચાતું જતું હતું, બેન્ગલોર, વડોદરા, દિલ્હી, કેલિફોર્નિયા... એ નામો આવતાં હતાં, ક્યારે ગયાં તેનો સાલોના નિર્દેશ આવતા જતા હતા, આ બધામાંનું કે મળતું આવતું લાગતું હતું. શ્રીનિવાસ? આગલા જ પુસ્તક દીમેમબર્ડ વિલેજના લેખક પણ શ્રીનિવાસ, એ વડોદરામાં પ્રોફેસર અને રુક્મિષીબહેનની વાતોમાં પણ વડોદરા. કોઈ સંબંધ? ‘દીક્ષિનાં પાનાં પર પતિનો ઉલ્લેખ આવ્યા જ કરે, પણ નામ બધી ચામુ, હુલામણું નામ. રહો, અરધી પુસ્તકે પહોંચું છું ત્યારે એમનાં લગનની વાત આવે છે, પણ એમાં પણ નામ ચામુ જ! પણ એક પાના પર કંકોત્રી છાપી છે એણે જ મને કહું કે રુક્મિષીબાના પતિ ચામુ એટલે જ ઓમ. ઔન. શ્રીનિવાસ, ‘સ્મરણમાં સચવાયેલા ગામડાની વાત આપણને કહી જનાર સમાજશાસ્ત્રી.

□

### સાહિત્ય અકાદેમી પુરસ્કારો

૨૦૧૬ માટેનો સાહિત્ય અકાદેમી, દિલ્હીનો બાળસાહિત્ય પુરસ્કાર ‘બંટીના સૂરજદાદા’ બાળવાર્તાસંગ્રહ માટે પુષ્પ અંતાણીને તથા યુવાસાહિત્ય પુરસ્કાર ‘ગાળવપૂર્વક’ કાબ્યસંગ્રહ માટે અંકિત ત્રિવેદીન આપવાનું જાહેર થયું છે.

બંને મિત્રોને હદ્દયપૂર્વક અભિનંદન.

પ્રિયદર્શિની એકેડેમી દ્વારા કવિ-વાર્તા-નવલકાર-વિવેચક રાધેશ્યામ શર્માનું ‘ગુજરાતી લિટરરી અવોર્ડ’ દ્વારા રાધેશ્યામભાઈને સર્સેહ અભિનંદન.

સાહિત્ય અકાડેમી : વાર્તા-અનુવાદ કાર્યશિબિર

(તીથલ, ૧૫-૧૬ માર્ચ ૨૦૧૬)



### મંડળી મળવાની ઉપલબ્ધિ

નીના ભાવનગારી

જોયા અંકના 'પ્રત્યક્ષીય'માં 'નાની નાની ગોઝી-મંડળીઓ'- અંતર્ગત જેનો નિર્દેશ કરેલો એ કાર્યશિબિરનો નીના ભાવનગરીએ કરેલો સમીક્ષિત અહેવાલ ૨જુ કરીએ છીએ.

અધ્યક્ષ, અતિથિવિશેષ, દીપ્પ્રાગટ્ય, શ્લોકગાન.... થડી નહીં પણ 'કેમ છો?' 'કેમ છો?' -ની તાજગીથી અને મસાલેદાર ચા સાથે આ શિબિર, કહો કે કાર્ય-શાળાનો આરંભ થયો હતો. સંયોજકની પાડી પૂર્વતૈયારી તેમજ અનુવાદકોના મજબૂત ગૃહકાર્યની પીઠિકાથી દરિયાકિનારાના પવનો એકદમ અનુકૂળ થઈ ચૂક્યા હતા : ભારતીય ભાષાઓમાંથી, દરેક ભાષાને પ્રતિનિધિત્વ મળે એ રીતે, વીસેક (અંગ્રેજીમાં અનૂદિત અને સામખ્યિક-ગ્રંથસંપાદનોમાં પ્રકાશિત) વાર્તાઓનું સંયોજક, અનેક વાર્તાઓ વાંચીને, ચથન કર્યું હતું ને શિબિરથીઓને બબે વાર્તાઓ મોકલી આપી હતી - આનો અનુવાદ કરી લાવશો. પર્યાપ્ત સમય અપાયો હતો. શિબિરથીઓમાં ગુજરાતીના જાણ્યામાણ્યા વાર્તાકારો પણ હતા; બિન-વાર્તાકારો છતાં નમ્ર તેમજ મહેનતુ, ભરોસાલાયક અનુવાદકો પણ હતા. આ બધાં જ ત્રણેક પેઢીનાં, ને છતાં નવીનતર પેઢીનાં લાગે એવાં પ્રતિનિધિઓ હતાં. વરિષ્ઠ રમેશ ઓઝાથી નવોદિત ઇમરાન સુરતી સુધીનાં. સંયોજક હિમાંશી શેલતે લખેલું કે રમણ સોની અને શરીફા વીજળીવાળા એ બે પરામર્શકો. એ બે કહે કે અમે તો વાર્તાના અનુવાદો પણ કરી લાવવાનાં - મોકલશો. સંયોજક કહે, ભલે, તો સંયોજક પણ વાર્તા-અનુવાદ કરીને ૨જુ કરશે. ઉચ્ચાવચ્ચતા એમ ઓગળી ગઈ. સંયોજિકા વળી ઉમદા આયોજિકા-વ્યવસ્થાપિકા પણ. ચા-બિસ્ટીટી રસોંડું તાજગીવાળું કરી દીવિલું. મિષ્ટ ભોજનનું ને સાંજે દરિયાકિનારે જવાનું 'આયોજન' પણ આ સૌ શ્રમિકો માટે કીધેલું. સૌને મજાક-મસ્તીની છૂટ હતી પણ ચર્ચા તો તલવારની ધાર પર થતી હતી. સરસ અનુવાદની સરાહના સાથે જ વૈકલ્પિક પર્યાય સુધ્યાં માટેની તીજી તકરાર. હળવાંથી ભારે આકમજા-અપટાં થયાં ને ઔપચારિક-અનૌપચારિક એકાકર થયાં. બે દિવસની લાંબી લાંબી, મહેનતુ પણ મજાની બેઢકોનું પરિણામ એવું તો રોમાંચક હતું કે છૂટાં પડતાં પહેલાં અનેકવાર બધાંએ કહ્યું કે આવા કાર્યશિબિરો થતા રહેવા જોઈએ - નક્કર અને સ્વાધ્ય. આ ૨૦ વાર્તાઓના અનુવાદનું પુસ્તક સાહિત્ય અકાડેમી પ્રકાશિત કરશે ત્યારે એનું વધુ મૂર્ત પરિણામ સામે આવી શકશે. અલબત્ત, સમીક્ષય પરિણામ.

- સંપાદક]

## મંડળી મળવાની ઉપલબ્ધિ

નીના ભાવનગરી

મંડળી મળવાથી થતી લાભનો ફળદાયી અને સુખદ અનુભવ કરાવે એવો આ અનુવાદકાર્યશિબિર ટૂકીવાર્તાના સન્દર્ભે તીથલા દરિયાકંઠના એક અતિથિ-આવાસમાં ખુશનુમા વાતાવરણમાં આયોજિત થયો હતો. પર્યાન્ત પૂર્વીયારી સાથેના આ અનૌપચારિક કાર્યશિબિરનાં સંયોજક હતાં સાહિત્ય અકાદેમી, હિલ્લીની ગુજરાતી સલાહકાર સમિતિનાં સભ્ય અને ખ્યાત વાર્તાકાર હિમાંશી શેલત. નીવડેલા અને નવા પણ કાર્યનિષ્ઠ અનુવાદકોની બનેલી આ મંડળીને મેળવતાં પૂર્વે સંયોજક હિમાંશી શેલતે, શિબિર હેતુપ્રોજક નીવડે તે માટે મહિનાઓ પહેલાં તૈયારી આરંભી હતી. વિવિધ પ્રાદેશિક/ભારતીય અંગ્રેજ ભાષામાં લખાપેલી અને વાર્તાકળાની દસ્તિએ નોંધપાત્ર એવી ૧૫૦ ઉપરાંત વાર્તાઓમાંથી તેઓ પસાર થયાં અને શિબિરમાં નિમંત્રિત અનુવાદકોને બે/ત્રણ જુદી જુદી ભાષાઓની વાર્તાઓ પસંદ કરીને એ વાર્તાઓને ગુજરાતીમાં અનુષ્ઠાનિક કરી લાવવાનો સ્વાધ્યાય તેમજે ફાળવ્યો હતો. જો કે, દરેક અનુવાદકને પોતાને ફાળવાયેલી ભાષાની બીજી કોઈ પોતાને ગમતી કળાત્મક વાર્તાની પસંદગી કરવાની મોકણાશ પણ તેમજે આપેલી. શિબિરમાં બે દિવસના ટૂકા ગાળમાં રોજ ત્રણ-ત્રણ બેઠકો થતી. પ્રત્યેક અનુવાદક પોતે કરેલામાંથી ઓછામાં ઓછી એક વાર્તાનો અનુવાદ મંડળી સમક્ષ વાંચે એવી અપેક્ષા હતી. જાણીતાં વિવેચક-અનુવાદ-સંપાદક રમણ સોની અને શરીઝા વીજળીવાળા પોતાના અનુવાદકર્યાના સઘન અને વિસ્તૃત અનુભવની મિરાત સાથે - ઉપસ્થિત હતાં, વિષય-નિષ્ણાત તરીકે. બનેએ પોતે કરેલા વાર્તાનુવાદ પણ પ્રસ્તુત કર્યા અને પ્રત્યેક અનુવાદ માટે વાર્તાને ઉપકારક, ભાષાકીય રીતે અનુરૂપ શબ્દ/શબ્દસમૂહ/વક્યના વિકલ્પો પણ સૂચવ્યા.

કાર્યશિબિરનું બીજું એક વૈશિષ્ટ્ય એ હતું કે અનુવાદકોમાં સિદ્ધહસ્ત ગુજરાતી વાર્તાકારો - ડિશેટ દૂધાત, બિપિન પટેલ, પ્રવીણસિંહ ચાવડા, બિંદુ ભણ, અધ્યાત્મિક બાપટ અને હિમાંશી શેલત ઉપસ્થિત હતાં. આ સૌની સર્જનશીલ ભાષા પરની પકડ એમના અનુવાદોને પણ ઉપકારક નીવડે એ તો સ્વાભાવિક હતું. ઉપરોક્ત નામો

ઉપરાંત અંગ્રેજ-ગુજરાતી પર સમાન અધિકાર ધરાવતા પ્ર. રમેશ ઓઝા, નીના ભાવનગરી, સુષ્પમા લેલે, અને ઈમરન સૂરતી પણ અનુવાદક તરીકે શિબિરમાં ઉપસ્થિત હતાં.

ઉપકમ એવો રાખેલો કે, અનુવાદક પોતાનો ગુજરાતી અનુવાદ વાંચતી જાય ત્યારે બાકીના સૌના હથમાં મૂળ વાર્તાની (અંગ્રેજ, કે હિન્દી, કે અન્યભાષા વાર્તાના અંગ્રેજ અનુવાદની) લેરોક્સ નકલ હોય. વંચાઈ રહેલી વાર્તાના મર્મને પકડી લઈને એના ભાષાપ્રવાહને અનુરૂપ, સન્દર્ભોચિત ચર્ચા થતી જાય, ગુજરાતી શબ્દવિકલ્પો સૂચવાતા જાય, વક્યની રેચના અંગેય નુકટેચીની થતી જાય... અનુવાદક પણ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા જાય.

શિબિરમાં ગુજરાતી અનુવાદરૂપે વંચાયેલી વાર્તાઓમાં ભારતીય અંગ્રેજ ('સ્વાતંત્ર્યદિન') બંગાળી, મલયાલમ ('ચૂટેલ') અને 'નાનકાની વારતા'), ઉર્દૂ ('નિર્જય' અને 'વપરાયેલ'), તમિન ('ઉંદર', 'ભૂલભુલામણી', 'અંકલ'), ઓડિયા ('વારસો', 'સૌથી લાંબી રાત') અને મરાઠી (ગતજન્મ) ભાષાની વાર્તાઓ સમાવેશ પામી હતી. ત્રણ ચાર વાર્તાઓનાં ગુજરાતી શીર્ષકો અંગે ઠીક ઠીક ચર્ચા થઈ. બંગાળી વાર્તા 'After the Rape'નું શીર્ષક અનુવાદક પ્રવીણસિંહ ચાવડાએ 'ઘટના બની ગયા પછી' એટું કર્યું પછીથી એમજો શીર્ષક 'ઘર ભાડી' એમ ફેરબ્યું છે. - સંપાદક પોતાની સર્જનશીલી અને ભાષાકર્મને અનુરૂપ શરીરી વીજળીવાળા ઉર્દૂ કથા 'ઊતરન'નો અનુવાદ 'વપરાયેલ' એવો વાર્તાના વિષયવસ્તુને અનુરૂપ કર્યો. કેટલાકે 'એહુ' એવો વિકલ્પ પણ સૂચવ્યો. ઉર્દૂ વાર્તાનું 'ફેસલો' કરવું કે 'નિર્જય' એ વિષે પણ હળવી રોગ મુખર ચર્ચા થઈ. પણ 'ફેસલો'માં અર્થછાયા ગુજરાતીમાં બદલાય એ જોતાં 'નિર્જય' પર પસંદગી ઊતરી. 'The Witch' એટલે 'ચૂટેલ' કે 'ડાકણા?' વાર્તાસન્દર્ભમાં 'ચૂટેલ' વધુ પ્રયોજક લાગતું હતું. આવી તો અનેકાંક્ષા ચર્ચાઓ શિબિર દરમિયાન થઈ. વાર્તાવાચન દરમિયાન રમૂજ, વિનોદ અને હાસ્યની છોળો ઊડતી રહી. બંને દિવસે સાંજે સાગરકંઠાનો સૂર્યાસ્ત પણ મંડળીએ માણયો.

હિમાંશી શેલતે અનૌપચારિક વાતોમાં સરસ મુદ્દો ઉખેલ્યો. વાર્તાસર્જક પોતે પોતાની વાર્તાનો અંગ્રેજ/હિન્દી, અનુવાદ આપતો હોય ત્યારે 'આ તો મારી પોતાની જ વસ'

એવા જ્યાલમાં વધુ પડતી છૂટ લઈ લેતો હોય એવું બને. તો એ કેટલે અંશો સ્વીકાર્ય? ચર્ચાઓ દરમિયાન બીજો એક મુદ્દો પણ ઉપસ્યો. અનુવાદક પોતે એક વાર્તાકાર હોય ત્યારે વાર્તાકળા અને લક્ષ્યભાષા પરના પોતાના ગ્રભુત્વને કારણે મૂળ વાર્તામાં શબ્દો/વાક્યો કે શબ્દસમૂહો અર્થપ્રત્યાયન માટે ઉમેરે કે દૂર કરે તે વાજબી ગણાય ખરું? આ મુદ્દા પરથી રમણ સોનીએ અનુવાદનાં શાસ્ત્ર અને શાસ્ત્રીયતા વિષે અછાદતી ચર્ચા છેડી અને સારો, મૂળને વજાદાર, નબળો અનુવાદ – કેવા હોય તેની વાત કરી. અને વજાદાર અનુવાદ પણ વાંચવે ગુજરાતી તો લાગવો જ જોઈએ – એમ કહું. શરીર્ફા વીજળીવાળાએ મેઘાણીનાં અનુસર્જનો અને ગિરીશ કર્ણિંના અનુવાદો વિષે પણ ઉલ્લેખ કર્યો,

અંગ્રેજ ભાષામાં આપણી પાસે આવતા મૂળને અન્યાયકર્તા અનુવાદો વિષે પણ માહિતી આપી.

અવારનવાર વાંચવા મળતા રેઢિયાળ ગુજરાતી અનુવાદો મૂળ વાર્તાના મર્મનો વધ કરતા લાગે છે તેને બદલે અકાદેમી જેવી સંસ્થાઓએ સૂચિત પ્રકાશિત અનુવાદો માટે આવા કાર્યશિબિર પ્રયોજવા જોઈએ એવી પ્રતીતિ પ્રત્યેક શિબિર-પ્રતિભાગીને થઈ એમાં જ આ કાર્યશિબિરની સાર્થકતા. બોજન-આવાસ ઈત્યાદિની સરસ વ્યવસ્થા અને સુંદર નૈસર્જિક માહોલ છોગામાં.

બે દિવસને અંતે, વાર્તા-અનુવાદોની તેમજ અનુવાદક-મિત્રોની સમજભરી નિકટતા વધી એ પણ આ શિબિરની પ્રસન્ન ફલશ્રૂતિ. □

- પ્રાદેશિક ભાષામાં રચાયેલી વાર્તા પ્રથમ અંગ્રેજ કે હિન્દીમાં આવે અને પછી ગુજરાતીમાં. એટલે મૂળ કૃતિનું સત્ત્વ જાળવવાનો પડકાર રહે. તે સાથે અંગ્રેજી/હિન્દી અનુવાદમાં કંઈક ચૂકી જવાયું હોય તો એ ક્ષતિની પણ ગુજરાતી અનુવાદ પર અસર થવાની. આમ છીતાં અનુવાદ(વાર્તાનો) પ્રાદેશિક લાક્ષ્ણિકતાઓનો પરિચય આપે અને આપણા પ્રદેશની વાર્તા ક્યાં ઊભી છે એનોય નિર્દેશ કરે એટલી એની આવશ્યકતા.
- કથાસાહિત્યમાં વપરાતા અંગ્રેજ શબ્દોના ઉચિત ગુજરાતી પર્યાયોની શોધ અને તદ્વિષ્યક ચર્ચા કેટલી આવશ્યક છે એ પણ આ શિબિર દ્વારા સમજાયું. સમયની જેંચને કારણે એ દિશામાં જવાયું નહીં પણ નાનકડી મંડળીમાં આવા પ્રયાસ કરવા જોઈએ એમ લાગે છે. નિજાનંદે પણ આવી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ મળવો રહ્યો.

હિમાંશી શેલત (સંયોજક)

૧. હેમણ્ઠ દવે, ૨. હર્ષવદન ત્રિવેદી

૧. રૂમંડનું ગુજરાતી વ્યાકરણ?

પ્રિય રમણભાઈ,

પ્રત્યક્ષના જૂન-સાયેમ્બર ૨૦૧૫ના અંકમાં હર્ષવદન ત્રિવેદીએ લખેલા ઊર્મિ દેસાઈકૃત પુસ્તકના અવલોકનમાં ૨૪૪ કરાયેલા એક વિચાર વિશે દીપક મહેતાનો પત્ર ઓફ્ફોબર-ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ થયો છે. પોતાના અવલોકનમાં હર્ષવદન ત્રિવેદીએ આ મુદ્રે કર્યો છે : ‘રૂમંડે સંસ્કૃતના જ્ઞાનકાર કોઈ ગુજરાતી શાસ્ત્રી પાસે આ વ્યાકરણ લખાવી તેનો અંગ્રેજ અનુવાદ કર્યો હતો કે કેમ એ પણ તપાસનો વિષય છે.’ દીપક મહેતાને આ વિધાન વાંચી ‘દુઃખ આશ્રમ્ય’ થયું છે. એમણે આવી શંકા કેમ ટકી શકે તેમ નથી એનાં ચાર કારણો આપ્યાં છે અને પત્રના અંતે ડૉ. રોબર્ટ રૂમંડ અને એમના પુસ્તક વિશે વધુ માહિતી મેળવવા માટે પોતાનું પુસ્તક ઔગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર (૨૦૧૫) જોવાની ભલામણ કરી છે. હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ. પણ હું પત્રલેખકની એ વાત સાથે સમ્મત થાઉં છું કે આ ગ્રંથ ‘અનુવાદ’ ન હોઈ શકે, છીંતાં આ સંદર્ભે બે-ત્રણ મુદ્રા કરવા મને જરૂરી જણાય છે.

૦

રૂમંડે ગુજરાતી (અને મરાઠી)<sup>૧</sup> મૂળાક્ષરો અને વાક્યોની માહિતી આપ્તી વખતે સંસ્કૃત વ્યાકરણના પારિભાષિક શાબ્દો—‘વ્યંજન માટે હલ્લ, સ્વરો માટે અચ્છ, નામપદ માટે સુબજ્ઞતા, આખ્યાત માટે તિંનત’<sup>૨</sup>—નો પ્રયોગ કર્યો છે એ બાબત અંગે હર્ષવદન ત્રિવેદીએ પોતાના અવલોકનમાં ખાસ ધ્યાન દોર્યું છે. એમની ઉપર જણાવેલી શંકા પણ આ પછી તરત આવે છે. રૂમંડ જેવી પણ્ણિમી વ્યાકરણશાસ્ત્રથી પરિચિત વ્યક્તિ અંગ્રેજ ભાષામાં અને મુખ્યત્વે યુરોપીય

વાચક માટે રચાવેલા—દીપક મહેતા પોતે જ લખે છે કે આ વ્યાકરણ ‘મુંબઈ ઈલાકામાં કામ કરતા અંગ્રેજો—સરકારી અમલદારો અને પાદરીઓ—ને મદદરૂપ થવા’<sup>૩</sup> લખાયેલું. ‘ગુજરાતી વ્યાકરણ’માં સંસ્કૃત વ્યાકરણની શબ્દાવલિ ક્યા શાસ્ત્રસંવર્ધનાર્થે પ્રયોજે છે, અથવા પ્રયોજ હોઈ શકે, એ વિશે પત્રલેખક, એમની પાસેથી અપેક્ષિત, કશો પ્રકાશ પડ્યો નથી.

૦

અર્વાચીન ભારતના બૌદ્ધિક ઈતિહાસ ઉપર સંનિષ્ઠ કામ કરનાર હરકોઈ વ્યક્તિને એ જાણ હોય જ કે ઓગણીસમી સદીમાં, અને એની આગલી-પાછલી સદીઓમાં, યુરોપીય વિદ્વાનોએ જે કામ કર્યો તેમાં આપણા પંડિતો અને શાસ્ત્રીઓની મૂલ્યવાન ભૂમિકા હતી. અહીંના ગ્રંથોની ભાગ મેળવવાથી માંડીને એમને વાંચવામાં, એમનું સંપાદન કરવામાં, એમના અનુવાદ કરવામાં અને એના અભ્યાસમાં એતદેશીય વિદ્વાનોની ભૂમિકા અભ્યાસીઓને સર્વવિદ્ધિત છે (સર્ર૦ રોશર ૧૯૮૬: ૩ અને નોંધ ૧૧, ૪૮-૫૧; અને હવે વીરચંદ ધરમસી ૨૦૧૨: ૨૩-૩૦). દાંત૦, એચ૦ એચ૦ વિલ્સન લખે છે કે પુરાણો ઉપર સંશોધન કરવા માટે –

I employed [‘several able Pandits’] to prepare a minute index of each of the Puráṇas. This was not a mere catalogue of chapters, or sections, or heads of subjects, but a recapitulation of the subjects of every page and almost every stanza in each page [...]. These indices were drawn up in Sanscrit. To convert them into English I employed several native young men, educated in the Hindú college, and well conversant with our language, and to them the Pandits explained the Summary which they had compiled (સર્ર૦ રોશર ૧૯૮૬: ૩).

ઘણા કિસ્સાઓમાં આ સ્થાનિક પંડિતોનાં નામનિર્દેશ દેવાનું કે એમનો ઝડણસ્વીકાર કરવાનું આ

‘વિદ્વાનો’એ ટાળ્યું છે. બર્ટન અને આબધાર્ટના નામે હાલ બોતલો કામસૂત્રનો અનુવાદ પંડિતોએ (શિવરામ ભીડેએ ભગવાનલાલ ઠિન્ડજીની મદદથી) કરેલો એ હવે, વીરચંદ ધરમસીના તદ્વિષ્યક સંશોધનને કારણે, ઘણ્યું જાડીતું છે (સર્ર૦ વીરચંદ ધરમસી ૨૦૧૨: ૧૪૮-૧૫૧). —અને આવા કિસ્સા એકલદોકલ નથી એ આ ક્ષેત્રમાં કરતા વિદ્વાનોથી અજાણ્યું નથી.

મુગલયુગ દરમાન ઘણા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયેલો. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ફેરી, મુલ્યાં શરીરી, દારા શુકોહ જેવા વિદ્વાનોએ સંસ્કૃતમાંથી ફારસીમાં આ અનુવાદ કરેલા. પણ આ ‘અનુવાદો’ની પ્રક્રિયા, હોડીવાળાએ બતાવી છે તેમ, આવી હતી: પહેલાં હિન્દુ શાસ્ત્રોએ સંસ્કૃત ગ્રંથોની ‘સમજૂતી’ દેશી ભાષામાં તૈયાર કરતા અને ત્યાર બાદ એ ‘સમજૂતી’ની ‘સમજ્જણ’ ફારસી અનુવાદકને આપત્તા (સર્ર૦ વિલ્સને ઉપર જે લખ્યું છે તે: ‘to them the Pandits explained the Summary which they had compiled’) અને ત્યાર બાદ જે તે ફારસી ભાષાવિદ એનું ફારસીમાં રૂપાંતર કરતા. જાણીતા ભારતવિદ અલબીરુની વિશે પણ સખાઉંએ લખ્યું છે કે, ‘he seems to have read Indian books with the aid of Pandits and to have written his translation simply from their dictation’ (સર્ર૦ હોડીવાલા ૧૯૭૮/૧૯૮૪: ૫૬૪-૬૬). પ્રારંભિક તબક્કે કેટલાયે યુરોપીય વિદ્વાનોના અનુવાદો અને અભ્યાસો આ મુગલયુગીન અનુવાદપ્રક્રિયાથી ખાસ ભિન્ન નહોતા.

પરદેશી વિદ્વાનોને નામે ચેલેલાં આવાં પુસ્તકો એ વિદ્વાનોએ સ્વતંત્ર રીતે, જાતમહેનતથી જ લખેલાં એવું તો રંગદર્શી મુગધ નવઅભ્યાસી માને. પણ ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારોથી સુપરિચિત દીપક મહેતા પણ આવું માને? ઓગણીસમી સદીનાં ગુજરાતી પુસ્તકો અને એમના કર્તાઓને દીપક મહેતાએ એ સમયના બૌદ્ધિક ઈતિહાસના વ્યાપક સંદર્ભમાં જોવા હોત તો હર્ષવદન ત્રિવેદીની ટિપ્પણીનું હાઈ એમને સમજાયું હોત, કઢાય.

ગુજરાતી વાકરણોના સંદર્ભમાં હોપ અને ટેલર પર તત્કાદે થયેલા આશેપોનો નિર્દેશ કરવાનું ઊર્મિબહેન જેવાં

અભ્યાસી ચૂક્યાં નથી તો હર્ષવદન ત્રિવેદીએ પણ પોતાના અવલોકનમાં એ વિશે આપણું ધ્યાન ખેંચ્યું છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ જો પાશ્વાત્ય લેખકો ગુજરાતી પંડિતોનો આશ્રય લેતા હોય તો એ સદીના પહેલા દાયકામાં કોઈ લેખક સંપૂર્ણ સ્વતંત્ર રીતે ગુજરાતી અને મરાઠી ભાષાના ‘પહેલવહેલાં’ કહેવાતાં વ્યાકરણ લખે તો એ વિશે શંકા થવી સ્વાભાવિક છે.

એ સિવાય, ઇમ્ફના આ પુસ્તકમાં પારસીઓને લગતા, ઐતિહાસિક રીતે મહત્વના ગણાતા, ‘સોળ શ્લોક’નો અંગ્રેજ અનુવાદ જોવા મળે છે (૧૮૦૮: ‘પારશી તથા પરશોશે’ હેઠળ). આ શ્લોકો આકા અધ્યાતુ નામક પંડિતે સંસ્કૃતમાં રચ્યા હતા (સર્ર૦ શિમ્પટ ૧૮૬૨).<sup>૫</sup> ઇમ્ફને આ શ્લોકોના અનુવાદ વિશે કશો નિર્દેશ મૂક્યો નથી. એટેલે આપણે તો મુજબ રીતે એમ જ માની લેવાનું કે એમણે એ અનુવાદ સ્વયં સંસ્કૃતમાંથી અંગ્રેજમાં કર્યો હતો! અને જો એમ માનીએ તો ઇમ્ફને ગુજરાતી અને મરાઠી, વળી મલવાળમ ઉપરાંત સંસ્કૃતના પણ પંડિત હતા એમ માનવું રહે! એ કાળે આટલી બધી ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા અંગ્રેજ અમલદારનું નામ, અંગ્રેજ ઈતિહાસમાં પણ, આટલી ઝડપથી ભુલાઈ જાય અને એમના વિશે ભાગ્યે કશી માહિતી સચવાઈ હોય એ મોટું આશર્ય!

ટૂકમાં, ઇમ્ફને પોતાનું પુસ્તક લખવા માટે સ્થાનિક પંડિતોની મદદ નહીં જ લીધી હોય એમ, તત્કાલીન બૌદ્ધિક ઈતિહાસની વિગતો જોતાં, માની શકાતું નથી.

## ૦

આ પત્રમાં દીપક મહેતાએ એમના પત્રમાં કેટલીક જાડીતી—અને હવે નવાં સંશોધનોને કારણે અમાન્ય બનેલી—વિગતોની સાથે એક નવી, અગત્યની વિગત મૂકી છે, અને એ આ : ઇમ્ફને ઈલસ્ટ્રેશનનું લખ્યું એ પૂર્વ ૧૭૮૭માં ઘેરે ઔંવ ધ મલબાર લેંજિવિજ લખ્યું હતું, જેની પ્રસ્તાવનામાં ઇમ્ફને, દીપક મહેતા લખે છે તે પ્રમાણે, ‘બહેરામજ ધાપગરનો અને તેમણે બનાવેલાં ગુજરાતી બીબાંનો ખાસ ઉલ્લેખ કર્યો છે, એટલું જ નહિ, તેના નમૂના પણ મૂક્યા છે’ (૨૦૧૫-૬: ૪૩).

આ બાબત ખૂબ મહત્વની છે, બેશક. પણ દીપક મહેતાએ ‘ડોં રોબર્ટ ઇમ્ફને અને તેમના પુસ્તક વિશે વધુ

માહિતી માટે' પોતાનું જે પુસ્તક જોવાની ભલામણ કરી છે તે ઓગઝીસમી સર્વીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકારમાં આ મલબારી ભાષાના વ્યાકરણનો કે બહેરામજી છાપગરનો કે એમણે બનાવેલાં ગુજરાતી બીબાંનો કોઈ જ ઉત્તેખ નથી. આ પુસ્તકમાં ડ્રમેડ વિશે ચર્ચા 'પ્રથમ ગુજરાતી પુસ્તક' એ લેખમાં તથા 'ગુજરાતી મુદ્રણ, ભાષા અને લિપિ' એ લેખમાં કરવામાં આવી છે (જુઓ, ૨૦૧૫-અ અને ૨૦૧૫-ક), પણ બન્નેમાંથી એક લેખમાં મલબારી વ્યાકરણ વિશે કે એમાં જોવા મળતાં ગુજરાતી બીબાં વિશે કશો જ ઉત્તેખ નથી.

દીપક મહેતાનો લેખ 'પ્રથમ ગુજરાતી પુસ્તક' અગાઉ ફાર્બર્સ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં 'આપણું પહેલું પુસ્તક : વ્યાકરણ, શાબ્દસંગ્રહ અને બીજું ઘણુંબધું' એવા નામ હેઠળ ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો (ફાગુસત્રે ૭૨ (૪): ૩૨-૩૮). આ લેખ ત્યાર બાદ એ જ નામથી ૨૦૧૦માં એમના પુસ્તક ઓગઝીસમી સર્વીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ પુસ્તકમાં પુનઃપ્રકાશિત કરાયો હતો (પ્ર૦ ૧૦-૧૮). અને છેલ્દે, ૨૦૧૫માં, ત્રીજી વાર, ઓગઝીસમી સર્વીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકારમાં કશા જ ફેરફાર વિના ફરી પુનર્મુદ્રિત કરાયો છે (પ્ર૦ ૮૨-૮૮). (જેકે, દીપક મહેતાએ એમના તાજેતરમાં, ૨૦૧૫માં, પ્રકાશિત પુસ્તકનો જ સંદર્ભ દેવો મુનાસિબ માન્યો છે!)

એટલે કે, દીપક મહેતાએ ૨૦૦૭થી ૨૦૧૫ સુધી, નવ વર્ષોમાં, ત્રૈશેમાંનાં એક પણ સ્થળે ડ્રમેડ વિશે ચર્ચા કરતી વખતે એમના મલબારી ભાષાના વ્યાકરણનો કે એમાં છાપાયેલાં ગુજરાતી બીબાંનો નિર્દેશ કર્યો નથી. આ વાત ખાસ નોંધપાત્ર છે. આપણે એમ ચોક્કસ કહી શકીએ કે એમને આ બાબતની જાણકારી હોત તો તેઓ, એમની આગવી શૈલીમાં, ગુજરાતી વિદ્વજજગતનું આ વિશે ધ્યાન દોર્યા વિના ન રવ્યા હોત. આ એટલા માટે પણ ખરું કે કે એમણે એ પુસ્તકની પ્રકાશન સાલ ૧૭૮૭ આપી છે. તેઓ અન્યત્ર લખે છે: '૧૭૮૭ પહેલાં ગુજરાતી મુદ્રણની સગવડ જ નહોતી. એટલું જ નહીં, ૧૭૮૭માં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ તે પણ આજના ગુજરાત રાજ્યમાં આવેલા કોઈ સ્થળે નહીં' (૨૦૧૫-અ: ૧૩). એટલે, જો મલબારી ભાષાના વ્યાકરણમાં ૧૭૮૭માં ગુજરાતી બીબાંના

નમૂના હોવાની એમને જાણકારી હોત તો એમણે એનો નિર્દેશ, વિશિષ્ટ રીતે, કર્યો જ હોત. અસ્તુ.

મારા મિત્ર મેહલી ભાંડુપવાલાએ ખાંખત કરીને ફાર્બર્સ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં જે કેટલાક ભૌંય ભાગનારા શોધનિબંધો લખ્યા છે તેમાં એક 'અધારમી સર્વીમાં ગુજરાતી છાપાકામ' છે (સર૦ ભાંડુપવાલા ૨૦૧૪). ડ્રમેડના ૧૭૮૭માં પ્રકાશિત મલબારી ભાષાના વ્યાકરણમાં બહેરામજી છાપગરની અને એમણે બનાવેલા ગુજરાતી બીબાંના નમૂનાને લગતી વિગત સચિત્ર, સર્વપ્રથમવાર આ નિબંધમાં મુકાઈ. (જુ હા, આ વ્યાકરણ સને ૧૭૮૭માં પ્રકાશિત થયેલું; દીપક મહેતા લખે છે તેમ ૧૭૮૭માં નહીં.) મારી જાણમાં આ વિગત મેહલી ભાંડુપવાલાના પૂર્વોક્ત લેખ પહેલાં ગુજરાતીમાં કદી લખવામાં આવી નહોતી.<sup>૪</sup>

મુદ્રે કેવળ એટલો જ કે આ અત્યંત મહત્વની વિગત માટે જેમાં આ વિગત છે જ નહીં તે પોતાના ત્રીજી વાર પુનર્મુદ્રિત થયેલા લેખને સમાવતા પુસ્તકનો નિર્દેશ કરવાને બદલે, અથવા તેની સાથે સાથે, દીપક મહેતાએ ભાંડુપવાલાના ઉપરોક્ત શક્વર્તી નિબંધનો સંદર્ભ આપવાની જરૂર હતી..

૦

ત્રીજો મુદ્રે ડ્રમેડના પુસ્તકને 'ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણનું પુસ્તક' ગણાવવા સંદર્ભે છે. પ્રશ્ન એ છે કે 'ગુજરાતી' એટલે શું, 'ગુજરાતી ભાષા' એટલે શું, અને 'ગુજરાતી ભાષાનું વ્યાકરણ' એટલે શું? ગુજરાતી ભાષાના પંડિતો ભરતેશ્વરબાહુબલિ ઘોર અને ભરતેશ્વરબાહુબલિ રાસને ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ તરીકે ગણાવે છે, અને એમનો સમય ઠીંસની બારમી સર્વી હોવાનું જરૂરાવે છે. પંડરમી સર્વીમાં ભાલાક આ ભાષાને 'ગુજરબાખા' કહી ઓળખાવે છે. ઈં ૧૭૮૪ના મુજદ્દાવલોધાંકિતકમાં જૂની ગુજરાતી ભાષાનું વ્યાકરણ, ભલે પરોક્ષ રૂપે તો એમ, મળે છે (સર૦ કે૦ ૯૦ ધ્યુવ ૧૮૮૮/૧૮૮૫; ઈં ૯૦ ધ્યુવ ૧૮૮૮; ગ્રિયર્સન્ ૧૮૦૨), જેનો અધિકતો નિર્દેશ હર્ષવદન ત્રિવેદીએ એમના અવલોકનના અંતે કર્યો છે, સોળમી સર્વીમાં સાધુ સુંદર ગણિના ઉક્તિરત્નાકરમાં પણ એ સમયની રાજસ્થાની અને એની સમકાಲીન કેટલીક

બોલીઓની વ્યાકરણીય સામગ્રી મુજાઈ છે (સર્ટો જિનવિજ્યકુ ૧૮૫૭). વાચકોની જાણ માટે નોંધું કે આ ફૂતિમાં વ્યાકરણ વ્યુત્પત્તિગત શબ્દાવલિના માધ્યમે આપવામાં આવ્યું છે.

ડ્રમંડનું પુસ્તક (મરાઠી અને અંગ્રેજી ઉપરાંત) ગુજરાતી ભાષાની વ્યાકરણની કેટલીક, સાવ પ્રાથમિક, વિગતોને રજૂ કરતું હોવાથી, કે એમાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ થયો હોવાથી, કે એક પરદેશી અંગ્રેજીની કલમે લખાયેલું હોવાથી, કે ‘મુદ્રિત’ હોવાથી એને ‘ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ પુસ્તક’ ગણાતું એ કાંઈ સ્પષ્ટ થતું નથી. આ પ્રકારના ઔક્સિટો કે ઉક્સિરલ્નાકરો સાથે ડ્રમંડના પુસ્તકનો સીધો સંબંધ ન સ્થાપી શકાય તો પણ એને પહેલું વ્યાકરણનું પુસ્તકનું બહુમાન આપવું કે કેમ એનો વિચાર કરવો રહે. ડ્રમંડ એમના મલબારી ભાષાના વ્યાકરણને સ્પષ્ટ રીતે ‘ગ્રેમર અવ ધ મલબાર લેંગ્વિજ’ કહે છે જ્યારે આ પુસ્તકને ‘ઈલસ્ક્રેશન્ઝ અવ ધ ગ્રેમેન્ટિકલ પાર્ટ્રિસ અવ ધ ગુજરાતી, મહરણ, એન્ડ ફિલિશ લેંગ્વિજિઝ’ કહે છે, એ પણ આપણે ધ્યાને લેવું જોઈ. લેખક પોતે જ્યારે જે પુસ્તકને ‘ગ્રેમર’ તરીકે ન ઓળખાવતા હોય ત્યારે આપણો એને ‘વ્યાકરણ’ તરીકે ખપાવવા ઉદ્યમ કરીએ તો એ આપણી નાદાન મુંઘતા કહેવાય.

નડિયાદ;  
૧૮ એપ્રિલ, ૨૦૧૬

હેમન્ટનાં વંદન  
9723113737

#### પાદનોંધ:

- આ પુસ્તકમાં ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાની કેટલીક વિગતોનાં કોષ્ટકો હોવા છતાં આપણા વિદ્ધાનો એને ‘ગુજરાતી વ્યાકરણ’ તરીકે જ જુઓ છે; એને આપણે નરરીસીવૃત્તિ કહીશું?
- ભગવાન પાણિનાં માહેશર સૂત્રોમાં તમામ વંજનોનો સમાવેશ ‘હલુ’ સંશામાં અને સર્વે સ્વરોનો નિર્દેશ ‘અચ્યુ’ સંશામાં થાય છે. બીજું, ડ્રમંડ ‘તિંનત’ને ‘તીગંત’ લખે છે.
- જોકે, ડ્રમંડ આ પુસ્તકની અર્પણપત્રિકામાં લખે છે કે, ‘the following pages, chiefly intended to assist the studies of his young countrymen [scil. the English] ... and also to encourage those liberal minded Natives who [...] aspire to learn our

language, are inscribed’.

૪ ડ્રમંડ વિશે કરેલાં લખાણોમાં દીપક મહેતાએ આ અત્યંત મહત્વના અનુવાદની કે એના ઐતિહાસિક મહત્વની કશી જ નોંધ નથી લીધી.

૫ અલબત્ત, અન્યત્ર આ વિગત નોંધાઈ છે, સર્ટો, દાંતો, નાયક (૧૮૭૧: ૧.૨૮૩; ૩.૧૮૨૭).

૬ વળી, આ નિબંધમાં ભાંડૂપવાલા બતાવે છે તેમ, જેમાં ગુજરાતી અક્ષરો પ્રથમ વાર પ્રયોગ્યા હોય એવું, આપણનું ‘પ્રથમ પુસ્તક’, આપણો અત્યાર સુધી માનતા આવ્યા છીએ તેમ, ૧૮૦૮માં પ્રકાશિત થયેલું ડ્રમંડનું ‘ગુજરાતી વ્યાકરણ’ નથી, પણ બહેરમજી છાપગારે છેક ૧૭૮૮માં પ્રકાશિત કરેલું ખુરદે અવસતા છે અને એની એક પ્રત લંડનની બિટિશ લાઇબ્રરીમાં સચવાઈ છે (સર્ટો ૨૦૧૪: ૧૬-૨૦).

#### સંદર્ભ:

નિર્વેદી, હર્ષવદ્ધન. ૨૦૧૫. ગુજરાતી વ્યાકરણવિચારના ઈતિહાસની આવકાર્ય દિશામાં. ઉર્મિ ઘનશ્યામ ટેસાઈ, ગુજરાતી વ્યાકરણનાં બસો વર્જ-નું અવલોકન. પ્રત્યક્ષ, જીવાન-સાયેન્સ, ૨૦૧૫, પૃષ્ઠ ૧૩-૩૨.

ધૂવ, કેશવ હર્ષદ ૧૮૮૮/૧૮૮૯. મુંધાવબોધાઓક્સિક, તદીય, દિવાન બહાદૂર કેશવલાલ હર્ષદરાય ધૂવ જંશોધન ગ્રંથમાળા, ગ્રંથ ૧, સાહિત્ય અને વિવેચન, પૃષ્ઠ ૨૫૨-૨૬૬. અમદાવાદ: ભો. જો. અધ્યયન-સંશોધન વિદ્યાભવન.

ભાંડૂપવાલા, મેહલી. ૨૦૧૪. અઢારભી સદીમાં ગુજરાતી છાપકામ. ક્ષાર્બસ ગુજરાતી સભા ટ્રેમ્યાસ્ક ૭૮ (૩): ૭-૩૩.

મહેતા, દીપક. ૨૦૧૫-અ. ગુજરાતી મુદ્રણ, ભાષા અને વિપિ. તદીય, ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર, પૃષ્ઠ ૧૩-૨૬. અમદાવાદ: રંગદ્વાર પ્રકાશન.

મહેતા દીપક, ૨૦૧૫-બ. ડ્રમંડનું વ્યાકરણ અનુવાદ?! પત્રચાર્ય. પ્રત્યક્ષ ૨૪ (૪): ૪૩.

મહેતા, દીપક. ૨૦૧૫-ક. પ્રથમ ગુજરાતી પુસ્તક, તદીય, ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર, પૃષ્ઠ ૮૨-૮૮. અમદાવાદ: રંગદ્વાર પ્રકાશન. (= તદીય, ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથમૃહિ, પૃષ્ઠ ૧૦-૧૮.)

જિનવિજ્યકુ ૧૮૫૭. ઉક્સિરલ્નાકર. જયપુર: રાજસ્થાન પુરાતત્ત્વાચેષણ મંદિર.

Dharamsey, Virchand. 2012. *Bhagwanlal Indraji: The First Indian Archaeologist: Multi-disciplinary Approaches to the study of the past*. Vadodara: Darshak Itihas Nidhi

Dhruba, H. H. 1893. *Mugdhabodhamauktika* In E.

- Delmar Morgan (ed.), *Transactions of the Ninth International Congress of Orientalists*, vol. 1, *Indian and Aryan Sections*, pp. 315-330. London: The Committee of the Congress.
- Drummond, Robert. 1799. *Grammar of the Malabar Language*. Bombay: Courier Printing Office.
- Drummond, Robert. 1808. *Illustrations of the Grammatical Parts of the Guzerattee, Mahratta & English Languages*. Bombay: Courier Press.
- Grierson, G. A. 1902. *The Mugdhabodhamauktika and Old Gujarati. The Journal of the Royal Asiatic Society*, July 1902, pp. 537-555.
- Hodiwala, Shahpurshah Hormasji. 1939/1994. *History of Indian Muslims* [Original title: *Studies in Indo-Muslim History*]: Critical Commentary on Eliot and Dowson's *History of India as Told by Its Own Historians*. New Delhi: Atlantic Publishers and Distributors.
- Naik, Bapurao S. 1971. *Typography of Devanagari*. 3 vols. Bombay: Directorate of Language.
- Schmidt, H. P. 1962. The sixteen Sanskrit ślokas of Ākā Adhyāru. *Bulletin of the Deccan College Research Institute* 21: 157-196.



## ૨. 'પ્રતિભાવક'ના રહસ્ય પરથી છેવટે પડદો ઉચ્ચકાયો

પ્રિય રમણભાઈ,

આપને વાદ હશે કે મેં થોડાં વર્ષો અગાઉ સુમન શાહના પુસ્તક સિદ્ધાન્ત ડિમ્બાની સમીક્ષા લખી હતી (જુઓ પ્રત્યક્ષ જુલાઈ-સપ્ટે. ૨૦૦૮). તેમાં અમુક મુદ્દે મારે તેમની ટીકા કરવાનો પણ પ્રસંગ આવ્યો હતો. ત્યાર બાદ ઉદ્દેશ સામયિક (જાન્યુ. ૨૦૧૦)માં 'પ્રતિભાવક' એવી સહીથી મારી સમીક્ષાને 'કીડળૂડ અને ડેળઘાલુ' ગણવી મારી ઉપર પસ્તાળ પાડતું અને સુમન શાહની વિદ્વત્તાની ભૂરી ભૂરી પ્રશંસા કરતું એક લખાણ આવ્યું હતું.

તમને, મને, મિત્રોને, અને ગુજરાતી સાહિત્ય તથા સુમન શાહથી વાકેફ સર્વ કોઈને ખાતરી હતી જ કે આ લખાણ સુમન શાહનું છે. છતાં, એ પત્રીના અંકમાં ઉદ્દેશના તંત્રી સ્વ. પ્રબોધ જોશીને તમે તથા બીજાં કેટલાંક વાચકોએ, અને મેં, એ લખનાર છચનપમધારી પ્રતિભાવક કોણ છે એ જાણવા, એ લેખકની અવિકૃત ઓળખ છાતી કરવાની માગણી કરી પણ તંત્રીએ કોઈ મચક આપી નહોતી. એ વાત તો ખેર પણી વીસરાઈ ગઈ.

થોડા વખત પહેલાં સુમન શાહનું નિર્બદ્ધપૂર્વક નામનું પુસ્તક (૨૦૧૧, પાર્શ્વ પ્રકાશન) મારા હાથમાં આવ્યું. કૂતુહલવશ મેં તેને ખોલીને જોયું તો તેમાં ઉપરોક્ત પ્રતિભાવકવાળો દેખ પણ જોવા મળ્યો! એ સાથે જ પ્રતિભાવક કોણ એ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો. ફંટાબાજ કુદરતના આ કરિશમાથી મને ખાતરી થઈ ગઈ છે કે સત્યને બહુ લાંબા સમય સુધી ઢાંકી રાખી શકતું નથી. વિંબના એ વાતની છે કે જે વાત ગુપ્ત રાખવા માટે સ્વ. પ્રબોધ જોશી આજીવન અડીભમ રવ્યા અને પોતાના લેખકની ગુપ્તતાના રક્ષણ માટે જગ્યાના તે વાત, હવે, એ 'પ્રતિભાવક'ને હાથે જ, બહાર આવી ગઈ છે. એ લખાણ સુમન શાહનું હતું એ વાત હવે અવિકૃત બની છે. જોકે એમના પોતાના જ પુસ્તકમાં એ લખાણ, એ લખાણ મૂળે પ્રતિભાવકની સહીથી લખાયું હતું એવી કોઈ સ્પષ્ટતા વિના જ, સમાવાયું છે.

આ પુસ્તક વાંચતા એ ધ્યાનમાં આવ્યા વિના રહેતું નથી કે 'કાલપુરુષ'ને 'સાહિત્યદેવતાની પ્રતિમા' સાથે ગાઢ intertextual સંબંધ છે અને 'વિવેચનની પ્રક્રિયા'ને વિવેચનના ઠિતર પ્રયોજનો સાથે પણ સંબંધ છે. આ બંને લેખો પહેલી વાર પ્રકાશિત થયા એ જીમાનામાં સુમન શાહના 'ખેવના' અને 'નિર્બદ્ધ' બન્ને કેટલાંક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા હતાં તે આજે પણ ઘણાંને વાદ હશે. (યુવાનોએ પોતાના વયવરિષ્ઠો પાસે વધુ માહિતી મેળવવી. કેમકે આ માત્ર ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન છે. તે પુસ્તકોમાં નહીં મળે. આજની ભાષામાં કહીએ તો encoded knowledge છે અને પાસવર્ડ વયવરિષ્ઠો પાસે છે.)

આ પુસ્તકમાં સુમન શાહ એક વેદાનીની ભૂમિકામાં જોવા મળે છે. કેટલાક લેખો તેમણે પોતાના આ જગતમાંના દરજા અંગે સતત સભાન રહીને લખ્યા છે તો સામયિકી નામના વિભાગમાં તેમનાં 'સ્વ.'નું વિગલન થઈ જાય છે, અને તેઓ પોતાના જ કર્તૃત્વને પોતાનાથી જ દૂર થઈને સાક્ષીભાવે જુઓ છે. શ્રી શાહે સામયિકી વિભાગનો ઉપયોગ જે રીતે કર્યો છે તે રસપ્રદ છે. તેનો અભ્યાસ કરતાં મેં નોંધ્યું કે આ કટારનો ઉપયોગ તેમણે પોતાના ટીકાકારનો તિરસ્કાર કરવા માટે તથા પ્રશંસકનો પુરસ્કાર કરવા માટે કર્યો છે. આ બંનેનાં ઉદાહરણો હું નીચે આપી રહ્યો છું.

સૌ પહેલાં ટીકાકારના તિરસ્કારનું ઉદાહરણ લઈએ –  
સામયિકી-૧માં સુમન શાહ લખે છે,

પ્રત્યક્ષ (જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૮)માં અમારું સવિશેષ ધ્યાન જેણાયું સુમન શાહના વિવેચનગ્રંથ સિદ્ધાન્તે કિમ્ભું? –ના હર્ષવદન વિવેદીના લખાણથી. આખું ચોકાવાનું લાગ્યું, કેમકે લેખકના કહેવાનો ઢૂંકસાર એ છે કે સુમન શાહ સિદ્ધાન્ત કથો સમજાયા જ નથી! એટલે તાબડતોબ લાઈબ્રેરીમાંથી અમે પુસ્તક લઈ આવ્યા. જોયું, તો ઉદેશની છે એવી ડબલ કાઉન સાઈઝનાં ૨૮૮ પાનાંનો એ ગ્રંથ છે ને અમાં ૪૨ લેખો છે. અમને સમજાયું કે ગ્રંથકાર સુમન શાહને લેખકે ખાસ કશી મહેનત લીધા તિના જ ઉત્તારી પાડ્યા છે’ (નિસ્બતપૂર્વક, પૃં ૩૧૭).

ત્યાર બાદ એમણે સ્વયં પોતાના ગ્રંથનું વિવેચન કર્યું જુઓ :

‘ଓરિસ્ટોટલ, મુનિ ભરત, લોન્ઝાઈનસનો ઉદાત્ત તત્ત્વવિચાર તથા સર્જકતા, ભાવકતા, ભાવન અને વિવેચન, કલા અને સાહિત્યકલા, સાહિત્યિક વાદ-વિચારણા, સાહિત્યસ્વરૂપ-સિદ્ધાન્ત, પણ્ચમની સાહિત્યવિવેચના, વિવેચનનાં વિવિધ સ્તરો, અવલોકન/સમીક્ષા, પ્રત્યક્ષ વિવેચન વગેરે વગેરે કઠિન વિષયો વિશેનાં સંકુલ છતાં સુગમ અનેક લેખોથી સમગ્ર ગ્રંથ સમૂક્ષ બની આવ્યો છે’ (એજન).

આ વાંચતાં આધ્યાત, આશ્ર્ય અને રમૂજ જેવી વૃત્તિઓ એકસાથે આવે પણ ઉપરનું લખાણ સુમન શાહે જાતે જ લાગ્યું છે. તેમની પાસે તેમના પોતાના ગ્રંથની નકલ ન હોવાથી તેઓ તાબડતોબ લાઈબ્રેરીમાં ગયા અને તેનાં કદન્-પાનાં-લેખોની સંખ્યા વગેરેની જાણ પણ તેમને એ પછી જ થઈ!

હવે સામયિકીમાં એમણે પોતાના પ્રશંસકનો કઈ હુદે પુરસ્કાર કર્યો છે તેનું ઉદાહરણ જોઈએ –

‘જ્યેશ ભોગાયતાનો ‘વિવેચક સુમન શાહ...’ લેખ એમના સમગ્ર વિવેચનકાર્યને ઊંડળમાં લેવા મયે છે (૨૫-૪૪). વિવેચકે ખરેખર શું કર્યું છે તે દર્શાવા લેખકે અનેક સ્થાને વિવેચકના જ શાબ્દોનો વિનિયોગ કર્યો છે. એ કાળજીનું મૂલ્ય છે. એ વિધાયક દસ્તિનું મૂલ્ય છે. કેમકે એથી વિવેચનાત્મક વિવેકનો ચોક્કસ પ્રારમ્ભ થતો હોય છે. દરેક વિવેચકનું આવું અધ્યયનનિષ્ઠ વાચન થવું જોઈએ. અનેકો વડે થવું જોઈએ. તો સંભવ છે કે વિવેચનને વગર

વાંચ્યે હુલ્લોધમાં ખપાવનારાઓની કટેવનો નાશ થાય. એ સત્યની પતીજ પણ પડે કે વિવેચન ગ્રામના ગોવાળો માટે નથી લખાતું. લેખકે વિવેચકની ‘પિસ્તાળીસ વર્ષ પર્યન્તની વિવેચનપ્રવૃત્તિ’ને ‘એક ઐતિહાસિક પ્રક્રિયા’ કહી છે તેમાં એમની વિવેચન વિશેની સૂઝભૂત્ત પરખાય છે. કેમકે કોઈ પણ સંનિષ્ઠ વિવેચકનું કાર્ય, કૃતિ, કર્તા સિદ્ધાન્ત પ્રત્યક્ષ વગેરે વાનાંના મેળથી સમ્બન્ધ થાય. તેમ છતાં, તે એક અવિરત પ્રક્રિયા હોય છે. વિવેચક સમગ્રને મુલવતી વખતે એ પ્રક્રિયાગત સંદર્ભની અવગણના ન કરાય. બાડી, વાક્યો કે તેના ગુચ્છ ચૂંટી તે પર મન ફૂરે તેવી ટીકાટિઘણી કરવાનું કામ ઘણું સહેલું ગણાય. પણ આ લેખકે એ પ્રક્રિયાપરક ઈતિહાસને નહીં ભૂલનાંદું અધ્યાત્મ કરી બતાવ્યું છે. એમના એ અભિગમનું સ્વાગત થવું જોઈએ (પૃં ૩૨૪).

પોતાના વિવેચનકાર્યનું મૂલ્યાંકન કરતા જ્યેશ ભોગાયતાના આ લેખ ઉપર જેટલા ઓવારી ગયા છે એટલા એમની ‘પિસ્તાળીસ વર્ષની’ કારકિર્દીમાં ભાગ્યે કોઈ લેખ, લેખક કે કૃતિ ઉપર ઓવાર્યા હોય. આ પુસ્તક સુમન શાહે બીજા કોઈને નહિં પણ જ્યેશ ભોગાયતાને અર્પણ કર્યું છે એ પણ યોગાનુયોગ જ હોય.

આ પુસ્તકમાં કેટલાક ‘ઐતિહાસિક’ કહેવાય એવા લેખો સંગ્રહાયા છે. વિવેચન અને વ્યવસાયના સંબંધ વિશે કે વિવેચનની વ્યાવહારિક નિસ્બત કઈ એ અંગે કોઈ જાણવા માગે તો તેને આ પુસ્તકમાંથી ઘણી સામગ્રી મળશે તેમ જ સાહિત્યના વ્યવહારું પ્રયોજન વિશે પણ એક નવી જ સૂઝ લાઘવો. અંગેજીમાં વિવિધ ક્ષેત્રોના unofficial history પણ લખાય છે. ગુજરાતી વિવેચનનો કોઈ આવો ઈતિહાસ લખવા માગશે તો પણ તેને આ પુસ્તક રીફર કર્યા વિના ચાલવાનું નથી. ‘વિવેચન’નો ઉપયોગ કારકિર્દીની બઢતી ‘પ્રક્રિયા’માં તો ખરો જ પણ ટીકાકારોની ટીકા કરવામાં અને પ્રશંસકોનો પુરસ્કાર કરવામાં પણ, પોતાનું નામ ગુપ્ત રાખીને, કેવી રીતે કરાય એ જાણવા માટે સુમન શાહના આ ગ્રંથનું વાચન અનિવાર્ય (!) બનશે.

અમદાવાદ;  
૨, મે ૨૦૧૬

હર્ષવદન નિવેદી  
9723555994

## સામયિક લેખ સૂચિ : ૨૦૧૫

‘નાટ્યસંગ્રહ/નાટક સમીક્ષા’થી ‘હાસ્યસાહિત્ય: સમીક્ષા’

### કિશોર વ્યાસ

આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.

૧. સૂચિની આધારસામગ્રી વેભ લીધેલાં સામયિકો : એતદ્વારા, કવિતા, કવિલોક, કંઠસંપદા, કુમાર, ગજલવિશ્વ, તથાપિ, તાદર્થ્ય, દાલિત ચેતના, ધબક, નવનીત સમર્પણા, નાટક, પરબ, પગદું, પરિવેશ, પ્રત્યક્ષ, શર્વસં ચાભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુજરી, વિવિધાસંચાર, શબ્દસર, શબ્દસૃષ્ટિ, શબ્દાલય, સંચિ, સમીપે, સંશોધન, સાર્થક, જલસો, સાહચર્ય અને હ્યાતી - કુલ ૩૦ સામયિકો.
૨. અડવા પાનમાં પ્રગટ થયેલા પુસ્તકપરિચયો, પુનઃપ્રકાશનો અહીં છોડી દીધા છે, તેમ પરિસંવાદોના અહેવાલોને બાકાત રાજ્યાં છે તથા પ્રાસારિક નોંધોને પણ અહીં લીધી નથી. -કિ.

### નાટ્યસંગ્રહ/નાટક સમીક્ષા :

અમે અહીંથી નહીં જઈએ (સતીશ વ્યાસ) -પ્રભુદાસ પટેલ, શબ્દસૃષ્ટિ, ડિસે., ૭૭-૮૧

અશ્વમેધ (ચિનુ મોઢી) - ભરત કાનાબાર, તાદર્થ્ય, જુલાઈ, ૩૩-૬

ઉમાશંકરનાં શૈખ નાટકો (ઉમાશંકર જોશી) - ભીખાભાઈ પટેલ, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૫-૭

ઈડિપ્સ (સોઝેક્ચિલ્સ) - મનોજ માલ્યાવંશી, તાદર્થ્ય, ડિસે., ૨૨-૮

કેકથી (રૂપાં. કનેયાલાલ ભટ્ટ) - નાટવર હેડાઉ, તાદર્થ્ય, નવે., ૩૭-૮

ઘોષયાત્રા (રાસવિહારી મણિયાર) - કેશુભાઈ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૩૨-૪

અન્નોન ચેહફનું નાટક : ત્રણ બહેનો - હસમુખ બારાડી, બુદ્ધિપ્રકાશ, મે, ૩૦-૪

મે ગંઢેવીનો ગલો (સતીશ વ્યાસ) - ચીમનલાલ બી. કોળી, શબ્દસર, સપ્ટે., ૩૫-૪૩

સુયોધન (હસમુખ બારાડી) - ધ્વનિલ પારેખ, પ્રત્યક્ષ, જાન્યુ-માર્ચ, ૧૭-૮

### નાટક અભ્યાસ :

અભિજ્ઞાનશાક્ષતલમાં પ્રકૃતિનિરૂપજા - હિલર કે. ભોઈ, પરિવેશ, એપ્રિલ-જુલાઈ, ૩૮-૪૧

કાબ્યનાટક - રંગમંચ પ્રસ્તુતિનું સુંદર કલાસંમિશ્રણ - રાજેશ્વરી પટેલ, શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર., ૭૪-૮૮

ગુજરાતમાં નાટ્યશિક્ષણ - માર્કન્ડ ભટ્ટ, નાટક, ઓક્ટો-ડિસે., ૬-૧૩

જીવનચરિત્રાત્મક નાટકોની નાટ્યાત્મકતા - હસમુખ બારાડી, કુમાર, મે, ૧૭-૮

પરિત્રાજા નાટકમાં કૃષ્ણ - શૈલેષ ટેવાડી, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૭૬-૮૬

બદ્ધલાંબ નેપથ્ય - પ્રવીણ પંડ્યા, પરબ, એપ્રિલ, ૫૧-૫

ભગવદજ્ઞકીયઃ અખૂટ હાસ્યરસનું નાટ્યાત્મક સ્વરૂપ - રાજીવી ઓઝા, શબ્દસર, માર્ચ, ૫૪-૮

ભાગવત આધ્યાત્મિક બે નાટકો “પહુલા રાજા (જગદીશચંદ્ર

માથુર), 'કથા એક કંસ કી (દ્વાપ્રકાશ સિંહા): એક અભ્યાસ – ધ્વનિલ પારેખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૬૪-૭

મધ્યમવ્યાયોગમાં પ્રયુક્ત આશીર્વચન – જાગૃતિ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૮-૩૨

શાકુન્તલાઃ જીવશિવની આધ્યાત્મિક ઘટનાની માનુષી નાટ્યકથા – આજિત ઠાકોર, પરબ, જૂન, ૨૮-૪૪

સારી રાત (બાદલ સરકાર, અનુ. પ્રતીભા અગ્રવાલ) અવિસ્મરણીય અનુભવ – હરીશ ખની, નવનીત સમર્પણા, જુલાઈ, ૪૬-૬

સંપત્ત ગુજરાતી રંગભૂમિ – ધ્વનિલ પારેખ, પરબ, ઓગસ્ટ, ૫૬-૬૬

### નિબંધસંગ્રહ સમીક્ષા :

અભાવોનું જૈથર્ય (ભગીરથ બ્રહ્માભદ્ર) – પ્રેમજ પટેલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૨૮-૩૧

ઇલેક્ટ્રિક ટ્રેન (ળિતા નાયક) – મોના વિયા, શબ્દસૃષ્ટિ, નવે., ૨૨૪-૨૮

– સેજલ શાહ, પ્રત્યક્ષ, જાન્યુ-માર્ચ, ૨૧-૪

કેન્દ્ર અને પરિવિષ્ટ (યશવંત શુક્લ) – દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૭-૮

છબિ ભીતરની (અચિન મહેતા) – અઝય રાવલ, શબ્દસર, ફેબ્રુ., ૩૧-૮

જગણું (નાટકરસિંહ પરમાર) – ટિવાન ફરહાના મહેમુદ્દા, પરિવેશ, એપ્રિલ-જુલાઈ, ૮૮-૮૦

– રમેશ ઓઝા, સમીપે, એપ્રિલ-જૂન, જુલાઈ-સપે., ૧૬-૧-૭૨

દૂરના એ સૂર (દિગ્દીશ મહેતા) – યશોધર રાવલ, બુદ્ધિપ્રકાશ, સપે., ૩૪-૬

ધરતીની આરતી (સ્વામી આનંદ) – નવિન પંડ્યા, પગલું, જુલાઈ-ઓગસ્ટ, ૨૧-૮

પવનવિદેહી (પણેશ દાદે) – મયંક કે. શાહ, તાદર્થી, ડિસે., ૩૭-૪૧

માણસ એ તો માણસ (પ્રકુલ્પ રાવલ) – રમેશ શાહ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૩૭-૮

રત્નિલાલ અનિલના નિબંધો (રત્નિલાલ અનિલ) – મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૧૩-૫

લખવૈયાગીરી (અસુણા જાહેજા) – પ્રતીભા શાહ, પરબ, જાન્યુ., ૬૦-૧

### ચિન્ત્ર સમીક્ષા :

અભિનયપંથે (આમૃત જાની) – વિનોદ જે. જાડા, પરબ, મે,

૭૨-૫

એ વર્ષો, એ હિવસો (પ્રાગજ્ઞભાઈ ભામ્ભી) – ઉત્પલ પટેલ, ઓગસ્ટ, ૭૨-૭

ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર (દીપક મહેતા) – પ્રકુલ્પ રાવલ, કુમાર, ઓગસ્ટ, ૪૬

કાબુલીવાલે કી બંગાલી બીવી (સુભિતા બંદોપાધ્યાય) – શરીરકા વીજળીવાળા, નવનીત સમર્પણ, જુલાઈ, ૮૧-૭

ધૂમવા દિનિંગટો (વિનોદ મેઘાણી) – સંધ્યા ભણ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૮૫-૭

છાંગ્યારૂકબ (બલવીર માધોપુરી) – કાન્તિ માતસતર, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૮૫-૮૪

જિંદગી એક સહર (પ્રદીપ પંડ્યા) – ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૨૫-૮

જીવતરની વાટે અક્ષરનો દીવો (કુમારપાળ દેસાઈ) – કિશોરસિંહ સોલંકી, શબ્દસર, જૂન, ૪૨-૮

– પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૨-૬

– પ્રકુલ્પ રાવલ, પરબ, ઓગસ્ટ, ૬૮-૭૨

– મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, ઓક્ટો., ૮૩-૫

– રજની વ્યાસ, નવનીત સમર્પણ, ડિસે., ૮૧-૪

– રાધેશ્યામ શર્મા, કુમાર, મે, ૪૪-૫

દાઈમકેચ્યૂલ (મોહનલાલ પટેલ) – દિનેશ દેસાઈ, કુમાર, માર્ચ, ૪૫-૮

તમે યાદ આવ્યાં (વિનોદ ભણ) – કીર્તિદા શાહ, પ્રત્યક્ષ, જાન્યુ-માર્ચ, ૧૬-૨૧

તરસી માટી (મણિલાલ હ. પટેલ) – ઉત્પલ પટેલ, શબ્દસૃષ્ટિ,

સપે., ૮૩-૮

દીકુ મેં (હસમુખ શાહ) – અઝય પાઠક, પરબ, એપ્રિલ, ૭૦-૪

દીઠે અદસાઈ જાત્ર (દર્શના ધોળકિયા) – કારમીરા મહેતા, પરબ, જાન્યુ., ૬૧-૨

દેવળાને જાપે (કિશોર વ્યાસ) – મયંક કે. શાહ, તાદર્થી, જુલાઈ, ૪૧-૩

ધ પિયાનિસ્ટ (વાલિસ્લોવ સ્પિલગેન, અનુ. અચિન ચંદ્રાશા)

– ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૨૪-૬

નવરસના માલમી: કાન્ચળ ભૂટા બારોટ (કૌશિકરાય જ. પંડ્યા) – ભીમજ ખાચરિયા, તાદર્થી, ઓક્ટો., ૧૫-૮

પરિચયપર્વ (દર્શના ધોળકિયા) – મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૧૫-૨૦

પુરુષાર્થનો પમરાટ (મહેશચંદ્ર જીવરામ પંડ્યા) – રસેશ

જમીનદાર, કુમાર, એપ્રિલ, ૪૮-૫૦  
 બજીતા જાયે એકતારા (વિહૃલારાય શ્રીમાળી) – વિનોદ ગાંધી,  
 દલિતચેતના, જાન્યુ., ૨૬-૩૧  
 મા'યલો ભીતર તો, જલે (સંકર પેન્ટર) – બી. કેશરશિવમુ,  
 બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૪૨-૪  
 મારી આનંદયા (ભગવાનદાસ પટેલ) – પ્રેમજી પટેલ,  
 શબ્દસૂચિ, ફેબ્રૂ., ૭૮-૮૬  
 મારી કથા (શુભમય ઘોષ, હિન્દી : રાહુલ બારપુતે, ગુજ.  
 દીપક રાવલ) તથાપિ, સાપે., નવે., ડિસે., ૬૬-૭૧  
 મારી લોકયત્રા (ભગવાનદાસ પટેલ) – જગદીશચંદ્ર ચ. પટેલ,  
 તાદ્ધર્ય, ઓક્ટો., ૩૦-૪  
     – બલભદ્રસિંહ રાઠોડ, શબ્દસર, સાપે., ૪૪-૮  
 રવીન્દ્ર: એક મેધધધનુષી વ્યક્તિત્વ (રિષ્ટિ પટેલ) – મધુસૂદન  
 પારેખ, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૫૨-૩  
 લમાણ (આત્મકથા) અને રૂપરેધ (સંસ્કરણો) શ્રીરામ લાગુ  
     – અરુણા જાડેજા, પ્રત્યક્ષ, જુલાઈ-સાપે., ૩૨-૭  
 વડફળિયું (ભિંશિલાલ રાનવેરિયા) – અરવિંદ વેગડા, હ્યાતી,  
 ડિસે., ૨૬-૩૫  
 વત્સલ અવિરત ટંકણાં (ભરત ના. ભક્ત) – ઈલા નાયક,  
 પરબ, જુલાઈ, ૭૭-૮૧  
 સત્યકથાઓ ભાગ: ૧/૨ (મુકુન્દરાય પારાશર્ણ) – મીનળ  
 દવ, પરબ, એપ્રિલ, ૩૮-૪૬  
 સંતોની છાયામાં (મ. જો. પટેલ) – ડંકેશ ઓળા, બુદ્ધિપ્રકાશ,  
 ઓક્ટો., ૪૮-૫૦  
 સંબંધોનું આકાશ (શરીરકી વીજળીવાળા) – જશુ પટેલ,  
 પરિવેશ, જાન્યુ-માર્ચ, ૭૫-૮  
 હું હીજડો... હું લક્ષ્મી (લક્ષ્મીનગરાયણ નિપાઈ) – રસીલા  
 કડીઆ, પરબ, જુલાઈ, ૨૩-૭

**ચાચિન અન્યાસ :**

અડધી રસ્તે અને નાટ્યકાર મુનશી – પના ત્રિવેદી, શબ્દસર,  
 ઓક્ટો., ૪૭-૫૦  
 અનંતરાય રાવળ – લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, માર્ચ,  
 ૧૨-૩  
 (સહદ્ય ધર્મના ઉપાસક) અનંતરાય રાવળ – દર્શના  
 ધોળકિયા, તથાપિ, સાપે-નવે., ડિસે-ફેબ્રૂ., ૬૦-૬  
 (કવિ)અમીર ખુસરો – મધુ કોઠારી, મોનોઝેમેજ, જુલાઈ,  
 ૧૬-૨૦  
 અમૃત ઘાયલ – ચીનુ મોદી, નવનીત સમર્પણ, સાપે., ૩૫-૮

અશોક હર્ષ – સંજ્ય પી. ઠક્કર, નવનીત સમર્પણ, ડિસે.,  
 ૧૦૧-૧૦૫  
 આત્મકથા નિમિત્તે પ્રગટ થતી વિચરતી જાતિઓની પીડા –  
 કાન્તિ માલસતર, હ્યાતી, સાપે., ૨૨-૮  
 આદિત મન્સૂરી – લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, સાપે.,  
 ૮-૮  
 ઈરાવતી કર્મ – પુ. લ. દેશપાંડે, અનુ. અરુણા જાડેજા, નવનીત  
 સમર્પણ, ફેબ્રૂ., ૧૦૭-૧૮  
 ઉમાશંકર જોશી – લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, મે,  
 ૮-૧૦  
 (કવિ) કલાપી – ૨જનીકુમાર પંડ્યા, કુમાર, એપ્રિલ, ૧૧-  
 ૩  
 કિશોર વ્યાસ – પ્રફુલ્લ રાવલ, કુમાર, ડિસે., ૪૮-૮  
 ગની દહીવાળા – ચિનુ મોદી, નવનીત સમર્પણ, ઓંગસ્ટ,  
 ૮૫-૭  
 ગુલામમોહમ્મદ શેખ – લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ,  
 નવે., ૮-૮  
 (વાર્તાકાર) ગ્રેનીયલ જેસીપોવીસ – સુરેશ શુક્લ, બુદ્ધિપ્રકાશ,  
 મે, ૪૨-૩  
 ચન્દ્રકાન્ત ટોપીવાળા – પરેશ નાયક, પરબ, ઓક્ટો., ૩૬-  
 ૪૦  
 ચન્દ્રવદન ચી. મહેતા – જ્યેમલ્લ પરમાર, નાટક, ઓક્ટો-  
 ડિસે., ૨૨  
     – હસમુખ બારાડી, નાટક, જુલાઈ-સાપે., ૨૦-૨  
     – એજ, તાદ્ધર્ય, ડિસે., ૧૮-૨૧  
 ચંદ્રકાન્ત શેઠ – લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, ફેબ્રૂ.,  
 ૮-૮  
 છેલભાઈ આશંકજી વાયડા – હની છાયા, નાટક, જાન્યુ-  
 માર્ચ, ૧૦-૨  
 જવાહેરલાલ હંડુ – બળવંત જાની, લોકગુજર્જરી, ડિસે., ૧-  
 ૭  
 જશાવંત ઠાકર – ઉષાબેન. મલજી, નાટક, ઓક્ટો-ડિસે., ૧૪-  
 ૬  
     – પ્રતીક પંડ્યા, કુમાર, મે, ૭-૧૧  
     – પ્રભાબેન પાઠક, માર્કન્ડ ભણ, વનલતા મહેતા, હની  
 છાયા, નાટક, જુલાઈ-સાપે., ૫-૧૩  
 જશાવંત ઠાકર સાથે નાટ્યસંવાદો – હસમુખ બારાડી, કુમાર,  
 નવે., ૧૨-૩, ડિસે., ૧૮-૮  
 (કથાસંવેદનાના સર્જક) જોસેફ મેકવાન – મહેશ બારોટ,

દિવિતચેતના, જાન્યુ, ૧૩-૫

ડાડા મેકરણ (કચ્છના સંતકવિ) - રાજેન્દ્ર બાંભણિયા, લોકગુર્જરી, સાએ, ૮૪-૧૦૨

તારક મહેતા - રત્નિલાલ બોરીસાગર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૪૬-૫૦

દિનેશ કોઠારી - લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, એપ્રિલ, ૮-૮

દૂદેશાય કારાણી (કચ્છી લોકસાહિત્ય અને ઈતિહાસના ઉદ્ઘાગતા) - હરેશ ધોળકિયા, લોકગુર્જરી, સાએ, ૮૨-૮૩ નલિન ચવળ - પ્રકુલ્પ રાવલ, કુમાર, જૂન, ૪૫-૬

નવી સદીના નવા ચરિત્રકારો - પ્રશાંત પટેલ, શબ્દસર, એપ્રિલ-મે, ૭૩-૮

નારાયણ દેસાઈ - શરીરા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૭-૩૦

પીટર બિક્સલ - રમણ સોની, નવે., ૩૫-૮

પૂર્જસત્ય (બી. કેશરાશિવમુ) અને ઉપરા (લક્ષ્મણ માને)માં વાતાવરણ - મિહિર સોલંકી, દિવિતચેતના, ઓગસ્ટ, ૨૨-૫

પૂર્જસત્ય (બી. કેશરાશિવમુ) અને ઉપરા (લક્ષ્મણ માને)માં સમાજદર્શન - મિહિર સોલંકી, હ્યાતી, સાએ., ૩૦-૩ પ્રબોધ જોશી - અરુણા જાડેજા, શબ્દસર, ફેબ્રુ., ૪૦-૫

ને હાર બાર-તેરનું ચારિત્ર સાહિત્ય - પ્રશાંત પટેલ, શબ્દસૃષ્ટિ, જૂન, ૬૮-૭૭

ભાવચંદ નેમાડે - અરુણા જાડેજા, કુમાર, સાએ, ૪૭-૮ - નલિની માડગાંઠકર, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૩૭-૪૧

મજ્જિલાલ દેસાઈ - લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, ઓગસ્ટ, ૮-૮

મનહર દીલદાર - ચિનુ મોટી, નવનીત સમર્પણ, જાન્યુ. ૧૦૦-૧૦૨

મનુભાઈ પંચોળી - રમેશ ર. દવે, કુમાર, જાન્યુ, ૭-૧૩ મન્થો જીવે છે (લે. નરેન્દ્રમોહન, અનુ. મોહન ઢાંડિકર) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૫૦-૧

મરીઝ - જલન માતરી, શબ્દાલય, ૨૪-૪૦

મો ધાન - હસમુખ ડે. રાવલ, પરબ, જાન્યુ, ૨૬-૩૨ મોહનભાઈ શંકરભાઈ પટેલ - ચિનુ મોટી, નવનીત સમર્પણ, ફેબ્રુ., ૬૮-૭૦

રધુવીર ચૌધરી - લાભશંકર ઠાકર, પરબ, ફેબ્રુ., ૫૧-૩ - લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, જુલાઈ, ૧૧-૨

રત્નિલાલ બોરીસાગર - નલિની દેસાઈ, કુમાર, જુલાઈ, ૫૦

રમેશ પારેખ - મનોહર ત્રિવેદી, શબ્દાલય, માર્ચ, ૩૨-૮

રણજિતરામ સુવર્ણચંદક વિજેતા શ્રેષ્ઠી - પ્રકુલ્પ રાવલ, બુદ્ધિપ્રકાશ, (અકારાદિ કમે) અમૃત ઘાયલ, જુલાઈ, ૪૮-૫૦, ગુણવંત શાહ, નવે., ઉધ્રેણ, ગુલાબદાસ બ્રોકર, ડિસે., ૩૧-૩, ધીરુભાઈ ટાકર, ઓગસ્ટ, ૩૨-૫, નગરીનદાસ પારેખ, એપ્રિલ, ૪૪-૬, બંકુલ ત્રિપાઠી, ફેબ્રુ., ૩૪-૭, ભોળાભાઈ પટેલ, સાએ, ૪૦-૨, યશવંત શુક્રલ, જૂન, ૩૫-૭, રમણલાલ નાગરજી મહેતા, મે, ૩૫-૬, રમણલાલ સોની, ઓક્ટો., ૪૫-૮, વિનોદ ભટ્ટ, માર્ચ, ૪૦-૨, સિતાંશુ યશચંદ મહેતા, જાન્યુ, ૩૫-૮

રાજેન્દ્ર શાહ - વિનોદ ભટ્ટ, નવનીત સમર્પણ, જાન્યુ, ૬૨-૬

રાધેશયામ શર્મા - લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, જાન્યુ, ૮-૮

રચણ પટેલ - લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, જૂન, ૧૦-૧

રંધના શાંતુ ઈન્દ્ર - નિર્જરી મહેતા, નવનીત સમર્પણ, એપ્રિલ, ૧૨૪-૨૮

રેણના અને ચેતના નિરૂપતી કેટલીક મરાઈ દિવિત આત્મકથાઓ - અતુલકુમાર પરમાર, હ્યાતી, માર્ચ, ૪૧-૫

શંકરભાઈ તડવી - બળવંત જાની, લોકગુર્જરી, જૂન, ૧-૭

શાંતિભાઈ આચાર્ય - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૧-૪

શિમોન દ બુવા - બી. એસ. નિમાવત, નવનીત સમર્પણ, ડિસે. ૫૬-૬૦

સુભાષ શાહ - લાભશંકર ઠાકર, નવનીત સમર્પણ, ઓક્ટો., ૧૧-૨

સૈફ પાલનપુરી - ચિનુ મોટી, નવનીત સમર્પણ, એપ્રિલ, ૮૫-૮

### પ્રવાસ સમીક્ષા :

ગોંડલ નરેશ ભગવતસિંહજનું દુંગલેંડ દર્શન (સં. મકરનદ મહેતા, રામજીભાઈ સાવલિયા) - યોગેશચંદ પટેલ, તાદર્થ્ય, જૂન, ૩૧-૭

-\* એજ, શબ્દસર, ડિસે, ૪૮-૫૫

વિદેશ મુજ મુખ ભમણ (જગાદીશ દવે) - વલલભ નાંડા, તાદર્થ્ય, જૂન, ૨૫-૩૦

હિમાલયનો પ્રવાસ (કાકાસાહેબ કાલેલકર) - સંદ્યા ભટ્ટ,

બુદ્ધિપ્રકાશ, ઓક્ટો, ૨૧-૪

### બાળસાહિત્ય સમીક્ષા/અભ્યાસ :

અમર બાલકથાઓ (સંપા. શ્રદ્ધા નિવેદી) – નટવર પટેલ,  
પરબ, માર્ચ, ૭૮-૮૧

ઓગજીસો એંસી પછીના ગુજરાતી બાળસાહિત્યમાં  
નારીસર્જકોનું યોગદાન – ઝાણિકેશ રાવલ, શબ્દસૃષ્ટિ, માર્ચ,  
૬૮-૭૩

ગુજરાતમાં સિંધી બાળસાહિત્ય – યશવન્ત મહેતા, બુદ્ધિપ્રકાશ,  
માર્ચ, ૨૫-૭

ગુજરાતી બાળસાહિત્ય સંદર્ભે નવી સર્વીની તાજી કલમો –  
વિપુલ પુરોહિત, શબ્દસર, એપ્રિલ-મે, ૮૦-૮૪

ગુજરાતી બાળસાહિત્યની ગતિવિધિ – દર્શની દાદાવાલા,  
શબ્દસૃષ્ટિ, નવે, ૧૬૬-૮૨

ગુલાબનું ફૂલ અને સપ્તરંગી વીરી તુખ્યા અંતાણી) – શ્રદ્ધા  
નિવેદી, પરબ, ફેબ્રુ, ૭૮-૮૧

ચાલો, રમીએ નાટક (સં. વર્ષી અડાલજા) – નટવર પટેલ,  
પરબ, ડિસે., ૭૦-૪

નવતર બાળવાર્તાઓ (યોરોફ મેકવાન) – રવીન્દ્ર અંધારિયા,  
બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૩૮-૪૦

બાલસાહિત્ય મંથન (યશવન્ત મહેતા) – રવીન્દ્ર અંધારિયા,  
પ્રત્યક્ષ, ઓક્ટો-ડિસે., ૧૩-૭

બાળવાર્તા સ્થાન નિમિત્રે નિર્ણયકનું આત્મનિવેદન (અને  
સાહિત્ય સમીક્ષા) – રવીન્દ્ર અંધારિયા, બુદ્ધિપ્રકાશ, જુલાઈ,  
૩૨-૭

બાળવાર્તામાં બાળકોની સામેલગીરી – જિતુ નિવેદી, શબ્દસર,  
ઓક્ટો, ૨૮-૮

બાળસાહિત્ય દ્વારા વૈજ્ઞાનિક અભિગમની કેળવણી – યશવન્ત  
મહેતા, બુદ્ધિપ્રકાશ, મે, ૪૪-૭

મેઘાઙીની બાળકવિતા નારીબોધના સંદર્ભે – નિવ્યા પટેલ,  
બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૨૫-૮

રમણલાલ સોનીની શ્રેષ્ઠ વાર્તાઓ, (સં. યશવન્ત મહેતા, શ્રદ્ધા  
નિવેદી) – ઈશ્વર પરમાર, પરબ, સાપે., ૭૮-૮૦

રસદાર બાલકશોરવાતાર્થો (રવીન્દ્ર અંધારિયા) – ગંગીરસિંહ  
ગોહિલ, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૪૬-૭

રાજેન્ડ શાહનાં બાળકાંઓ – નટવર પટેલ, તાદર્થ્ય, સાપે.,  
૩૭-૪૫

-\* એજ, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૩૪-૮

રે વાહ! (જિતુ નિવેદી) – જલાલ મસ્તાન 'જલાલ', કવિલોક,  
મે-જૂન, ૩૮-૮

હું હોઉં જો જાહુગર (ધર્મન્દ્ર પટેલ) – નટવર હેડાઉ,  
બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૫૪

### હાસ્યસાહિત્ય સમીક્ષા :

ઊં હાસ્યમ (રતિલાલ બોરીસાગર) – સુધા પટેલ, પરિવેશ,  
જાન્યુ-માર્ચ, ૫૨-૩

તમે યાદ આવ્યા! (વિનોદ ભક્ત) – ધીરુ પરીખ, કુમાર, મે,  
૪૩

પ્રપંચતં (નવનીત સેવક) – પ્રકુલ્પ રાવલ, તાદર્થ્ય, સાપે.,  
૪૬-૫૦

બાપાનું બારમું (દશરથ પટેલ) – રતિલાલ બોરીસાગર, પરબ,  
માર્ચ, ૫૪-૮

હાસ્યકલરવ (પ્રદ્યુમન આચાર્ય) – રમેશ પટેલ 'ક્ષ', પ્રત્યક્ષ,  
ઓક્ટો-ડિસે., ૮-૧૦

(કમશઃ)

### સદ્ગત બાબુ દાવલપુરા

મુખ્યત્વે કથાસાહિત્યનું વિવેચન-સંપાદન આપનાર બાબુ દાવલપુરા – બાબુભાઈ પટેલ (૪૦ ૧, નવેમ્બર  
૧૯૭૦)નું અવસાન (જૂન ૨૦૧૬) થતાં એક નિત્ય સ્વાધ્યાયી અધ્યાપક વિદ્યાપત્ર પાણ્યા. 'પ્રતિસ્પંદ'  
(૧૯૭૭) વિવેચનસંગ્રહી શરૂ થયેલી એમની વિવેચનપ્રવૃત્તિ 'મુનશીનાં ઐતિહાસિક-પૌરાણિક નાટકો'  
એ શોધગ્રંથ તેમજ 'ગુજરાતી કથાવિશ્ચ' નામે, ગુજરાતી નવલકથાઓ પરનાં વિવેચનવેખોના સંપાદન  
વર્ગેરેમાં વિસ્તરી હતી.

પ્રા. દાવલપુરાને સ્નેહાંજલિ

## પરિચय-મિત્રાક્ષરી

સ્વીકાર-સમીક્ષા માટે પ્રકાશકો/લેખકોએ મોકલેલાં તથા સંપાદકે નવાં ખરીદેલાં પુસ્તકોની પરિચયનોંધ

### કવિતા

પિલ્જિકા - નગરીનંદ્ય ડોડિયા. જાસ્તુદ પ્રકાશન, મહેસ્સાણા,  
૨૦૧૬, રે. ૮૮, રૂ. ૨૦૦ □ કાબ્યો

બનારસ ડાયરી - હરીશ મીનાશ્રુ. ગૂર્જર, અમદાવાદ,  
૨૦૧૬, રે. ૧૩૬, રૂ. ૧૭૦ □ કાબ્યો

મંત્રોચ્ચાર - કનૈયાલાલ ભંડ. જાહીનવી પ્રકાશન,  
ગાંધીનગર, ૨૦૧૫, રે. ૧૬૦, રૂ. ૩૩૦ □ કાબ્યો

મૌન સંમતિ લક્ષ્ણભૂ - પ્રભુ પણડપુરી. પ્ર. હસમુખ પટેલ,  
અમદાવાદ, ૨૦૧૬, રે. ૭૨, રૂ. ૮૦ □ કાબ્યો

યદ્યા તદ્યા ગળા - સ્નેહી પરમાર. દર્શક ફાઉન્ડેશન,  
૨૦૧૫, વિતરક રંગદ્વાર, અમદાવાદ, રે. ૮૬, રૂ. ૭૦  
□ ગળબકાવ્યો

વહેચાતી દીવાલો - પ્રભુ પણડપુરી. મુ. રોહિત એસ. પટેલ,  
ધનસુરા, ૨૦૧૬. પ્રાપ્તિ. ગૂર્જર. રે. ૧૮૮, રૂ. ૧૫૦ □  
કાબ્યો

વસ્તુપર્વ - રાજેન્દ્ર પટેલ. બુકપબ, અમદાવાદ, ૨૦૧૬.  
રે. ૮૬, રૂ. ૧૦૦ □ પૂર્વકાવ્યસંગ્રહોમાંથી સ્વ-સંચિત  
કાબ્યરચનાઓ

વૃદ્ધશતક - કમલ વોરા. ક્રિતિજ પ્રકાશન, મુંબઈ, ૨૦૧૫.  
પૃ. ૧૧૦, રૂ. ૧૫૦ □ કાબ્યો

સુભાષિત-સૌરભ - કુલીનંદ્ય મો. યાણીક. ગૂર્જર, અમદાવાદ,  
૨૦૧૫, પૃ. ૨૦૮, રૂ. ૩૦૦ □ સંસ્કૃત સુભાષિતો -  
સમશ્લોકી અનુવાદ, અર્થ-અન્તય અને ગંધાનુવાદ સાથે

હદ્યલિપિ - ભારતી રાણો. ગૂર્જર, અમદાવાદ, ૨૦૧૬.  
ડબલ કાઉન ૧૩૨, રૂ. ૪૦૦ □ ‘જીવનલક્ષી સંવેદનનાં  
કાબ્યો’, પ્રત્યેક પાને ફોટોગ્રાફ સાથે.

### વાર્તા

ઝોબામાં દરિયો - રેખાબા સરવૈયા. ગૂર્જર, અમદાવાદ,  
૨૦૧૬. રે. ૧૫૨, રૂ. ૧૫૦ □ લઘુકથાઓ

પડ્થારો - ગોરધન ભેસાણિયા. લટૂર પ્રકાશન, ભાવનગર,  
૨૦૧૫, પૃ. ૧૫૬, રૂ. ૧૮૦ □ વાર્તાઓ

પવનકુમારી - પ્રવીષાસિંહ ચાવડા. લજા પલ્લિકેશન,  
વલ્લભ વિદ્યાનગર, ૨૦૧૫, રે. ૨૨૪, રૂ. ૨૪૦ □  
વાર્તાઓ

### નિબંધ, ચરિત્ર, પ્રવાસ આદિ

આપણા ઋષિઓ - જિતેન્દ્ર પટેલ. પાર્શ્વ, અમદાવાદ,  
૨૦૧૬, રે. ૧૪૦, રૂ. ૧૨૫ □ ચરિત્રો

ઉમાશંકર મારા આભલામાં - ધીરેન્દ્ર મહેતા. ઈમેજ, મુંબઈ-  
અમદાવાદ, ૨૦૧૬. રે. ૧૧૪, રૂ. ૧૨૫ □ ઉમાશંકર  
વિશે ચરિત્રલેખો, ઉમાશંકરનાં પુસ્તકો વિશે લેખો

કોના બાપની હોળી! - નિરંજન ત્રિવેદી. સંસ્કાર સાહિત્ય  
મંદિર, અમદાવાદ, ૨૦૧૬, પ્રાપ્તિ. ગૂર્જર. રે. ૧૮૨, રૂ.  
૨૦૦ □ હાસ્યલેખો

ચંદ્રકાન્ત શેઠના પ્રતિનિધિ નિબંધો - સંપા. સતીશ ઉણાક.  
આદર્શ, અમદાવાદ, ૨૦૧૬, રે. ૮૬, રૂ. ૧૦૦ □

સંચિત નિબંધો, સંપાદકીય લેખ સાથે  
પત્રજરણું – ભુવનચંદ્ર મહારાજ ‘ચિન્મય’. શ્રી પાર્શ્વચંદ્ર  
પ્રકાશન સમિતિ, નાની ખાખર; કચ્છ, ૨૦૧૬. પૃ. ૧૯૨,  
૩૬૦ ડાયિટ વ્યક્તિઓને પત્રો  
પત્ર-લાભ – સંપા. રમણીક સોમેશ્વર. રનાદે, અમદાવાદ,  
૨૦૧૬. ડે. ૧૧૮, રૂ. ૧૨૫ ડાયિટ લાભશંકર ઠાકરના લેખક  
પત્રના પત્રો

પ્રવાસી રવીન્દ્રનાથ – સંપા. અનુ. અનિલા દલાલ. સાહિત્ય  
અકાડેમી, દિલ્હી, ૨૦૧૪. ડે. ૧૬૮, રૂ. ૧૪૦ ડાયિટ  
રવીન્દ્રનાથના વિવિધ પ્રવાસ-અનુભવો, નિબંધો-પત્રો રૂપે  
મારી પ્રવાસનોંધ – ઉર્વી તેવાર. પ્રકા. લેખક, વડોદરા,  
૨૦૧૫. ડે. ૬૪, રૂ. ૧૦૦ ડાયિટ પ્રવાસ-આદેખન

સંતકવિશ્રી ભાજસાહેબ – નરેત્તમ પલાણ. દર્શન પ્રકાશન,  
પોરબંદર, ૨૦૧૬. ડે. ૮૦, રૂ. ૧૦૦ ડાયિટ

### વિવેચન, સંશોધન

ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ : પ્રવાહો અને પ્રયોગો –  
વિનાયક જાદવ. પ્રકા. લેખક, અમદાવાદ, ૨૦૧૫, ડે.  
૪૨૨, રૂ. ૪૫૦ ડાયિટ સંશોધન

પ્રચેતસ – અરુણ કક્કડ. રોયલ બુક કંપની, રાજકોટ,  
૨૦૧૫. ડે. ૨૭૨, રૂ. ૨૭૫ ડાયિટ વિવેચનલેખો

Narasinha Mehta of Gujarat – નીલિમા શુક્રલ ભણ.  
ઓક્સફર્ડ, યુનિવર્સિટી પ્રેસ, ન્યૂ યૉર્ક, ૨૦૧૫. ડે. ૦૦૦  
ડાયિટ નરસિંહ ની કવિતા અને સંતધારા વિશેનું અધ્યયન  
વાર્તા વાંચવાનું શાસ્ત્ર – અનુપમ ભણ. પ્રકા. લેખક,  
શાંતિનગર, ભાવનગર, ૨૦૧૬, ડે. ૨૮૮, રૂ. ૧૯૦ ડાયિટ  
કથાસાહિત્ય વિશેના અભ્યાસલેખો

### ભાષાવિજ્ઞાન, કોશ

ગુજરાતી ભાષાના અર્વાચીન ધ્વનિતી-ધ્વનિ વિજ્ઞાનનું વૈજ્ઞાનિક

અધ્યયન – મગન પટેલ, ભગીરથ બ્રહ્મભણ. સ. ૫.  
યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ૨૦૧૫, ડે. ૧૯૦, રૂ. ૫૦૦

ડાયિટ ભાષાવિજ્ઞાન-વિષયક પુસ્તક

ગુજરાતી બ્યુત્પત્તિ કોશ – સંપા. કે. કા. શાસત્રી. આદર્શ,  
અમદાવાદ, બીજી આ. ૨૦૧૫. કા. ૧૯૨, રૂ. ૧૫૦ ડાયિટ  
કોશ

**શેષ-વિશેષ:** અધ્યયન ગ્રંથો, માહિતીગ્રંથો

સાહિત્ય સંલગ્ન અને અન્ય વિષયો પરના ગ્રંથો

કેરલ યાત્રાપ્રવાસ – નાગરભાઈ સોલંકી. પ્રકા. લેખક,  
સુરેન્દ્રનગર, ૨૦૧૬, પ્રાપ્તિ. ગૂર્જર, ડે. ૧૩૬, રૂ. ૧૬૦  
ડાયિટ પ્રવાસ-માહિતી

પ્રતિબિંબ – ભાવાનુવાદ ઉપાધ્યાય ભુવનચંદ્ર. પાર્શ્વચંદ્ર  
પ્રકાશન સમિતિ, નાની ખાખર, કચ્છ, ૨૦૧૬. ડે. ૫૦  
ડાયિટ સોતોમાંના પ્રાકૃત શ્લોકોના ભાવાનુવાદ, કેટલાંક  
કચ્છી પુસ્તકોના અંગેજી ભાવાનુવાદ

ભારતના રાજવંશો – જિતેન્દ્ર પટેલ. પાર્શ્વ, અમદાવાદ,  
૨૦૧૬, ડે. ૩૪૨, રૂ. ૩૦૦ ડાયિટ ઇતિહાસના રાજવંશો વિશે  
દૂંકી માહિતી આપતાં લખાણો

ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ – સંપા. પ્રકાશ ન.  
શાહ વગેરે. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૧૬,  
ડે. ૫૬૨, રૂ. ૫૨૫ ડાયિટ ભોગીલાલ ગાંધીના ગ્રંથો વિશે વિવેચન, તથા એમને  
વિશેનાં સંસ્મરણો

વહીવટની વાતો – કુલીનચંદ્ર યાણિક. દર્શક ઇતિહાસનિધિ,  
વડોદરા, ૨૦૧૬. વિતરક રંગદ્વાર અમદાવાદ, ડે. ૪૦૮,  
રૂ. ૪૦૦ ડાયિટ સરકારી સેવાનાં સંભારણાં

શિક્ષણના સામ્રાત્પ્ર પ્રવાહો – મૌતીભાઈ મ. પટેલ. અવનિકા  
પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૬. ડે. ૨૨૪, રૂ. ૨૦૦ ડાયિટ  
લેખો

